

\* આપણદરમણી ભર્તેલી શાળગંગાને વહેવાદવારા અને કૃતાને શાપ્તિ

\* देवरा अदितीय चंद्र, भगवान् चंद्रपत्र जिनने नमस्कार

ભગવાન ચંદ્રપ્રેભુ પૂર્વ શ્રીવર્ણિનાભવમાં સમ્યકૃત્વ પામ્યા, ત્યારથી શરૂ કરીને, કેવળજ્ઞાન પ્રામ્યી તીર્થકર થયા ત્યાં, સુધીના સાત ભવોનું આ મંગલ પુરાણ છે.

૧. શ્રી વર્મા રોજા : ઇસમંકૃતવિની પ્રાપ્તિઃ નિઃબુદ્ધિભવ (પૂર્વભવ છકી) એવું હોય  
૨. પ્રથમ સ્વર્ગમાં દેવ..... (પૂર્વભવ પાંચમો)

3. અંજિતસેન ચકવતી, મુનિદીક્ષા..... (પૂર્વભવ ચોથો)

૪. સોળમા સર્વમાં અચ્યતા-ઈન્ડિકેશન (પૂર્બભવ ગીજો) વાટાનું જીવન હૈ

સાચા-પદ્મનાભદી-ધીક્ષા-તીર્થકરપ્રકૃતિએ પ્ર.(પૂર્વલખ, બીજો) હિતાય

वैज्यन्-विभानम् अहमिद्धि (पूर्वभवेष्टित्वा) ८५ प्रा. ३।

୭ ଯନ୍ତ୍ରପ୍ରେସରୀ(କାଶି)ମୁଣ୍ଡ ଯନ୍ତ୍ରପ୍ରେସରୀ-ନିର୍ମିକରନୀ ଅଧିକାର ଅନେ ମୋକ୍ଷ.

અને એવા વિષયોની જાહેરી કરી શકતાં આપણું એવી વિષયોની જાહેરી કરી શકતાં આપણું

હવે તેવી મંગલ કશ્ય આપ વાંચશો

A decorative separator consisting of two stylized floral or star-like symbols facing each other, with a horizontal line extending from the right symbol.

## ભગવાન ચંદ્રમલ : પૂર્વભવ : મહારાજા પદ્મનાભ

ધાતકી ખંડના વિદેહક્ષેત્રમાં રતસંચયપુર નામનું નગર છે. સમ્યગદર્શનાદિ ઉત્તમ રતોથી વિભૂષિત એવા સજીજન પુરુષો વડે તે નગરીની અદ્ભુત શોભા છે. ત્યાં સદાચારી શ્રાવકો ઉત્તમ જૈનધર્મનું પાલન કરીને સ્વર્ગમાં કે મોક્ષમાં જ જતા હતા. ‘અરે, સ્વર્ગમાં તો શું છે! તે તો અહીં જેવું જ છે’ તેમ વિચારીને ત્યાંના સમ્યગદર્શિ જીવો મોક્ષને માટે જ ધર્મસાધન કરતા હતા, સ્વર્ગની ઈચ્છાથી નહિ.

તે રતસંચયપુરીના રાજા કનકપ્રભ, અને રાણી સુવર્ણમાલા; તેરે પદ્મનાભ નામનો પુત્ર છે. આ પદ્મનાભ તે જ આપણા ચરિત્રનાયક શ્રી ચંદ્રપ્રભનો જીવ છે. (પદ્મનાભ તે તેઓ બીજો પૂર્વભવ છે.)

એકવાર રાજા કનકપ્રભ રાજમહેલની અગાશીમાં બેઠા બેઠા નગરીનું અવલોકન કરતા હતા. એવામાં તેમણે જોયું કે, એક બુદ્ધાંશુ બળદ ઊંડા કાદવમાં ખૂંચી ગયો છે, ને તરફડીને મરે છે. તે દેખીને તે રાજને વૈરાગ્ય જાગ્યો અને વિચારવા લાગ્યા કે અરે! હજુ પણ હું આ સંસારના મોહ-કીચડમાં ખૂંચી રહ્યો છું. મેં જિનાગમ જાણ્યા છે, ઉત્તમ સાધુઓની સંગતિ કરી છે ને સંસારને અસાર જાણ્યો છે; તો હવે હું આ ઈન્દ્રિયસુખોમાં ક્યાં સુધી આસક્ત રહીશ? આમ વિચાર કરતાં તે ધર્મત્ત્વા કનકરાજા સંસારસુખોથી અત્યંત વૈરાગ્ય પામ્યા ને તેમનું ચિત્ત મુનિમાર્ગમાં પ્રવેશ્યું. જાણો કે મુક્તિના દૂતે આવીને ગુપ્તપણે તેમના કાનમાં મુનિ થવાનું કહું હોય! તરત તેમણે પોતાના પુત્ર પદ્મનાભને રાજ્ય સૌંપીને, શ્રીધર મુનિરાજની સમીપે મુનિદીક્ષા ગ્રહણ કરી.

હવે તે રતસંચયપુરીનું રાજ્ય આપણા ચરિત્રનાયક ધર્મત્ત્વા પદ્મનાભે સંભાળ્યું. એક દિવસની વાત છે : રાજા પદ્મનાભ રાજસભામાં બેઠા છે; ત્યાં ભાગીએ આવીને હર્ષપૂર્વક વધામણી આપી કે-હે સ્વામી! મનોહર બાગમાં શ્રીધરમુનિરાજ પદ્માર્થ છે; તેમની મુદ્રા અત્યંત શાંત ને તેજસ્વી છે; તેમના આગમનથી આખું વન પ્રકૃતલ થઈને હસી રહ્યું હોય તેમ ખીલી ઊઠ્યું છે. હરણ ને સિંહ, વાધ ને હાથી, સર્પ ને મોર જેવા પશુપંખીઓ પણ વેરભાવ છોડીને શાંતિથી મુનિરાજની ચરણછાયામાં હળીમળીને મિત્રતાથી બેઠા છે....

—આ રીતે શ્રીધરમુનિરાજની પદ્મરામણીના સમાચાર સાંભળતાં વેંટ, રાજા પદ્મનાભના હૃદયમાં હરખનો સમુદ્ર ઊછલ્યો; ખુશી થઈને તેણે પોતાનો રતાંધાર માળીને હન્પમમાં આપ્યો. ‘અહા, જેમના દર્શન માટે મારે પોતે જવાનું હતું તે ભગવાન પોતે મારા આંગણે પદ્માર્થી’ એમ કહીને તરત જ તે મુનિરાજના સાક્ષાત્ દર્શન-વંદન કરવા ચાલ્યા.

રાજા પદ્મનાભ, મુનિરાજ સમીપ આવી જ્યુજ્યુકાર-પૂર્વક વંદન કરીને બેઠા. મુનિરાજના દર્શનથી તેને ઘણી પ્રસંગતા થઈ. મુનિરાજે તેને ધર્મના આશીર્વાદ આપ્યા.

રાજાએ વિનયપૂર્વક તત્ત્વના ઉપદેશ માટે પ્રાર્થના કરીઃ હે સ્વામી! આજકાલ અનેક લોકો નાસ્તિક બની રહ્યા છે, જીવના અસ્તિત્વને તેઓ જાણતા નથી, માટે આપશ્રી યુક્તિપૂર્વક જીવના અસ્તિત્વની સિદ્ધિ કરીને સમજાવો...જેથી જીવોનું કલ્યાણ થાય; કેમકે જીવનું અસ્તિત્વ સિદ્ધ હોય તો જ ધર્મ અને મોક્ષની સિદ્ધિ થાય.

શ્રી મુનિરાજે કહ્યું : હે બુદ્ધિમાન રાજન્! તે સુદર પ્રેર્ણ પૂછ્યો. સાંભળ! હું જીવની સત્તા સિદ્ધ કરીને બતાવું છું.—

‘જીવ નથી’ એ વાત પ્રત્યક્ષાદિ પ્રમાણોથી ખંડિત છે.

‘જીવ દેખાતો નથી માટે નથી’ એમ કહેલું તે તો મૂર્ખતા છે. ‘આ મફાન વગેરે બધાને હું દેખ્યું છું’—એમ કોણ કહે છે?—દેખનારો જે વિદ્યમાન છે તે જ એમ કહે છે કે ‘હું દેખ્યું છું’—માટે જીવ વિદ્યમાન છે.

ગમે તેવા અંધારામાં પણ જીવ કહે છે કે ‘હું અહીં વિદ્યમાન છું’—એમ પોતે સ્વસંવેદનથી પોતાના અસ્તિત્વને પ્રસ્તિદ્ધ કરે છે, તે જ જીવ છે. ‘હું છું’ એવું વેદન જીવમાં થાય છે, શરીરમાં નહીં.

શરીરના હાથ—પગ વગેરે અવયવ કપાઈ જાય છતાં જ્ઞાન કપાઈ જતું નથી, ઓછું થઈ જતું નથી; તેથી સિદ્ધ થાય છે કે ચેતનસત્તા દેહથી જુદી છે,—જેના આધારે જ્ઞાન રહેલું છે. જ્ઞાન જો શરીરના આધારે હોત તો શરીર કપાઈ જતાં જ્ઞાન પણ કપાઈ જાત.

જગત્તમાં જેટલા પ્રાણીઓ છે તે (માણસ; હાથી, સિંહ, કીઝી, વગેરે), બધાયમાં ‘જીવ’નું હોવાપણું સ્વસંવેદન—પ્રત્યક્ષ વડે સિદ્ધ છે, કેમકે ‘હું સુખી છું હું દુઃખી છું’ એવું સુખ—દુઃખનું વેદન (જ્ઞાન) દરેક જંતુને થાય છે. જીવ વગર સુખ—દુઃખનું વેદન કોણ કરે? સ્વને તેમજ પરને જાણો એવો જ્ઞાનનો સ્વભાવ છે, ને એવો જે જ્ઞાનસ્વભાવ છે તે જ જીવસત્તા છે.

આ પ્રમાણે મુનિરાજે જ્ઞાનલક્ષણ દ્વારા જીવના અસ્તિત્વને સિદ્ધ કરીને કહું : હે રાજા! જીવના આવા અસ્તિત્વને, જે જાણો છે તે સ્વર્ગ—નરકાદિ પરભવને સ્વીકારે છે, એટલે તે પાપથી ઉરે છે ને ધર્મને સેરે છે.

દેહથી બિન્ન જીવની સિદ્ધ કરતાં મુનિરાજ કહે છે—અચેતન શરીરથી જીવ જુદી છે; શરીર તો એવું ને એવું હોય છતાં જીવમાં વિકાર (દુઃખ, કોધ વગેરે) થતાં જોવામાં આવે છે; તેમજ શરીરમાં રોગાદિ વિકાર થવા છતાં કે તે સળગવા છતાં જીવના ચિત્તમાં શાંતિ રહી શકે છે; આ રીતે જીવ અને શરીરનાં કાયો (ધમો) બિન્ન—બિન્ન છે. વળી હે રાજન્ન! શરીરની ચેષ્ટાઓ તો આંખથી દેખાય છે, પણ આત્માના ભાવો આંખથી દેખાતાં નથી—એ રીતે બંન્નેના ધમો (મૂર્ત્પણ ને અમૂર્તપણ) જુદા છે.

આ રીતે શ્રીધરમુનિરાજે સ્વસંવેદન—પ્રત્યક્ષથી—તેમ જ અનુમાન વડે ચેતનસ્વરૂપ જીવનું અનાદિઅનંત અસ્તિત્વ સિદ્ધ કરીને સમજાવ્યું; દરેક જીવ પોતે એવો અનુભવ કરે છે કે પાપ—પુણ્ય દુઃખ—સુખનું વગરે રૂપે પોતાના ભાવો સંદ્યા પેલટાયા કરે છે, અને આ બદલંતી અવસ્થા દ્વારા તે ધર્મને અને મોક્ષને સાધી શકે છે. આ રીતે નિત્ય—અનિત્ય (ગુણ—પરયિ) સ્વરૂપ જીવતત્ત્વમાં જ બંધ—મોક્ષાની સિદ્ધ થાય છે. જીવ—સર્વથાં અકર્તૃ કે અપણિણામી નથી—તિચારવા જેવી વાતાં છે કે ‘જીવ’ જો ભલા—ભૂરા કાયોને (શુભ—અશુભ ભાવોને) ન કરે તો તેને પુણ્યપણ્ય કે મોક્ષનો ઉપાય (ધમ) પણ તે શા માટે કરે? જીવની દ્યાહિ શુભકાયો વડે પુણ્યબંધ કરે છે ને હિંસાદિ અશુભ કાર્યકરે પાપનો બંધ કરે છે; વીતરાગભાવરૂપ ધર્મ વડે તે બંધને છેદીને મોક્ષને કરે છે. આ રીતે જીવ પોતાના ભાવનો કર્ત્તા, થાય છે ને તેના, જ્ઞાનો (દુઃખ—સુખનો) પોતે જ ભોક્તા થાય છે.

જીવને બંધન કે મુક્તિ જો કોઈ બીજો કરે, તો તેનું ફળ પણ આત્મા કેમ બોગવે? જીવ પોતે જ પોતાના બંધ-મોક્ષને કરે છે ને પોતે જ તેના ફળને બોગવે છે; જ્યારે રત્નત્રયરૂપ શુદ્ધ ભાવને કરે છે ત્યારે તે રાગાદ વિભાવનો અકર્ત્વ થાય છે,—પણ સર્વથા અકર્ત્વ નથી, આવું સ્વતંત્ર સ્વયંસિદ્ધ જીવતાચ છે ને તે પોતાના અંતરંગ સ્વસંવેદનની અનુભવગોચર થાય છે.

શ્રી મુનિરાજના ઉપદેશથી રાજા પદનાભને તેમજ સભાજનોને અત્યંત પ્રસરતા થઈ; ઘડા જીવો જીવતાચને અનુભવગોચર કરીને સમ્યગદર્શન ને સમ્યગજ્ઞાન પામ્યા.

ત્યારબાદ સર્વજ્ઞતાની સિદ્ધિ કરતાં મુનિરાજે કહું કે—સર્વજ્ઞતારૂપ મોક્ષપદ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ છે, અને તે જ્ઞાનની પરાકાશા તે સર્વજ્ઞતા છે. તે સર્વજ્ઞતાની સિદ્ધિ અંતરના આત્મઅનુભવપૂર્વકના પુક્તિ—અનુમાન વગેરેથી થાય છે.

છે જે ‘ઈન્દ્રિય-પ્રત્યક્ષ’ છે તે, અતીન્દ્રિય પર્યાર્થની સિદ્ધિમાં ન તો સાધક થઈ શકે છે, કે ન બાધક.

છે સર્વજ્ઞતા અતીન્દ્રિય છે; એટલે ઈન્દ્રિયજ્ઞાન તેના સદ્ગ્ભાવરે કે અભાવને સિદ્ધ કરી શકતું નથી. જે જ્ઞાનનો જે વિષય હોય તે જ તેમાં વિધિ કે નિરેધ કરી શકે; જેનો જે વિષય ન હોય તે તેમાં વિધિ કે નિરેધ કરી શકે નથી.

છે જગતમાં એવું કોઈ પ્રમાણ નથી કે સર્વજ્ઞતાના અસ્તિત્વને જે બાધા પહોંચાડી શકે.

છે કોઈ કહે : પુરુષપણું સર્વજ્ઞતાનું બાધક છે! તો તે બરાબર નથી; પુરુષપણું હોવા છતાં કોઈમાં જ્ઞાનના અતિશયરૂપ સર્વજ્ઞતા હોઈ શકે છે. (જેમકે અરિહંત દેવ)

છે ‘સર્વજ્ઞ છે’ એવા વાક્યના બોધ વડે ઉત્પત્ત થયેલી બુદ્ધિ તે પ્રમાણ છે, અને તે બુદ્ધિ સર્વજ્ઞના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. સર્વજ્ઞના સ્વીકારથી આત્માના જ્ઞાનસ્વભાવનો સ્વીકાર થાય છે. ને રાગાદ વિભાવોથી બેદજ્ઞાન થાય છે, એટલે આત્મા નિજસ્વભાવની સન્મુખતા વડે સર્વજ્ઞપદનો સાધક થાય છે. આ વાત પ્રસિદ્ધ છે કે—

જે જાણતો જિનરાજને ચેતનામણી શુદ્ધ ભાવથી,  
તે જાણતો નિજાત્મને, સમ્યક્ત્વ લ્યે આનંદથી.

શ્રી મુનિરાજે આમ સર્વજ્ઞતાની સિદ્ધિપૂર્વક ગંભીર ઉપદેશ આપ્યો ને મોક્ષમાર્ગની રીત સમજાવી.

શ્રીધર મુનિરાજના શ્રીમુખથી આવી અદ્ભુત ધર્મચર્ચા સાંભળીને, ચંદ્રપ્રભ-તીર્થકરના, જીવ પદનાભ રાજાએ ભક્તિથી કહું—પ્રભો! આપે જૈનસિદ્ધાંતના જે ગંભીર તત્ત્વો જીવ, મોક્ષ, સર્વજ્ઞતા વગેરે સમજાવ્યા તો બરાબર તેમ જ છે; એ જ પ્રમાણો અમારા શ્રદ્ધા-જ્ઞાનમાં બેસે છે ને એ જ હિતનો માર્ગ છે. આટલું કહ્યા પછી તે રાજા પદનાભે વિનયથી પૂછ્યું : હે પ્રભો! આપ દિવ્યજ્ઞાનના ધારક છો; મારા આગલા—પાછલા ભવો જાણવાની મને ઉત્કંઠા છે, તો કૃપા કરીને કહો.

શ્રી મુનિરાજે દિવ્યજ્ઞાન વડે જાણીને કહું—હે ભવ્ય, સાંભળ! હવે એક ભવ પછી તારો આત્મા ભરતક્ષેત્રમાં આઠુમા તીર્થકર ચંદ્રપ્રભ થશે. તારા પૂર્વના ભવો પણ હું કહું છું....

મુનિરાજના શ્રીમુખથી આ વાત સંભળતાં વેતાં સભાજનોમાં પરમ હર્ષ-છવાઈ ગયો કે અહાં એક તીર્થકરનો આત્મા અડી આપણી વચ્ચે બિરાજ રહ્યો છે... ને એ તીર્થકરના પૂર્વભવોની વાત મુનિરાજ આપણને સંભળાવી રહ્યા છે.—આમ મહાન હર્ષથી સભાજનો સાવધાનીપૂર્વક સંભળવા—તૈયાર થયા અને શ્રી મુનિરાજે પદ્મનાભરાજના અર્થાત ચંદ્રપ્રભ: તીર્થકરના પૂર્વભવોની મંગલ કથા કહેવાનું શરૂ કર્યું... તમે પણ આનંદથી સંભળો.

કૃતું હું તું તું તું તું તું તું \* \* \* તું તું

[૧]

શ્રી ચંદ્રપ્રભ તીર્થકરનો પૂર્વભવ (૪૩)

શ્રીવર્મા રાજા : સમ્યકૃત્વ-પ્રાપ્તિ

મુનિરાજ કહે છે : હે રાજી પવનાને ! પ્રથમ તો આ ભવમાં જ એક હાથીના નિમિત્ત, તમે મુનિ થશો, ને દર્શનવિશુદ્ધ વગેરે ૧૬ ઉત્તમ ભાવનાઓ વડે તીર્થકરપ્રકૃતિ-નામકર્મ બાંધશો. ભરતકોત્રની આ ચોવીસીમાં અત્યાર સુધી ઋષિલ્લાંદિ સાત તીર્થકરો થઈ ચૂક્યા છે; અત્યારે ત્યાં કોઈ તીર્થકર વિચરતા નથી! એક, ભવદું પછી, તમેજુ ત્યાં, આઠમાણુંતીર્થકર તરીકે અવતરશો ને ધર્મચિકનું પ્રવર્તન કરશો.

અહાં એક તીર્થકરનો જીવ પોતાના ભૂતલબિધના વર્ણનની કથા, મુનિરાજ પાસે સંભળી રહ્યો છે :

હે રાજન ! આ પહેલાં પાંચમા ભવે તમે પુષ્કરાદ્વારીપેના વિદેહકોત્રમાં શ્રીશેષરાજના પુત્ર શ્રીવર્મા હત્તાં તે રાજા શ્રીષેષા, શ્રીપુર નામના નગરમાં રાજ્ય કરતા હતા, તેની ચાણીનું નામ શ્રીકાન્તા. તમારા જન્મ પહેલાં યૌવનમાં પુત્ર ન હોવાથી તે રાજી ચિંતામાં રહેતી હતી, તેને ઉદાસ દેખીને રંઝી તેને સમજાવત્તા કે હે દેવી ! “જે વસ્તુ ભાગ્યને આધીન છે ! તેને માટે શોય કરવો ઉચિત નથી, માટે તમે શોય છોડો, ને ધર્મમાં તમારે ચિત્ત લગાવો. જીવ પૂર્વ ભવંમાં જે ભલ્લા કુલૂરા કુર્મો બાંધા હોય તે અનુસાર ફળ આવે છે; તેમાં હર્ષ-શોક કરવો તે વૃથાં દુઃખનું કારણ છે. અને હે દેવી ! ભાગ્ય અનુકૂળ થતાં પુત્રપ્રાપ્તિ પણ જરૂર થશો !”

આ પ્રસંગ પછી, એક દિવસ શ્રીશેષ રાજી ફળકૂલથી જીવિતા બેગીયોમાં કીડાં કરવા માટે ગયેતાં, ત્યાં મહાન ભાગ્યોદ્ય આકાશમાંથી એક ઋષિધારી મુનિરાજ અચાનક ત્યાં ઉત્તોચ્ચ તે અનંત-મુનિરાજ અવધિજ્ઞાની હતા, તેમને દેખતાં જાજાજના હરનો પારે જાણરહ્યો. રાજાએ તેમને વંદન કરીને ભક્તિપૂર્વક કહું—અહો, મારા કોઈ મહાન પુણ્યોદયથી નાથાપના: દર્શન થયાએ પ્રભો ! આપની રનત્રય-વિભૂતિ સમસ્ત મંગળનું કારણ છે. હે સ્વામી ! જીનધર્મના પ્રતાપે સ્વ-પરનું બેદજ્ઞાનનું જીંજાણું છું. આ રાજભોગોમાં કયાંય સુખ નથી, એમ મેં જાણ્યું છે, જીતાં મારું મન સંસારથી વિરક્ત, કેમ થતું નથી ?

શ્રી મુનિરાજ તેના મનની વાત સમજી ગયા... ને કહું : હે રાજની ! તમારું મન પુત્રપ્રાપ્તિની ચિંતાથી ઘેરાયેલું છે. હે થોડા કાળમાં જ તમારે ત્યાં એક ભાવિ-તીર્થકરનો જીવ પુત્ર તરીકે અવતરશો, ત્યાર પછી, તેને રાજ્યભાર સોંપીને તમે જિનદીક્ષા લેશો, ને અષ્કર્માને નાટ કરીને સિદ્ધપદને પામશો.

તમારી રાણી શ્રીકાન્તાએ પૂર્વજનમમાં એક ગર્ભવતી સીની પીડા તથા કદરૂપતા દેખીને, એવું નિદાન કરેલું કે મને યૌવન—અવસ્થામાં ગર્ભધારક ન હો. તે અશુભનિદાનને કારણે તેનું નવ્યૌવન પુત્ર વગર જ વીત્યું. હવે તેના અશુભ કર્મનો અંત આવ્યો છે, થોડા જ સમયમાં તે પુત્રવતી થશે....ભાવિ ચંદ્રપ્રભ—તીર્થકરનો જીવ તેની ગોદમાં અવતરણ ને તેને આપન્દિત કરશે.

મુનિરાજના વચન સાંભળી રાજાનું ચિત્ત ઘણું પ્રસત્ર થયું; ઘર્મોપદેશથી પ્રભાવિત થઈને તેણે પાંચ અશુભવત અંગીકાર કર્યા. ઘરે આવીને રાણીને તે મુનિરાજની વાત કરતાં તે પણ ઘણી સંતુષ્ટ થઈ, ને ઉલ્લાસપૂર્વક ઘર્મસાધના કરવા લાગ્યા. અહા, જેના ઉદરમાં ભાવિ—તીર્થકરનો જીવ બિરાજે તેના મહાભાગ્યની શી વાત !

યોગ્યકાળે મહાદેવી શ્રીકાન્તાએ એક અદ્ભુત તેજસ્વી પુત્રરલને જન્મ આપ્યો..જે સાતમા ભવે ભરતકોત્તમાં તીર્થકર થનાર છે, તેના જન્મથી આનંદ-મંગલ થવા લાગ્યા. રાજાએ જેને જે જોઈએ તે દાન દીધું. જિનેન્દ્રપૂર્જન વગેરે સર્વત્ર મંગળ વિશિષ્ટપૂર્વક તે પુત્રનું ‘શ્રીવર્મા’ એવું શુભ નામ રાખ્યું. (આ શ્રીવર્મા તે જ ભાવિ ચંદ્રપ્રભ-તીર્થકર)

\*

### ચંદ્રપ્રભુને શ્રીવર્માના ભવમાં સમ્યકૃત્વ-પ્રાપ્તિ

એકવાર તે શ્રીપુરનગરીમાં પદ્માંનિના આગમન થયું. રાજા શ્રીષેષણ પુત્ર શ્રીવર્મા સહિત તેમનો ઘર્મોપદેશ સાંભળવા ગયા. અદ્ભુત—આંશર્યકારી—આનંદમય આત્મતત્ત્વનું સ્વરૂપ સાંભળીને તેઓ મુગ્ધ બન્યા. આપણા ચરિત્રનાયક ચંદ્રપ્રભુનો જીવ (યુવરાજ શ્રીવર્મા) તો એ જિનોપદેશ જીલીને તરંતે અંતમુખ થયો; તેની જ્ઞાનચેતના, જાગ્યી ઉઠી ને મિથ્યાત્વરૂપ મહાઅંધકાર નષ્ટ થઈ ગયો; ચૈતન્યની સ્વાનુભૂતિથી અપૂર્વ સમ્યકૃત્વ પામીને તે ચતુર્થ ગુણસ્થાને આરૂઢ થયો....અંતરાત્મા થઈને મોક્ષમહેલનું પહેલું પગથિયું રહ્યો; તેણે પરમાત્માને પોતામાં જ દેખી લીધા. આ રીતે અપૂર્વ નિધાન પામીને તેનું જીવન પ્લાટી ગયું. સમ્યકૃત્વના સહ્યોગથી જે વિશિષ્ટ પુષ્ટયકર્મનો સંચય થાય છે તે સ્વયમેવ ઈચ્છિત પદાર્થોનો સમાગમ કરતો રહે છે; તેથી ઘર્મત્વા શ્રીવર્મા પણ બહારમાં ઈચ્છિત સુખોને પામતા હતો, અંતરનું સત્ય અતીન્દ્રિય સુખ તેમને સમ્યકૃત્વ-પરિણિતિ આપતી હતી.

અહે, જિનચરણોમાં સમ્યકૃત્વના પ્રતાપે આત્માની અપૂર્વ આરાધના શરૂ થઈ તે હવે વૃદ્ધિગત થતી. થતી સાતમા ભવે પૂર્ણ પરમાત્મપદ પમાડશે. ચૈતન્યસુખ ચાખ્યું હોવથી તે રાજકુમાર—શ્રીવર્માનું ચિત્ત રાજ-સુખોમાં ઉદાસીન રહેતું હન્ય હતું એમનું આત્મજીવન !

મહારાજા શ્રીષેષણનું ચિત્ત પણ કેવળી પ્રભુનો ઉપદેશ સાંભળ્યા પછી સંસાર-ભોગોથી ઉંદાસીન અને ભવથી ભયલીત રહેતું હતું...એક દિવસ આકાશમાંથી તારો ખરતો દેખીને “તે મહારાજા શ્રીષેષણ સંસાર-ભોગોથી વિરક્ત થયા ને વૈરાગ્યપૂર્વક ચિંતવવા લાગ્યા” : ‘અરે, આ અસ્થિર સંસાર-પરિવાર કે રાજલક્ષ્મીમાં મોહ શો ! એક મોક્ષલક્ષ્મી ને બીજી આ જરૂર લોકો મોક્ષલક્ષ્મીની સાધના છોડીને જરૂર લક્ષ્મીનો મોહ કરે છે. અરે, એની બુદ્ધિની બલિહારી છે, કે ચૈતન્યનું અમૃતપાન છોડીને તે વિષયોનું વિષ પીવા જાય છે. સારી લક્ષ્મી તો મોક્ષલક્ષ્મી, જ છે. વિષયોરહિત નિર્ગંધ વીતરાગદશમાં જ પરમસુખ છે.’

આમ ચિંતવી તેણે રાજકુમાર—શ્રીવર્માને બોલાવ્યો અને વિરક્ત ભાવથી કહ્યું : હે વત્સ !

જ્યાં સુધી ઘાસની ઝૂપડી જેવા આ શરીરને વૃદ્ધાવસ્થાઅપી વાયરો વીજી ન નાખે, ધર્મશ્રવણ માટે કાનની શક્તિ તથા અંખની શક્તિ મંદ ને પડી જાય ને સ્મરણશક્તિ નાચ ન થઈ જાય ત્યાર પહેલા હું નિર્ભય-દીક્ષા લઈને મારા આત્માને આ 'ભવયકથી' છોડવા ચાહું છું. અત્યાર સુધી તો સંસારનું સ્વરૂપ 'જીણવા' છતાં હું પરિવારનો 'મોહમા' 'કસાઈ રહ્યો'; હવે શીધ આત્મકલ્યાણ સાધી વેવા મેં નિશ્ચય કર્યો છે. 'હે પુત્ર! મારા આ ધર્મકાર્યમાં હું અનુમોદના' કરજે. હવે આ 'રાજ્યભાર તું' સંભાળજે. 'સદા' પ્રશંસાત્મક 'ભાવથી' રહેજે; ધર્મત્વા સજીવન-વિકાનોનો 'આદર' કરજે. પ્રજાજનોને પુત્રવત સમજીને, તેમને કઈ પણ કદ હોય તો 'તે' તુરત ૪ દૂર કરજે. ધર્મની રક્ષાપૂર્વક 'રાજ્ય કરજે.

એ પ્રમાણે હિતશિક્ષાપૂર્વક શ્રીવર્મનો 'રાજ્યાભિર્ષેક કરીને, 'શ્રીસેણ મહારાજાએ મુનિદીક્ષાં અંગીકાર કરીને' શુદ્ધભાવથી રત્નત્રૈયની સાધનાં કરીને 'અલ્યકળમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું' ને સર્વકર્મનો કથાં કરીને મૌખ પામ્યા.

આ બાજુ શ્રીપુરનગરીમાં રાજા શ્રીવર્મા (કૃતે ચંદ્રપ્રભ તીર્થકરણો છું છે તે) આત્મસાધનનાને  
ભૂત્યા વંગર, ન્યાય-નીતિપૂર્વક કુશળતાથી રાજ્ય કરવા લાગ્યા. જે રીજાં ભવે ચક્કવતી થવાના છે,  
પાંચમા ભવે તીર્થકરપ્રકૃતિ બાંધવાના છે ને સાતમા ભવે તીર્થકર થવાના છે-એવા તે શ્રીવર્મા-રાજા  
જ્યારે દ્વિજિવજ્ય મારે નીકળ્યાં ત્યારે ઘણા રાજાઓ તો બિયેંભીત ધઈને શીર્ષણે અંગ્રેઝી, કેટલાક  
રાજાઓ યુદ્ધની હેસાથી ઉરીને સંસારથી વિરક્તસી થયાં ને રાજાઓટે છીરીને જીનેશરે ભગવાનના  
શેરણમાં ચાંદ્યા ગંયો. આ પ્રેમાણો વિજ્ય કરત્તા-કરતા રીજાં શ્રીવર્મા સમુદ્રકિન્નારે પહોંચ્યો. ત્યારે,  
તેના પુષ્ટયપ્રભાવથી સમુદ્રના તરંગોની સંથેચાકંચકતા મોતી-રંતૂં પણ તણાઈને ડિનારે આવવા  
લાગ્યા... જોણ કે સમુદ્ર પણ તેની ઔધીનેતાં સ્વીકારીને મોતી-રંતૂની લેટ ધરીને એ લાંબિ-તીર્થકરણ  
સંન્માન કરતો હોયના

दिविज्य करीने ते राजा श्रीवर्मा पुनः नगरीमां आव्या अने सुखविलासपूर्वक राज्य करवा लाग्या. एक भोक्ष-पुरुषार्थ सिवोयना धर्म-अर्थ ने काम ए त्रेषु पुरुषार्थ तेरे सिंह थयो हत्ती ने योथा भोक्षपुरुषार्थ (भाटेन). तेनो उघम थाल की हत्ती

એકવાર શર્ટરદક્કતુનાં ક્ષાળભગુરે વોદળા દેખીને સંસારની ક્ષાળભગુરતા ચિંતિવીને તે રાજી સંસારથી વિરકૃત થયાં “અનેં શ્રીપ્રભ મુનિરાજ પાસે જિનદીકા અંગીકારુકરી, રત્નત્રયની આરીધિનાપૂર્વક સમ્પાદિમરણ કરીને” તેઓ જીની વર્તમાન સૌધર્મસ્વર્ગમાં શ્રીધરજી મામેંં દેવનથયાં તુલના કરીને હિંદુ માટે પ્રાર્થના કરી નાના કરી નાના

अहा चैतन्यनी शांति आत्माभास सभाय दिल

જગતની બીજી કોઈ વસ્તુ સાથે સંબંધ રાખતી નથી.

**શ્રી ચંદ્રપ્રભ તીર્થકરનો પૂર્વભવ : ચોથો  
ધાતકીખંડમાં અજિતસેન-ચક્રવર્તી**

શ્રી મુનિરાજ કહે છે : હે રાજા પદ્મનાભ ! પહેલાં જે શ્રીવર્મા રાજા હતા, અત્યારે જે પદ્મનાભ છે અને એક ભવ પછી જે ચંદ્રપ્રભ-તીર્થકર થનાર છે એવો તારો આત્મા, પાંચમા-પૂર્વભવે સૌધર્મ સ્વર્ગમાં હતો; ત્યાંથી ચચીને ચોથા-પૂર્વ ભવે, ધાતકીખંડની કૌશલનગરીમાં રાજકુમાર-અજિતસેન તરીકે અવતયો તેમના પિતાનું નામ મહારાજા અજિતંજ્ય અને માતા અજિતસેના ગુણવાન તેજસ્વી પુત્રને દેખીને ખૂબ પ્રસત્ર થયા. અહિ, ભાવિ-તીર્થકરને પોતાના ઘરમાં દેખીને કોણ ખુશી ન થાય !!

આપણા ચરિત્રનાયક રાજકુમાર અજિતસેન એકવાર રાજસભામાં બેઠા હતા... આનંદમય ચર્ચા લાલી રહી હતી; એવામાં તેનો પૂર્વભવનો વેરી કોઈ દુષ્ટ દેવ ત્યાં આવ્યો ને સભાજનોને મૂર્છિત કરીને તે રાજકુમારને ઉપાડી ગયો.

મૂર્છા દૂર થતાં રાજાએ ગભરાટપૂર્વક સભામાં નજર કરી, ત્યાં રાજકુમારને ન દેખતાં તેને ચિત્તભાસ થઈ ગયો કે અરે આ શું ! સભામાંથી રાજકુમાર ક્યાં ગૂમ થઈ ગયો ? મહારાણી પણ પુત્રના વિયોગથી હાય-હાય કરતી એકદમ રોવા લાગ્યો. પુત્રના વિયોગથી બંનેનો સંસાર નીરસ થઈ ગયો. અરે, ફરીને નેત્રોથી પુત્રને કથારે દેખશું ! એવી ચિત્તામાં ક્ષાણકાર તો બંને મૂર્છિત થઈ ગયા.

થોડીવારે મૂર્છા દૂર થતાં રાજાએ જ્યાં આંખ ખોલીને ઊંચે જોયું...ત્યાં તો...અહાહા ! એના આશર્યનો પાર ન રહ્યો. તેણે જોયું કે આકાશમાંથી એક મહા તપસ્વી ઋદ્ધિધારી મુનિરાજ પોતાની તરફ પદ્મારી રહ્યા છે... પૂનમના ચાંદ જેવા એ મુનિરાજને દેખતાં જ રાજના બધા દુઃખ ભૂલાઈ ગયા. મુનિરાજ જેમ જેમ નજીક આવતા ગયા તેમતેમ રાજના અંતરમાં હર્ષનો સાગર ઊછળવા લાગ્યો.... ખરું જ છે-મુમુક્ષુ આત્મા, ધર્મત્તમાનો સંગ થતાં દુનિયાના દુઃખોને ભૂલી જાય છે. તે રાજાને પોતાના પ્રાણપ્રિય પુત્રના વિયોગથી એટલો શોક ન થયો,—કે જેટલો મુનિરાજના પદ્મારવાથી સંતોષ થયો. ખરેખર, આવો સંતોષ પોતાના જીવનમાં તેને પહેલી જ વાર થયો.

શ્રી મુનિરાજે રાજાને મંગલ આશીર્વદ આપ્યા ને કહું—હે ભવ્ય ! તું ચરમશરીરી છો.’ અહા, એમના વાત્સલ્યની શી વાત ! એ વાત્સલ્યઝરતા આશીર્વદ જીલીને રાજાનું દુદ્યકમળ આનંદથી ખીલી ઉઠ્યું. અહા ! મુનિના શ્રીમુખથી પોતાના મોક્ષની વાત સાંભળીને કોને આનંદ ન થાય !!

રાજાએ આનંદિત થઈને કહું : પ્રભો ! મને કલ્યાના પણ ન હતી કે, અત્યારે કોઈ મુનિભગવંતના દર્શન થશે. જ્યારે હું પુત્રવિયોગરૂપ દુઃખસમુદ્રમાં દૂલ્હી રહ્યો હતો ને મારું. મન મૂઢ બની, રહ્યું હતું તે વખતે ખરે ટાળે આપ પદ્મારતાં, આપનાં દર્શન પામીને મને નવું જીવન મળ્યું છે, દુઃખના દરિયામાંથી આપે મને બહાર કાઢ્યો છે; આપ મારા પરમ છિત્સ્વી બંધુ છો.

શ્રી મુનિરાજે કહું—હે ભવ્ય ! હું અહિં આકાશમારો જતો હતો, ત્યાં પુત્રવિયોગથી તને દુઃખી જોઈને તારા ગુણોના અનુરોગથી હું અહિં આવ્યો હું. હે રાજન ! તમે તત્ત્વજ્ઞાની છો, સ્વ-પરના લેદાજાની છો, અને સંસારનું સ્વરૂપ જીવનાર છો. તમને આ અસાર-સંસારની રિથતિ બતાવવી તે તો ઈન્દ્ર પાસે સ્વર્ગનું વજ્ઞન કરવા જેવું છે. વળી તમે આ ભવમાં મોક્ષગામી ચરમશરીરી છો; તેથી તમને અધિક શું કહેવું ? તમે ચિત્તામાંથી ઈષ-વિયોગનો વિષાદ છોડો. હે રાજન ! આ પ્રસંગે કાયરતા છોડીને ધીરને ધારણ કરો... ને વીરપુરુષને શોભે તેમ ધર્મમાં સાવધાન થાવ.

વળી હે રાજન્ ! (મુનિ કહે છે) અવધિજ્ઞાનથી જાણીને હું કહું છું કે તારો પુત્ર કુશળ છે. તેનું કાંઈ જ અમંગળ થવાનું નથી. તે ભાવિ-તીર્થકર છે ને થોડા જ હિવસોમાં અનેક સમૃદ્ધિ સહિત આવીને તે તમને મળશે.

—આમ કહી આશીર્વાદ. આપીને મુનિરાજ તો આકાશમાર્ગ વિહાર કરી ગયા. મુનિરાજના વચનથી રાજનું ચિત્ત સંતુષ્ટ થયું અને ધર્મધ્યાનમાં તે વિશેષપણે ઉઘ્મા થયો.

\* \* \*

બીજી બાજુ, જે દુષ્ટ દેવ અજિતસેન-રાજકુમારને હરીને લઈ ગયો હતો, તેણે તે રાજકુમારને મગરમચ્છથી ભરેલા એક સરોવરમાં ફેંક્યો. પરંતુ પુષ્યપ્રતાપે રાજકુમાર કિનારે આવ્યો. ચારે તરફ ઘેર જંગલ હતું. સિંહ-વાધ ને હાથીથી ભરેલા તે વનમાં ચાલતાં ચાલતાં તે એક સુંદર પણડ ઉપર આવ્યો. ત્યાં હિરેણ્ય નામનો એક દેવ રહેતો હતો, તે તેની શ્રૂતીરતા દેખીને પ્રસત્ર થયો ને કહું—હે પુષ્યપત્તમા ! હું તમારો સેવક છું એટલે તમને મારી પાસે કંઈ મંગવાનું તો કેમ કહું ? પણ તમે જ્યારે યાદ કરશો ત્યારે હું તમારી સેવામાં હાજર થઈશ... કેમકે પૂર્વજનમમાં તમે મારા ઉપકારી છો.

‘કંઈ રીતે?’ એમ રાજકુમારે પૂછતાં તે દેવ કહું : પૂર્વે હું સૂર્ય નામનો ખેડૂત હતો ત્યારે, ચંદ નામના ખેડૂતે મારું ધન ચોરી લીધું હતું તમે મને તે ધન પાછું અપાવ્યું હતું ને ચંદને ફાંસીની સજા કરી હતી... તે ચંદ મેરીને ભવમાં ભમતો-ભમતો ચંડલણી નામનો અસુર દેવ થયો છે, ને તે જ પૂર્વભવના દેરથી તમારું અપહરણ કરીને તમને અહીં લાવ્યો છે. હું સૂર્ય નામનો ખેડૂત હતો તે અત્યારે હિરેણ્યદેવ થયો છું ને મારા ઉપર તમારા ઉપકારનો બદલો વાળવા આવ્યો છું.—આમ કહી, રાજકુમારને જંગલની બહાર મૂડીને તે દેવ અદશ્ય થઈ ગયો.

રાજકુમારે આશ્રયપૂર્વક એક નગરીમાં પ્રવેશ કર્યો; એનું નોમ વિપુલનગરી. ત્યાંના નગરજનો ધન-ધાન્યથી સુખી હતા. પરંતુ દુશ્મન રાજના ભયથી બધાય અત્યંત ભયભીત હતો. અજિતસેન રાજકુમારે તે રાજને હરાવીને તે જ્યાં દૂર કર્યો, ને ત્યાંની રાજકુમારી સાથે લગ્ન કર્યો. ત્યારબાદ તે પોતાની કોશલનગરીમાં આવ્યો. પ્રતાપી પુત્રના પુનર્ગમનથી મોતા-પિતાને અપાર હર્ષ થયો ને ભવ્ય સ્વાગત કરીને ભાવિ-તીર્થરાજ એવા તે રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો. તેના મહો પુષ્યપ્રતાપે થોડા સમયમાં તેના રાજભંડરમાં સુદર્શન-ચક તેમ જ તલવાર વગેરે સાત અર્જવ-રલો ઉત્પત્ત થયાં; તેમજ સેનાપતિ વગેરે સાત છવ-રલો તેને પ્રાપ્ત થયાં.—આમ ૧૪ રત્નધારી ચકવર્તીપદ તેને પ્રાપ્ત થયું. અને ધર્મની આગાધનાના પ્રતાપે હવે ત્રણ ભવ પછી તેઓ ધર્મ-ચકવતી થશે.

૧૪ રત્નો ઉપરાંત તેને નવ નિધાન પર્ણ પ્રાપ્ત થયો હતો.—જે તેને ઈચ્છિત સામગ્રી આપતા હતા, આ પ્રમાણે નવ નિધાન ને ૧૪ રત્નો પામવા છતાં તે ધર્મત્વા પોતાના ચૈતન્યનિધાનમાંથી મળેલા સમ્યક્તિપદ્ધતિ રત્નોની પાસે તે બાબતેભવને તુચ્છ સમજતા હતા. તે ચકવતી અજિતસેન બંધુજનો સહિત દરરોજ ધામધૂમથી અરિહંતદેવની પૂજા કરતા હતા, અને ધાતકીદીપના ભરતક્ષેત્રનું છ ખંડનું રાજ્ય પણ સંભાળતું હતા.—આશ્રયકારી હતી એમની પરિણાત!

એકવાર તે અજિતસેન-ચકવતીની રાજધાની કોશલ (અયોધ્યા) નગરીમાં, ધર્મચકી સ્વયંપ્રભ-તીર્થકર પદ્ધાર્ય, પ્રભુજી પદ્ધાર્ય છે’ એ સંભળતાં જ ચકવતીને મહાન હર્ષાલ્તાસ થયો... અને તરત જ ધામધૂમથી પ્રભુદર્શન માટે ચાલ્યા. સાક્ષાત્ તીર્થકરના દર્શનથી, ભાવિ તીર્થકરને કેવો આનંદ થયો !—જેવો

આનંદ સ્વાનુભૂતિમાં પરમાત્માને દેખતાં ધર્મત્ત્વાને થાય તેવો જો કે બે તીર્થકરોનું મિલન નથી થતું છતાં એક 'ભાવ-તીર્થકર'ને બીજા 'ભાવતીર્થકર' (એક વર્તમાન ભાવનિક્ષેપરૂપ ને બીજા દ્વયનિક્ષેપરૂપ) એમ બે તીર્થકરોનું મિલન થયું. દ્વયતીર્થકરે ભાવતીર્થકરને વંદન કર્યા.

અખે, "એ તીર્થસ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માની, ગજાધરો એને ઈન્દ્રો પણ આરાધનો કરતાં હતા; એને મનુષ્યના ઈન્દ્ર એવા આ ચકવત્તી પણ પ્રભુની આરાધના કરતાં હતા. તે દેખીને લોકો બરાબર સમજી જતા કે ઈન્દ્રપદ કે ચકવત્તીપદના વૈભવ કરતાં યુદ્ધાત્માના આ સર્વજ્ઞપદનો વૈભવ મહાન છે. એ આત્મવૈભવની પાસે સંસારના બધા વૈભવો તુચ્છ છે.

આપણા ચારિત્રનાયક ચકવત્તી અજિતસેન, તથા તેમના પિતા અજિતંજ્ય-મહારાજા સ્વયંપ્રભ તીર્થકરના ધર્મદરબારમાં પ્રભુદર્શન કરીને જિનવાણી સાંભળવા બેઠા. નણકાળ નણલોકના સમસ્ત પદાર્થો જેમના જ્ઞાનમાં સ્પષ્ટ ઝણકી રહ્યા છે એવાં તે પરમાત્માની વાણીમાં તત્ત્વોનું અદ્ભુત સ્વરૂપ આવ્યું એને સર્વ તત્ત્વોમાં શ્રેષ્ઠ શુદ્ધાત્માની અનુભૂતિ જુ જીવને મોકાનું કારણ છે—એમ પ્રભુએ ઉપદેશયું.

ત્યારબાદ રાજા અજિતંજ્યે હથ જોડીને પૂછ્યું : હુ દેદા ! આ સંસારમાં જીવ શુભ-અશુભ કર્મોથી કેમ બંધાય છે ? ને તેનાથી છૂટકારો કેમ થાય ?

ભગવાને આશર્થકારી દ્વયધનિ વડે તેનો ઉત્તર કહ્યો; પરંતુ ખૂબી એ હતી કે, ભગવાન બોલતા હોવા છતાં તેમનું મુખ ખૂલતું ન હતું કે હેઠળ હાલતા ન હતા; આખાય શરીરમાંથી કોઈ અદ્ભુત રણકાર બીઠતો હતો. તેમાં ભગવાને કહ્યું—

હુ ભવ્ય ! જીવનો સ્વભાવ ઉપયોગમય છે; તે ઉપયોગમાં કોધ નથી, કોધ કરવાનો તેનો સ્વભાવ નથી; છતાં જીવ જે કોધાદિ, કષાય ભાવો કરે છે. તેને લીધે તે પુષ્ય-પાપરૂપ કર્મોથી બંધાય છે; પછી તે કષાય અશુભ હોય તો પણ કર્મો બંધાય છે. ને શુભ હોય, તો પણ કર્મો બંધાય છે., તે, કર્મો વડે, સંસારબમણમાં, જીવ દુઃખી થાય છે. એને જ્યારે જૈનધર્મ પામીને, તે ઉપયોગ એને કોધનું બેદજ્ઞાન કરે છે ત્યારે, કોધથી, જુદા એવા શુદ્ધ-ઉપયોગને જ તે કરે છે; તે શુદ્ધ ઉપયોગ વડે, નવા કર્મો બંધાતા નથી ને જૂના બંધાયેલા કર્મો પણ છૂટી જાય છે, એટલે જીવ મોકાસુખ પામે છે. આ રીતે, કષાયો વડે જીવ બંધાય છે ને, વીતરાગી-શુદ્ધોપયોગ વડે, તે મોકા પામે છે.—

જીવ રક્ત બાંધે કર્મ ને વૈરાગ્યપ્રાપ્ત મુકાય છે;

આ જિન તણો ઉપદેશ, તેથી ન રાચ તું-કર્મો વિષે.

કષાય એને ઉપયોગની ભિન્નતાના બેદજ્ઞાન વડે જીવને આત્માના સમ્યંદર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે. બેદજ્ઞાન થયા પછી 'પણ જ્યાં સુધીં 'જીવ' પુત્ર-પરિવારાદિના મોહમાં ફસાઈને અવતીપણે રહે છે. ત્યાં સુધીં તે સર્વ કર્મોથી છૂટીને મોકા નથી પામતો. માટે સંસાર-દુઃખથી ઉરનારા મોકાથી જીવે રત્તાય-ધર્મની પૂર્ણ આરાધના કર્તવ્ય છે. ચારિત્ર વગરનું સમ્યંદર્શન, કે સમ્યંદર્શન વગરનું ચારિત્ર, તે મોકાને, સાધી શકતું નથી. સમ્યંદર્શન-જ્ઞાન-ચારિત્ર-તણોની સંપૂર્ણતા જ મોકાને સાધે છે; માટે તે મુખ્યાનું કર્તવ્ય છે.

આ રીતે શ્રી જિનેન્દ્રદેવની વાણીમાં બંધનું તથા મોકાનું સ્વરૂપ સાંભળીને, તે રાજા અજિતંજ્યનું

ચિત્ત સંસારથી વિરક્તાઃ થયું રાજપાટ છોડીને તેણે સંશ્વાતં મોક્ષમાર્ગરૂપ શ્રીમર્દ્યને અંગીકાર કર્યું ને શુદ્ધોપયોગમાં લીન થયા.

આપણા ચચિત્રનાયક ચક્કવતીને સમૃદ્ધદીશન તો પહેલથી હતું તેના પરિણામોમાં વિશુદ્ધ થઈ, તેનો જ્ઞાનબંધિયો ખીલી ઉક્ખો પરંતુ ચક્કવતીપદે છોડીને તો મુનિને થઈ શક્યો મુનિપદની ભાવનાંપૂર્વક, જિનદેવને વંદન કરીને, તેમજ હમણાં મુનિ થયેલા પોતાના પિતાજીના ચરણોની પૂજા કરીને તે ચક્કવતીએ પોતાની ક્રીશલનગરીમાં પુનઃ પ્રવેશ કર્યો; અને દારાજ્ય-સંભાળ્યું દેશના ભધા રાજ-મહારાજાઓ તેની આપણા સ્વીકારતા હત્યે; માત્ર રાજાઓ જ નહિં પણ છંચ ખંડમાં રહેનારા વંતરદેવોને પણ તેણે વર્ણ કર્યા લિધા હતા. જો કે હજીરો દેવો તેની સેવા કરતા હતા-પણ તે પોતે તો અંતરમાં દાસ ભગવંત કે, ઉંદસાં રહે જગતસો. અનું જીવન જીવત્તા હતા. ૧૪ રત્નો નહીં એને તો ૧૪મું ગુણસ્થાન જોઈતું હતું નવનિધાનમાં એનું ચિત્ત ના હતું એને હતો નવ ક્ષાયિકલબ્ધ જોઈતી હતી. નીચું શિપ્રાદ્રોહ શિપ્રાદ્રોહ શિપ્રાદ્રોહ

[આપણે વાંચી રહ્યા છીએ—ચંદ્રપ્રભ રતીશ્વકરની કથાઓ અને તેમાં તેમના પૂર્વના ચોથા ભવનું આ વજન ચાલી રહ્યું છે.—જેમાં તેઓ અજિતસેન નામના ચક્કવતી છે.]

ભાવી ભગવાન એવાફ્તે અજિતસેન-ચક્કવતી, છ ખંડનો દિગ્નિઃજ્ય-કરવા, છતાં અંતરમાં પોતાના અંદર ચૈતન્યતત્ત્વને ભૂલ્યા ન હતા. છ ખંડની પ્રજાના હૃદયમાં વસ્ત્વ હોવા છતાં એના હૃદયમાં તો પંચપરમેષ્ઠીનો જ વાસ હતો... બલારમાં પંચનિદ્ય-વિશ્વોની પૂર્વાત્તા હોવા છતાં એમાં એનું ચિત્ત સંતુષ્ટ ન હતું એનું ચિત્ત તો પંચ-પરમાપદની પૂર્ણતાને સાધવોમાં જ ચોટેલું હતું ગૃહસ્થ હોવા છતાં એમની ચેતના તો ચૈતન્યસ્થ હતી, એટે ગૃહી છતાં તેઓ મોક્ષમાર્ગ હતા. હુરે માત્ર ત્રણ ભર્વ પછી તો તેઓ તિથિકર થઈને સિદ્ધાંતથી પહોંચી જવાના છે.

તે આત્મસાધક ધર્મતિભાને ચક્કવતીપદનું અભિમાન ન હતું દેવ-ગુરુ પ્રત્યે પરમ વિનય-બહુમાન તેના ચિત્તમાં સેદાયે જોગ્યો હતા. ભોજન સમયે રસ્તા પરં આવી રોજ મુનિવરોને વાદ કરતા. એકવાર અરિન્દમુનિરોજ પેઢારતાં, તેણે બક્કિતપૂર્વક આંહરેદાને દીધું... એને દેવોએ ત્યાં રેલંવૃષ્ટ વંગે પંચ આશ્રય પ્રગટ કર્યા.

એક, દિવસ ચક્કવતી-અજિતસેન રાજસભામાં બેઠી છે; હજીરો રાજાઓ મુગટ જ્ઞાવીને તેમનું અભિવાદન કરી રહ્યા છે; નગરજનો પણ તેમના દર્શનથી પ્રસત્ર થઈ રહ્યા છે. છતાં આરાજ્યથી, પાર કોઈ અમૂલ્ય નિધાનમાં જ મહારાજાની દાદિ લાગેલી છે... તેમના મનમાં ઉડે ઉડે વૈરાગ્યનું, ચિત્તન ચાલી રહ્યું છે, કે કચારે આ ઉપાધિથી છુટીને નિરૂપાધિ-સૈતન્યધ્યાનમાં, સ્થિર રહું! કચ્ચારે વનવાસી મુનિ થઈને વીતરાગ ભાવમાં વિચરું!!

સભાભવન વ્યવસ્થિતાં ચાલી રહ્યું હતું; એવામાં રાજાની દાદિ-રાજસભાના આંગણામાં એક ભંબ્ય છીથી; ઉપરા પડી તે મોટા બણદુર હાથીને વીર મુલાખો અને કાણકારે ત્રાસરો આપીને યુદ્ધની તાલીમ આપી રહ્યા હતા. ચોરેકોરે શાસ્ત્ર-પ્રાણરની પ્રતિકૂળતા વચ્ચે, કઈ રીતે મહાદુરીથી લડવું તે શીખવતાઃ હતા. તે દેખીને રાજાને થયું; કે-અરે, આંદુઃખમિયા રૂસસારમાંનું ચારેક કોરની પ્રતિકૂળતા વચ્ચે: પણ શૂરવીરપુરો આત્મસાધનામાં કઈ રીતે વિજય મેળવવો એની ત્સાલીમ પરમ ગુરુઓ ભંબ્ય

મુમુક્ષુને આપે છે...ને તેમાં મુમુક્ષુને આનંદ છે. આ યુદ્ધની તપાલીમમાં તો હાથીને ત્રાસ છે. હાથીનો એ ત્રાસ દેખીને રાજાનું ચિત્ત સંસારથી ઉદ્ઘાસ થયું. એવામાં તે હાથીએ એક માણસને સુદૂરમાં પકડ્યો ને પછાડી પછાડીને તેના ચૂરા કરી નાંખ્યા...બસ, જીવનની આત્મી ક્ષણાલંગુરતા દેખીને, અને હાથીનો ત્રાસ દેખીને મહારાજા અજિતસેનનું ચિત્ત વિરક્ત થયું ને વૈરાગ્યથી તે ચિંતન કરવા લાગ્યા કે-

અરે, આ સંસાર ઘોર દુઃખોથી ભરેલા ઊંડા કૂવા જેવો છે; તેમાં આ મનુષ્યજીવન વીજળીના જબકારા જેવું અસ્થિર છે. 'આ શરીર-ધન-યૌવન-પરિવાર કે રાજ્ય કોઈ જીવની જીવાયે રહેવાનાં નથી. તે જીવનાં છે જ નહિં, છતાં તેમાં મોહ કરી-કરીને જીવ સંસારમાં ફસાઈ રહે છે. 'આજે આ કામ કરીશ, કાલે આ કરીશ, પછી આ કરીશ...' એમ પારકી ચિંતામાં ને ચિંતામાં એ પોતાના મૃત્યુને ભૂલી જાય છે કે હું આજ મરીશ કે કાલ મરીશ !-

**કરિષ્યામિ કરિષ્યામિ કરિષ્યામિ ઈતિ ચિન્તયા!**

**મરિષ્યામિ મરિષ્યામિ મરિષ્યામિ ઈતિ વિસ્મૃતમ્ભુ ! !**

'કરીશ...કરીશ...કરીશ...' એવી ચિંતામાં લીન થયેલો મૂઢ જીવ 'મરીશ...મરીશ.... મરીશ...' એ વાત તો ભૂલી જ ગયો !—જાણો મરણ તો કદી આવવાનું જે ન હોય—એમ નિશ્ચિતપણે મૂર્જ જીવ બાબુ વિષયોમાં રોકાઈ રહ્યો છે ને મનુષ્યજીવન ગુમાવી રહ્યો છે.

વૈરાગી—ચક્કવર્તી ચિંતાને છે : અરેરે, સત્યપુરુષોએ જેનો નિષેધ કર્યો છે એવા પાપોથી મૂઢ જીવ ઉરતો નથી, નરકાદિ દુર્ગતિનાં ઘોર દુઃખોનો તેને ભય નથી ને ઈન્દ્રિય-વિષયોમાં તથા કોધાદિ કષાયોમાં તે ફસાઈ રહ્યો છે. સંસારમાં બંધુ—બાંધવ સૌ ધનના સાથી છે, ધર્મમાં સાથ આપનારા ધર્મત્તમા તો, કોઈ વિરલ છે.

અરે, આ છ ખંડના પરિગ્રહમાં સુખ કર્યાં છે? એ તો બધું કર્મનું ફળ છે. કોધાદિ કષાયોથી સળગતા આ સંસાર-દાવાનળમાં જીવ બળી રહ્યો છે; તેને શાંત—વીતરાગી જીવનજળનું સીંચન કરવાથી જ શાંતિ થશે.

આમ નિજસ્વભાવના વીતરાગી ચિંતન વડે ચક્કવર્તી કહે છે : હે સભાજનો! મારું ચિત્ત હવે આ સંસારથી વિરક્ત થયું છે. સંસારમાં એવા કોઈ ઈન્દ્રિયવિષયો બાકી નથી રહ્યા કે જેને આ જીવ ભોગવી ચૂક્યો ન હોય! પણ એ વિષયોથી કદી જીવને તૃપ્તિ થતી નથી. વીતરાગ ભાવ વડે જ જીવને સાચું અતીન્દ્રિય સુખ-શાંતિ ને તૃપ્તિ થાય છે. એ સુખ માટે વીતરાગી સંતો સાદ પણને મને મોકષમાં બોલાવી રહ્યા છે. જિનમાર્ગના પ્રતાપે મેં મારા ચૈતંન્યસુખને જાણ્યું છે ને વિષયભોગોથી મારું ચિત હવે પાછું વળ્યું છે. મારી વૃત્તિ હવે અંદર વળે છે. સંસાર-લતાને છીદવા માટે હવે હું શુદ્ધોપ્યોગ-તલવાર ધારણ કરું છું. ચક્કવર્તીની ચંદ્રાસ-તલવાર બહારના દુષ્મનોને ભલે જીતી શકે પણ અંતરના કોધશત્રુને તે કચાં જીતી શકે છે? સમભાવરૂપ વીતરાગ-તલવાર વડે હવે હું કોધશત્રુને જીતીશ ને મારા મોકષસાગ્રાજ્યને પ્રાપ્ત કરીશ. ઘણી જ કઠીનતાથી મળેલ આ મનુષ્યજન્મ, તેમાં જે આત્મહિત નથી સાધતા તે મૂર્જજીવો ફરીને સંસાર દરિયામાં હુલે છે. પુષ્પના ફળરૂપ આ સંસારના સુખોની પ્રેશંસા મૂર્જ લોકો જ કરે છે; ખરેખર તો તે ઝેર મળેલા મિથ્યાત્મ જેવા છે. જેમ હું અહીં દુશ્મનોને જીતીને ચક્કવર્તી થયો તેમ હવે મુનિદશામાં હું સમસ્ત

પરભાવોરૂપી દુશ્મનોને પરાસ્ત કરીને ધર્મચક્કવત્તી થઈશ ને અખંડ મોક્ષસામાજ્યને પ્રાપ્ત કરીને સદાય આત્માના શુદ્ધ સ્વરૂપમાં જ રહીશ.

વાહ ! ચક્કવતીની આ ભાવના સભાજનો મુગધપણે સાંભળી રહ્યા છે ને વૈરાંયરસમાં જૂલી રહ્યા છે...જાણો મહાન ધર્મસભા ચાલી રહી છે. વૈરાંયપરાયણ ભાવિતીર્થકર મહાત્મા અજિતસેન કહે છે : આ પુત્રપરિવાર ને છ ખંડના વૈભવો કરતાંય વન-જંગલમાં ચારિત્રવૈભવથી મને વધુ સુખ થશે. હું હેયઉપાદેયનો જાગ્ઞાનાર, જન્મ-મરણથી ઉનાર, મુક્તજીવનોની રત્નત્રયસંપત્તિને હદ્યથી ચાહનાર,-તે પણ જો વિષયોમાં આસક્ત રહેશે ને ઈન્દ્રિયવિષયોની સેનાને જીતીને મોક્ષને નહીં સાધે, તો-તો પછી મુક્તિકન્યા હુંવારી જ રહી જશે ! (જો મુમુક્ષુ જીવો મુક્તસુંદરીને નહીં વરે ને વિષયબોગોમાં જ આસક્ત રહેશે, તો પછી મુક્તિને વરશે કોણ ?) બસ, આજે જ હું આ રાજલક્ષ્મીનો મોહ છોડીને, મોક્ષસુંદરીને વરવા તપોવનમાં, જઈશ ને મારા આત્માને મોક્ષની સાધનામાં જોડીશ. બુદ્ધિમાન પુરણો પોતાના હિતના અવસરમાં આળસ નથી કરતા.

હજુ રાજસભામાં ચક્કવતી પોતાના વૈરાંય-વિચારો પ્રસિદ્ધ કરે છે...ત્યાં તો...? શું બન્યું તે હવેના પ્રકરણમાં વાંચો.

\* \* \*

### શ્રી મુનિરાજનું આગમન અને ચક્કવતીની દીક્ષા

આપણા ચારિત્રનાયક ભગવાન ચંદ્રમલુનો જીવ પૂર્વના ચોથા ભવમાં અજિતસેન-ચક્કવતી છે; તે વૈરાંય પામીને તપોવનમાં જવાનો પોતાનો નિશ્ચય રાજસભામાં પ્રસિદ્ધ કરે છે, ત્યાં તો...! શું બન્યું ? તે હવે વાંચો.

વનનો માળી હર્ષપૂર્વક રાજસભામાં આવીને કહેવા લાગ્યો : હે મહારાજ ! ગુણપ્રભ નામના મહા ગુણવાન આચાર્ય સંઘસહિત આપણી નગરીના ઉદ્ઘાનમાં પદ્ધાર્યા છે; તેમના આગમનથી બાગબગીચા ફળકૂલ ખીલી ઉઠ્યા છે ને ચારેકોર અદ્ભુત ચમત્કાર ફેલાઈ રહ્યો છે.

વાહ ! રાજાને જે જોઈતું હતું તે જ સામે મળ્યું આ મુશ્ખલબર સાંભળીને તેના હર્ષનો પાર ન રહ્યો... અહો, જાણો તે મુનિભગવંતો મને મોક્ષમાં રેઝવા માટે જ પદ્ધાર્યા હોય ! -આમ પ્રસત્તા પામીને પોતાનો રત્નાભર માળીને ઈનામ આપ્યો, ને આચાર્ય મહારાજની સંન્મુખ પરોક્ષ નમસ્કાર કર્યા : અહો પ્રભો ! આજે આપણા મંગલ આગમનથી હું કૃતકૃત્ય થઈ ગયો; હું જેને ચિંતવતો હતો તે પરમેષ્ઠીપદ સામેથી મારા આંગણો આવ્યું.. મને ચિંતામણી મળ્યો.-આમ અત્યંત પ્રમોદપૂર્વક તે ચક્કવતી રાજા, નગરજનો સહિત મુનિરાજના દર્શન, માટે તપોવન તરફ ચાલ્યો.

વાહ, મહાત્માના સદ્ભાગ્ય તો જુઓ ! પહેલાં ચક્કવતીપદમાં ચિંતિત સામગ્રી મળતી, હવે મોક્ષના સાધન, માટે ચિંતિત સામગ્રી સ્વયમેવ આવી મળે છે. ખરેખર, મોક્ષના, સાધકને આખુંય વિશ અનુકૂળ જ પરિણમી રહ્યું છે.. મોક્ષના સાધકને જગતમાં કોઈ પ્રતિકૂળતા છે, જ નહીં.

\* મહારાજા અજિતસેન તપોવનમાં પહોંચા.. નજર કરી ને મુગધ  
\* બન્યા-અહાદા ! જ્યાં જુઓ ત્યાં મુનિ...મુનિ....મુનિ.... ! કોઈ ધ્યાનમાં લીન  
\* છે...કોઈ સ્વાધ્યાયમાં મળન છે...કોઈ ધર્મચર્ચા કરીને ભવ્યજીવોને અપૂર્વ ચૈતન્યતત્ત્વ  
\* બતાવી રહ્યા છે. ચારેકોર...બસ, રત્નત્રયમય મોક્ષમાર્ગનું વાતાવરણ છિવાઈ ગયું

- \* છે. કખાયોનું કે વિષયોનું તો નામનિશાન ત્યાં નથી. અહા, આ તો પંચપરમેષ્ઠીની \*
- \* વીતરાગી નગરી વસી ગઈ છે... ને હું હવે સંસારનગરીમાંથી છૂટીને આ \*
- \* વીતરાગનગરીમાં પંચપરમેષ્ઠી ભગવંતો સાથે રહેવા આવી ગયો હું. અહા, કેવી \*
- \* અપૂર્વ શાંતિ છે આ નગરીમાં! આમ રાજાને અપૂર્વ આખ્લાદ થયો. \*



એક બાજુ આચાર્ય, શ્રી ગુણપ્રભસ્વામી ધ્યાનમાં સ્થિર હતા. અહા, કેવી શાંત મુદ્રા! મોક્ષમાર્ગમાં કેવી શાંતિ હોય, તે તેમની મુદ્રા દેખાડતી હતી; વચ્ચન વગ્ર, પણ તેમની મુદ્રા વચ્ચનાતીત શાંતિની પ્રતીત કરાવતી હતી. રાજા તો તેમની સંસુધ બેસીને ચૈતન્યના અપાર મહિમા પૂર્વક મુનિજીવનની ભાવના કરવા લાગ્યો. કે 'બસ! હું પણ હવે હમણાં જ આવો મુનિ થઈશ ને. મુનિવરોની સાથે રહીને આત્મસાધના કરીશ.'

"મુનિવરોનો ઔષ્ણ્રમ પરમ શાંત છે. ચારેકોર 'વીતરાગતા છવાઈ' રહી છે. જાડ પણ પ્રેસત્રતાથી ખોલી રહ્યા છે. પશુ-પંખી શાંત થઈને મુનિયરણોમાં બેસી ગેયાં છે... ને ઉત્સુકતાથી મુનિ સામે જોઈ રહ્યા છે: જીવ-જંતુનો કોઈ ઉપદ્રવ નથી... ગાયનું બચ્યું સિંહણને ધારે છે... ને સિંહણનું બચ્યું ગાયને માતા સમજીને ધારે છે; કોઈનો ભય નથી; સર્પ ને નોળિયો, વાઘ ને સસલાં-સૌ દેરભાવ છોડીને સાથે જ બેઠા છે. શાંત-શીતળ વનમાં અદ્ભુત શોભા ખોલી ઉઠી છે. જાણે સમવસરણ જ હોયનું. એમ જીવોમાં સર્વત્ર રત્નત્રય ધર્મનો વિસ્તાર થઈ રહ્યો છે. સૌ. જિનમાર્ગમાં તત્પર છે... મોક્ષને સ્વાધ્યવામાં મશગુલ છે. સંસાર તો કોણા જાણે કયાં દૂર દૂર ચાલ્યો ગયો છે!"

કેટલીક વારે નિર્માણી આચાર્યમહારોજનું ધ્યાન-સેમાપ્ત થયું; તેમણે આંખ-ખોલી... રાજાએ વંદના કરી. મુનિરાજે પ્રસત્રદાસિથી ધર્મવૃદ્ધિના. આશીર્વાદ આપ્યા. ત્યારબાદ, રાજાને સુતિ કરતાં કહું—

‘હે પ્રભો જે બુદ્ધિમાન પુરુષ આપની સ્વરૂપનું ક્ષણભર ચિંતન કરે છે તેને પણ પરિણામ વિશુદ્ધ થઈ જાય છે, તો પછી આપના સાક્ષાત્તં દર્શનની તો શી વાત ! જેમ ચૈતન્ય પરમતત્ત્વનું સ્મરણ પણ મોહને તોડીને શાંતિ આપે છે, તો તે, ચૈતન્યના સાક્ષાત્ત અનુભવના આનંદની તો શી વાત ! પ્રભો, આજ આપના દર્શનથી હું ફૂત્યકૃત્ય થયો. હું મુનિદશાની ભાવના ભાવતો હતો ત્યાં જ મને આપની સાક્ષાત્ત પ્રાપ્તિ થઈ. અહા, સાક્ષાત્ત રલત્રય મને મળ્યા ! મિથ્યાત્વ અંધકારમાં રૂબેલું આ જગત આપના શાન્દિકરણો વડે જ સમ્યક્ માર્ગને પામે છે. અધોગપ્તિમાં આથડતા જીવોને આપ જ શરણ છો ને મોક્ષમહેલમાં પહોંચવો માટે આપું જ સોપાન-માર્ગ છો. અરે, એવો કયો અભાગી જીવ હોય કે જે આપને પણ ધર્મને અંગીકાર ન કરે ?

આ રીતે હર્ષોલ્લાસથી મુનિરાજની સ્તુતિ કરતાં ચક્કવર્તી કહે છે—પ્રભો, આપના માર્ગને અંગીકાર કરતાં જ ભવભવનાં પાપો ક્ષણભરમાં દૂર થઈ જાય છે. બીજા કુમારોનું ઘણાકાળ સુધી સેવન કરીને પણ જીવો જે મુક્તિને દેખી નથી શકતા, તે મુક્તિ આપના દર્શનથી ક્ષણભરમાં નીકટ આવે છે ને જીવને આશ્રય પમાડે છે. મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિમાં દુશ્મન એવા કોધ—માન—માયા—લોભને આપે જીતી લીધા છે, તેથી આપ જિન છો.—આમ વિનયપૂર્વક સ્તુતિ કરીને તે વૈરાગી રાજા મુનિરાજ સમીપ ધર્મશ્રવણ કરવા બેઠા.

તપોવનમાં ગુણપ્રભ—મુનિરાજ અને ચક્કવર્તી—અજિતસેન એ બે ભવ્યાત્માઓના ભિલનથી ધર્મનું ગંભીર વાતાવરણ છવાઈ રહ્યું હતું. હજારો સંભાજનો તે બંનેની ધર્મચર્ચા સાંભળવા આતૂર બન્યા હતા. શ્રી મુનિરાજે કહું : દેખો જગતમાં રાજુપદ તે ઘણાને મદનું કારણ છે...પરંતુ આશ્રય છે કે, આ ભવ્યાત્મા પાસે ચક્કવર્તીનો રાજવૈભવ હોવા છતાં તેને રાજ્યનો મદ નથી ને ધર્મપ્રત્યેની તેની નમ્રતા પ્રશંસનીય છે. વળી શુદ્ધ સમ્યક્તવ્યાદિ ગુણોથી તે શોભે છે. તેને છ ખંડ સાધવાની એટલી ચિન્તા ન હતી કે જેટલી ચિન્તા મોક્ષને સાધવાની છે. એને સંસારસુખની ચાહ નથી, એને તો મોક્ષસુખની જ ચાહ છે,—એટલું જ નહિ, આ મહાત્મા એક ભાવિ—તીર્થકર છે ને ચોથા ભવે તે ચન્દ્રપ્રભ—તીર્થકર થશે.

મુનિરાજની અંદ્રભૂત વાત સાંભળીને સૌને અત્યંત પ્રસન્તતા થઈ; બધાય આશ્રયથી તે ભાવિ—તીર્થકરના દર્શન કરવા લાગ્યા. ત્યારે અત્યંત નમ્રતાથી તે અજિતસેન ચક્કવર્તીએ કહું : હે સ્વામી ! આપની મહાન કૃપા પામીને હું ધન્ય બન્યો. પ્રભો ! મુનિ થવાના મારા મનોરથ છે. આપ પ્રસન્ત થઈને મારા મનોરથ પૂરા કરો..ને મને જિનદીકા આપો. આ ભરતઅંડનું નાનું રાજ્ય છોડીને હવે ત્રણલોકના જ્ઞાનથી ભરેલું સર્વજ્ઞતાનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે રલત્રયથી શોભતા શુદ્ધોપયોગરૂપ ધર્મચક્કને હું ધારણ કરીશ.

અજિતસેન—ચક્કવર્તીના ઉત્તમ વૈરાગ્યભાવો જાણીને શ્રી આચાર્યમહારાજે તેને જિનદીકા આપી. ચક્કવર્તીપદ છોડીને તેણે દિગ્ંબરદશા ધારણ કરી ને આત્મધ્યાન વડે શુદ્ધોપયોગી થઈને આત્માને રલત્રયરૂપ પરિણમાયો. ધન્ય તે મુનિરાજ ! લોકો આશ્રયથી તેમને નીહાળી રહ્યા. છ ખંડના પરિગ્રહને ક્ષણમાં છોડીને અપરિગ્રહી થયેલા તે મુનિરાજના ચરણોમાં દેવો પણ નમસ્કાર કરવા લાગ્યા. જે હજારો દેવો પહેલાં ચક્કવર્તીરાજા તરીકે તેમની સેવા કરતા, તે દેવો હવે તેમને પરમેષ્ઠ તરીકે પૂજવા લાગ્યા.


જિનમુનિ થઈને તે મહાત્માએ ઉગ્ર આત્મસાધના કરવા માંડી. ધ્યાનચક્કનો મોહ ઉપર પ્રહાર કરીને પહેલું જ ધરાકે બાકી રહેલા ૧૨માંથી ૮ કષાયોને તો નાચ કર્યા, ને છેલ્લા ચાર કષાયોને

પણ મરણતુલ્ય કરી નાંખ્યા. તેઓ સહજ તપ કરતા, સ્વાધ્યાયમાં રત રહેતા, ઉપસગોને ઘેર્યથી સહન કરતા, પરીષહમાં પણ આત્મસાધનાથી ચ્યૂત થયા વગર મોક્ષમાર્ગમાં નિશ્ચલ રહેતા; તેમને મરણાદિ સંબંધી કોઈ ભય ન હતો. ઘોર ગરમી હો, ઠડી હો કે વરસાદ હો, કૃધા હો કે તૃષ્ણ, -તેમનો શુદ્ધોપયોગ એક સરખો જ રહેતો હતો. તેમનું ચિત્ત સ્વકાર્યમાં જ લાગ્યું રહેતું. અનિત્ય-અશરણાદિ બાર વૈરાગ્યભાવનાઓના ચિંતનમાં તેમનું ચિત્ત સદ્ગ તત્પર રહેતું, એ રીતે, છ ખંડ છોડીને અખંડ ચૈતન્યની સાધનપૂર્વક સમાધિમરણ કરીને તે (ચંદ્રપ્રભ તીર્થકરના આત્મા, આજિતસેન-ચક્રવર્તીની પર્યાય છોડીને) અચ્યુત સ્વર્ગમાં ઈન્દ્રપણે 'શાંતકાર' વિમાનમાં ઉપજ્યા. વાહ, એ શાંતમૂર્તિ-જીવ અપૂર્વ આત્મશાંતિ સહિત જે વિમાનમાં ઉપજ્યા તેનું નામ પણ શાંત-કાર હતું. કુદરતનો કેવો સુમેળ ! દેવલોકના દિવ્ય-વૈભવોમાં મૂઢ્ય વગર તે મહાત્માએ પોતાની આત્મસાધનાને અસંખ્ય વર્ષો સુધી અખંડ રાખી. ત્યારપછી તેઓ આરાધના સહિત ક્યાં અવતર્ય ? તે હવે સંભળો.

\* \* \*

## [૫]

## ચંદ્રપ્રભ-તીર્થકરનો પૂર્વભવ (બીજો) : પદ્મનાભ રાજા



શ્રીધર મુનિરાજ પદ્મનાભરાજાને તેમના પૂર્વભવોની આ કથા સંભળપાતાં કહે છે કે હે ભવ ! તે અચ્યુત સ્વર્ગમાંથી ચ્યૂત થઈને પછી તમે અહીં રતસંચયપુરમાં આ પદ્મનાભ તરીકે ઉપજ્યા. છો ; હવે આ ભવમાં તીર્થકર પ્રકૃતિ બાંધીને એક ભવ પછી તમે ભરત ક્ષેત્રમાં ચંદ્રપ્રભ તીર્થકર થશો.

વિશેષમાં મુનિરાજે કહ્યું-હે રાજન્ ! આજથી દશમા દિવસે તમારી નગરીમાં એક મોટે ઉન્મત હાથી આવીને ઉપદ્રવ કરશે, તે ઉપદ્રવ તમારા નિમિત્તે શાંત થશે, ને તે પ્રસંગ ઉપરથી તમને આ બધી વાતોનો વિચાસ દઢ થશે.

અહા, મુનિરાજના શ્રીમુખથી પોતાના પૂર્વભવોની આવી સરસ વાત સાંભળીને, તથા હવે એક જ ભવ પછી તીર્થકર થઈને મોક્ષ જવાની મધુરી વાતે સાંભળીને, તે પદ્મનાભરાજાનું ચિત્ત હર્ષથી રોમાંચિત થયું હજારો શ્રોત્વાજોમાં આનંદ-ઉલ્લાસનું વાતાવરણ છવાઈ ગયું ને સર્વત્ર હર્ષમય ઉત્સવ થવા લાગ્યો. પદ્મનાભ રાજાએ મુનિરાજ સમીપે શ્રાવકના વ્રતો અંગીકાર કર્યા; ને ભક્તિપૂર્વક પુનઃપુનઃ પ્રણામ કરીને તે પોતાની રાજધાનીમાં આવ્યો. પોતાની આત્મસાધનામાં કઈ રીતે આગળ વધે છે તે આપણે જોઈશું.

તે ધર્મત્વા અને પુજુયવંત રાજ પદ્મનાભ, કોઈના શીખત્વા વગર જ પંચપરમેષ્ઠી પ્રત્યે સ્વાભાવિક વિનયવાન હતા; તેનું જ્ઞાન ઈન્દ્રિયોને જીતીને માત્ર અતીન્દ્રિયઆત્મા સાથે જ પ્રેમ કરતું હતું; આત્મા

કરતાં બીજા કોઈ વિષયો તેને વહાલા ન હતા... વ્રતપૂર્વક તે વિદ્યાભ્યાસ કરતા હતા ને અધ્યાત્મવિદ્યા સહિત સર્વવિદ્યામાં તે અત્યંત કુશળ હતા. જિનેન્દ્ર-ઉપાસનાની સાથે જ તે અનેકાત્તરૂપ જિન-વિદ્યાને પણ સમ્યક્કપણે ઉપાસત્તા હતા; મુનિજનોને ભક્તિપૂર્વક આહારદાન દેતા હતા ને તેમનો સત્તસંગ કરતા હતા; વિદ્વાનોનું સંન્માન કરતા હતા; અવારનવાર તેઓ આત્મધ્યાન કરતા હતા ને નિરંતર પરમાત્માની ભાવનામાં રહેતા હતા.

હ્મણાં જ શ્રીધર મુનિરાજના" શ્રીમુખથી પોતાના સાત ભવોની ઉત્તમ કથા સાંભળીને રાજા પદનાભને ઘડી જ પ્રસન્નતા હતી... અહા ! પોતાના મોક્ષની વાત સાંભળીને કોને ખુશી ન થાય ! રાજા પદનાભ આનંદપૂર્વક ધર્મસાધનામય જીવન વીતાવે છે; મુનિરાજે કહેલી વાતો ફરીફરી યાંદ કરે છે. ચક્કવર્તીપદ કે ઈન્દ્રપદની વિભૂતિપણ આ જીવ પૂર્વ જ્વામાં પામી ચૂક્યો છે, ત્યાં આ રાજ્ય-ભાગોની શી વાત ! એમ વૈરાગ્યપરિણામ કરે છે.

એ વાતને નવ દિવસ વીત્યાં દશમા દિવસે નગરીમાં એકાએક ભયંકર કોલાહલ થવા લાગ્યો. નગરજનો ભયથી આમતેમ ઘોડાદોડી કરવા લાગ્યા ને, 'બચાવો... બચાવો', એમ બૂમ પાડવા લાગ્યાં. હાથી ને ઘોડા પણ ભયથી ચીસો પાડતા ભાગવા લાગ્યા. 'શું થયું... શું થયું !' એમ ચારેકોર પોકાર થવા લાગ્યો.

ત્યાં તો રાજાએ જોયું કે એક ઘણો મોટો ને અતિ સુંદર હાથી નગર તરફ આવી રહ્યો છે. તે ગંડો થઈને જે ઉડકેટમાં આવે તેને સૂંધમાં પકડીને ઊંચે ફંકે છે ને પગ નીચે કચરી નાંજે છે. લોકો તેનાથી ભયભીત થઈને આ કોલાહલ કરી રહ્યા છે. તે હાથીને ટેખીને રાજને મુનિરાજની વાત યાદ આવી; તેમના કહેવા પ્રમાણે જ બન્યું. મનમાં મુનિરાજને વંદન કર્યા; ને ક્ષણભરમાં હાથીને તાબે કરવા તે કટિબદ્ધ થયા. તેણે યુક્તિપૂર્વક હાથીને વશ કર્યો. હાથી પણ જાણે પુષ્યવંત રાજાને પારાખી ગયો હોય તેમ શ્વાસ થઈને તેની આશામાં રહ્યો. તેના ઉપર બેરીને રાજા પદનાભ નગરીમાં આવ્યા, ત્યારે નગરજનોએ વિજયનો ઉત્સવ કરીને તેનું ભલ્ય સ્વાગત કર્યું. હાથી પણ જાણે નગરજનોની ક્ષમા, માંગતો હોય તેમ સૂંધ ઊંચી કરી કરીને સૌને વંદન કરતો હતો. તે હાથીનું નામ 'વનકેલિ' હતું. રાજાને પુષ્યયોગે આવા ભલ્ય હાથીની પ્રાપ્તિ થઈ, અને હવે તે હાથી જ તેને મહા વૈરાગ્યનું નિમિત્ત થશે.

મહારાજા પદનાભ એકવાર રાજસભામાં જેઠા હતા; એવામાં પૃથ્વીપાલ રાજા તરફથી એક રાજદૂત આવ્યો ને નમસ્કાર કરીને કહેવા લાગ્યો—હે મહારાજ ! અમારો પ્રિય ગજરાજ વનકેલિ—હાથી તમારા રાજ્યની હદમાં આવ્યો; તેને તમે પકડી લીધો. ને તમારી સવારી માટે રાખી લીધો. અમને એમ હતું કે અમારો તે હાથી માનસહિત તમે અમને પાછો આપુશો. તેને બદલે તમે, તે હાથીને પોતાનો જ સમજીને રાખી લીધો છે. આ, કાર્ય વડે, તમે અમારું અપમાન કર્યું છે; માટે તમે તે હાથી પાછો આપી જાઓ.

—આ પ્રમાણે ગલીત ઘમકી સહિત તે દૂતે કહું. 'ત્યારે રાજા' પદનાભ તે પૃથ્વીપાલ રાજાનો યુદ્ધ માટેનો લલકાર સમજી ગયો, પણ તે ધીર-ગંભીર રાજાનું ચિત્ત 'જરા' પણ વ્યાકુળ ન થયું. દૂતને જવાબ દેવા માટે તેણે યુવરાજ તરફ આંખથી ઈશારો કર્યો.

.. કુશળ યુવરાજ સુવર્ણનાભ પિતાના ભાવને સમજી ગયો; તેણે દૂતને સંબોધાને કહું—હે દૂત !

આવા વચન તું જ કહી શકે કેમકે તું દૂત છો,—બીજાએ તારા મોઢામાં મૂકેલા શબ્દો જ તું બોલી શકે છે. સાંભળ, તારા રાજા ગમે તેવા શક્તિશાળી હોય પણ તેનું અભિમાન તેનો જ નાશ કરશે. શું તારા રાજા પાસે બીજા હથી નથી કે આ હાથીની બીજ માંગવા તને મોકલ્યો છે? જ્યારે આ હથી ગાંડો થઈને અમારા પ્રજાજનોનો કચ્ચરઘાણ કરી નાખતો હતો ત્યારે તારો રાજા કયાં ગયો હતો? એ વખતે અમારા મહારાજાએ મહાન પરાક્રમ વડે તેને જીતીને વશ કર્યો છે. અમારા પુષ્યયોગે જ તે હથી અમારી નગરીમાં આવી ચક્યો. તો પુષ્યયોગે અમને પ્રાપ્ત થયેલી ચીજ છીનવી લેવાનો તમને શું અધિકાર છે?—આ પ્રમાણે ધમકાવીને દૂતને પાછો કાઢ્યો. આ રીતે હથી પાછો ન આપ્યો તેથી બંને રાજાઓ વચ્ચે યુદ્ધની તૈયારી થઈ. યુદ્ધ માટે પ્રસ્થાન વખતે પણ ધર્મત્તમા પદ્ધનાભ પોતાની આત્મસાધનાને ભૂત્યા ન હતા. રોજ સવારમાં રાગ-દ્રેષ્ણ વગરના ચિદાનંદ તત્ત્વને સમભાવથી અંતરમાં ધ્યાવતા હતા. પંચપરમેષ્ઠી ભગવંતોને પોતાના અંતરમાં બિરાજમાન કરીને તેમના વીતરાગી સ્વરૂપનું ચિંતન ને બહુમાન કરતા હતા. રસ્તામાં વન-પર્વતમાં કોઈ વાર મુનિરાજના દર્શન પ્રાપ્ત થતા ત્યારે તેને પરમ હર્ષ થતો ને જીતિપૂર્વક આખારદાન દેતા. કંઈક માનકષાયને લીધે યુદ્ધ માટે જતા હતા... છતાં કખાય વગરની આત્મશાંતિ પણ ભેગી હતી જ. ખરેખર, એ મહાત્માનું જીવન અટપણું હતું. રાતે સૈન્યના વીરપુરુષો સાથે માત્ર યુદ્ધની નહિ, —ધર્મની ચર્ચા પણ કરતા હતા. તેમની ચેણા સૈન્યને પણ મુશ્ખ કરતી. સંધ્યા સમયે જ્યારે સામાયિક-યોગમાં બેઠા હોય ત્યારે આશ્રય થતું કે અરે, આ તે રાજીવી છે કે યોગી? કચ્ચારેક સૈન્યના પડાવમાં આંટો મારીને અને લોકો સાથે હળીમળીને તે રાજા સૈન્યને પણ ખુશ કરતો હતો; એટલું જ નહિ, તેને દેખીને સેનાના હથી—ઘોડા વગરે પણ આનંદિત થઈને હર્ષનાંદ કરતા હતા.

એ રીતે વનની પ્રાકૃતિક શોભા જોતા જોતા સેનાનું ગમન થઈ રહ્યું હતું. એકવાર એક મનોહર પર્વત પાસે પડાવ નાંખ્યો. એ સુંદર પર્વત પરથી અનેક મુનિવરો નિવિંશ પામ્યા હતા. આનું શાંત-નિર્વિષાધમાં દેખીને રાજાને પ્રસ્ત્રતા થઈ અને થોડા દિવસ શાંતિપૂર્વક અહીં રહેવાનો વિચાર કર્યો. તે દરમિયાન પૃથ્વીપાલ રાજના ગુપ્તચરોએ રાજાને બાતમી પહોંચાડી કે રાજા પદ્ધનાભ યુદ્ધ માટે તૈયાર થઈને આવી રહ્યા છે, તેમની સાથે મોટી સેના છે.

એ સાંભળતાં જ રાજા પૃથ્વીપાલ કીથિત થયો ને તરત સૈન્ય લઈને યુદ્ધ માટે પદ્ધનાભની સામે આવ્યો. જેમ જિનેદ્રપ્રભુની દિવ્યધનિના નાદથી મુમુક્ષુની વીરતા જાગી ઉઠે, તેમ રણભેરીના નાદથી યોદ્ધાની વીરતા જાગી ઉઠી; ઘોડા હણહણવા લાગ્યા ને હથીઓ પૃથ્વી પર સૂંધ પછડીને ચીંઘાડવા લાગ્યા. આત્મસાધનાના અવસરે વીર મુમુક્ષુ હર્ષથી રોમાંચિત થાય તેમ યુદ્ધનો પ્રસંગ દેખીને વીર યોદ્ધાઓ શૌયથી રોમાંચિત થતાં હતા. યુદ્ધ તો માત્ર એક હથી માટે હતું! —હથી તો માત્ર નિભિત હતો, ખરેખર તો બંને રાજાઓના માનકષાયનું યુદ્ધ હતું. એ જ વખતે રાજા પદ્ધનાભની શાનચેતના તે કખાયથી અલિપ્ત રહેતી હતી... ને મોકને સાધી જ રહી હતી. એ જ ધર્મત્તમાની વિશેષતા છે કે, કોઈ પણ પ્રસંગમાં તેની શાનચેતના મોકને સાધવાનું કામ છીડતી નથી, ને સંસાર વધવા દેતી નથી. (પાઠક! તને યાદ હશે જ કે આ રાજા પદ્ધનાભ તે જ આપણા ચંદ્રપ્રભ તીર્થકરના આત્મા છે.)

બંને રાજાઓની સેના યુદ્ધ માટે સામસામી આવી ગઈ. જેમ મુમુક્ષુ મોકને માટે શરીરનો ને

સંસારનો મોહ છોડી દે છે તેમ યુદ્ધતત્પર તે યોદ્ધાઓએ શરીરનો ને સ્વીનો મોહ છોડી દીધો. કેટલાક યોદ્ધાઓએ બજ્જર-કવચ પહેર્યા, તો કેટલાક યોદ્ધાઓએ એમ સમજીને તે ન પહેર્યા કે પુરુષુપી કવચ જ અમારી રક્ષા કરશે, પછી બીજા કવચની શી જરૂરે !

રાજા પદ્મનાભના સેવકોએ 'વનકેલિ'ને રત્નાભૂપણોથી ખૂબ જ શક્તાળાયો હતો. સૌની નજર ત્યાં જ મંડાણી હતી—કે જેના માટે આ યુદ્ધ થઈ રહ્યું હતું. ગજરાજ વનકેલિ પણ જાણે પોતાના સન્માનથી પ્રસત્ર થઈ રહ્યો હતો, ને તેમાં વળી રાજા પદ્મનાભ (—એક ભાવિ તીર્થકર) તેના પર આરુઢ થયા હતા, પછી તેની શોભાનું શું કહેવું ? તે હથી, પહેલાં તો રણમેંદ્રનમાં પોતાના પૂર્વપરિચિત રાજા પૃથ્વીપાલને તેમ જ બીજા હાથીઓને જોઈને, અજીવનની જેમ ચમક્કો. પણ રાજા પદ્મનાભે પ્રેમપૂર્વક તેનું મસ્તક થાબડીને તેને શાંત કર્યો, એટલે તે તેની આજ્ઞામાં વર્તવા લાગ્યો.

બને સેનાનો ભેટો થયો; યુદ્ધનો પ્રારંભ થયો. પૃથ્વીપાલ, રાજા જો કે શૂરવીર હતો—બુદ્ધિમાન હતો, પણ અત્યારે કોથે તેની ચેતના પર કંબજો કરી લીધો હતો, તેને યુદ્ધ સિવાય બીજું કાંઈ સૂજુતું ન હતું. યુદ્ધમાં કોઈ મર્યાદા, કોઈ ઘાયલ થયા; ઘોર સંગ્રહ ચાલ્યો.—પણ વિશેષતા એ હતી કે ઘાયલ થઈને પડેલા દુશ્મનયોદ્ધાં પર કોઈ પુનઃ પ્રહાર કરતા ન હતા; એટલું જ નહિ, કોઈવાર તો મૃત્યુશાયા પર પડેલા યોદ્ધાને, તેને મારનાર યોદ્ધો જ ધર્મ (નમસ્કાર મંત્ર) સંભળાવતો હતો કે પણી પાતો હતો. આ રીતે બને યોદ્ધાઓ વેરભાવના સંસ્કારને ભૂલી જતા હતા.

એકાએક પૃથ્વીપાલના સેનાપતિ ચંદ્રશેખરે, પદ્મનાભના સેનાપતિ ભીમરથને માથામાં બાણ મારીને મૂર્છિત કરી દીધો. જ્યાંસુધી તે મૂર્છિત રહ્યો ત્યાંસુધી સામા સેનાપતિએ યુદ્ધ બંધ રાખ્યું. થોડીવાર પછી તેની મૂર્છા દૂર થઈ અને, જેમ બેભાન મુમુક્ષુવીરની ચેતના સદ્ગુરુના વચનથી જાગી ઉઠે ને મોકશનું પરાક્રમ કરીને તે મોહને જીતી લ્યે, તેમ ભીમરથની ચેતના જાગી ઉઠી ને ઘોર પરાક્રમ વડે તેણે સામા સેનાપતિ ચંદ્રશેખરને બાણથી વીંધી નાંખ્યો; તેનું મરણ થયું.

પૃથ્વીપાલના સેનાપતિનું ભરણ થતાં તેની સેનામાં હાથકાર થઈ ગયો; તરત તેનો યુવરાજ લડવા આવ્યો, પણ સામેથી વીર યુવરાજ સુવર્ણનાભે યુક્તિથી તેને જીવતો જ પકડીઃ લીધો.

સેનાપતિ ચંદ્રશેખર મરાયો ને રાજકુમાર જીવતો પકડાઈ ગયો, તેથી અર્તિંત ગુર્સે થઈને રાજા પૃથ્વીપાલ પોતે યુદ્ધ કરવા તૈયાર થયો. તેણે પોતાનો હાથી સીધો પદ્મનાભ રાજ ઉપર ચલાવ્યો ને ભયાનક શાસ્ત્રપ્રહાર કર્યો. રાજા પદ્મનાભ તો તૈયાર જ હતો, અર્તિંત સાવધાનીથી તેણે પૃથ્વીપાલના શાસ્ત્રનો ઘાંચુકાવી દીધો, ને પોતાના વનકેલિને પૃથ્વીપાલના હાથી સાથે ભટકાવીને પૃથ્વીપાલ ઉપર એવો શાસ્ત્રપ્રહાર કર્યો કે પૃથ્વીપાલનું મસ્તક પૃથ્વી પર રંણવા લાગ્યું.

બસ, રાજા પૃથ્વીપાલ મરાયો તેથી તેની સેના હતાશ થઈને ભાગવા માંડી. રાજા પદ્મનાભે તરત યુદ્ધ બંધ કરવાની આજ્ઞા કરી ને સૌને અભયવચન આપ્યું. થોડીવાર સર્વત્ર શાંતિ ને સત્તબ્ધતા છવાઈ ગઈ. એવામાં રાજા પૃથ્વીપાલનું માર્યું ભાલામાં પરોવીને એક સૈનિક પદ્મનાભ પાસે લાવ્યો... એ કરુણ દશ્ય જોતાં જ રાજા પદ્મનાભનું ચિત્ત એકદમ સંસારથી વિરક્ત થયું.... તે વિચારવા લાગ્યો—

"અરે, એક હાથીને માટે આટલી હિંસા ! થોડાક માન ખાતર આ રાજાએ પ્રાણ ગુમાવ્યા. આવા કષાયોવાનું ગૃહસ્થજીવન મને શોભતું નથી. પરમ શાંત—અકષાય મુનિજીવન જ શ્રેષ્ઠ છે.



રણભૂમિમાં  
રાજા  
પદ્મનાભનો  
વૈરાગ્ય  
અને  
મુનિરાજનું  
આગમન

અરે, પૂર્વભવે હું ચક્રવર્તી હતો ત્યારે મેં ૮૪ લાખ ઉત્તમ હાથીને ક્ષણમાં છોડીને દીક્ષા લીધી હતી, ને અત્યારે આ એક હાથીના મોહમાં હું કેમ ફસાયો? મોક્ષના સાધકને આ મોહબંધન શ્રોમતું નથી. આવી ભાવનાથી પશ્ચાત્તાપૂર્વક ક્ષમાભાવ ધારણ કરીને, તેણે પૃથ્વીપાલના પુત્ર ધર્મપાલને (-કે જે યુદ્ધમાં જીવતો પકડાયો હતો તેને) મુક્ત કર્યો અને પ્રેમથી તેના માથે હાથ ફેરવીને કહું : બેટા, તારા પિતાનું રાજ્યપદ તું સંભાળ. તું મારા યુવરાજ—સુવર્ણનાભનો ભિત્ર થઈને રહેજે ને ધમનું પાલન કરજે..—અમ વૈરભાવ છોડી પ્રેમપૂર્વક તેને તેનું રાજ્ય પાછું સોંઘું; યુવરાજ સુવર્ણનાભનો રાજ્યાભિષેક કર્યો; અને પોતે મુનિદીક્ષા માટે તત્પર થયા : અરે !—

જીવને પ્રેમ જેવું કોઈ બંધન નથી; વિષયો જેવું કોઈ વિષ નથી;  
કોધ જેવો કોઈ શરૂ નથી; ને જન્મ જેવું કોઈ હુઃખ નથી.

—માટે એ ચારેયનો નાશ કરીને હું મોક્ષના પરમ સુખને સાધીશં કેમકે—

વીતરાગતા જેવો કોઈ મોક્ષમાર્ગ નથી; જ્ઞાન જેવું કોઈ અમૃત નથી;  
શાંતિ જેવો કોઈ ભિત્ર નથી; ને મોક્ષ જેવું કોઈ સુખ નથી.

### આકાશમાંથી મુનિરાજનું આગમન

હજુ રાજા આવી વૈરાગ્યભાવનામાં તત્પર છે.. ત્યાં તો કુદરતના ઉત્તમ યોગે આકાશમાંથી શ્રીધરમુનિરાજ ઉત્ત્યા. અહા ! ઉપાદાન—નિમિત્તનો સુમેળ બન્યો. ગુરુ જાડો શિષ્યને તેડવા આવ્યા. આ તે જ શ્રીધર મુનિરાજ છે. કે, થોડા વખત પહેલાં જેમની પાસેથી પદ્મનાભરાજએ પૂર્વભવોની તેમજ ભવિષ્યમાં તીર્થકર થવાની કથા સંભળી હતી. અત્યારે અરે ટાણે એ જ ગુરુનાં પુનઃ દર્શન થતાં રાજા ધન્ય બન્યો. પરમભક્તિથી હર્ષપૂર્વક તેમના ચરણોમાં વંદન કર્યા, અને તેમની પાસે જિન્દીક્ષા અંગીકાર કરીને મુનિ બન્યા. મુનિ થઈને ધ્યાનમાં બેસતાં જ શુદ્ધોપયોગ સહિત સપ્તમું ગુણસ્થાન

પ્રગટ્યું રત્નત્રય પ્રગટ્યા રાજપદમાં જેવું સુખ ન હતું તેવું સુખ મુનિપદમાં પ્રગટ્યું એટલું જ નહિ...તેમને બાર અંગનું શ્વાન પણ તે જ સમયે અંતરમાં ખીલી ઉઠ્યું... આ ભવમાં શ્રુતકેવળી બન્યા ને ત્રીજા ભવમાં કેવળી પરમાત્મા બનશે. હવે બીજી બાજુ વનકેલિ હાથીની વાત સાંભળો.

### વનકેલિ-હાથીનો વૈરાગ્ય

પૂર્વના સ્વામી રાજા-પૃથ્વીપાલનું મૃત્યુ થયું અને હાલના સ્વામી રાજા-પદ્મનાભે જિનદીકા લીધી,-એ બંને દશથો નજરે દેખીને બુદ્ધિમાન હાથી પણ એકદમ વૈરાગ્ય પામ્યો, તેનું ચિત્ત બધેથી એકદમ ઉદાસ થઈ ગયું. મુનિરાજના દર્શનથી ને ધર્મોપદેશથી તેની ચેતના પણ જાગ્રી ઉઠી...હું પશુ નહિ, આ કોધાદિ પણ હું નહિ, હું તો આ મુનિભગવંત જીવો શાંત સ્વરૂપ આત્મા છું—એમ તેણે વેદન કર્યું ને તે પણ સમ્યગદર્શનથી અલંકૃત થઈને પોતાના સ્વામી (—ભાવી ચંદ્રપત્રતીર્થકર)ના પગલે મુક્તિમાર્ગ ચાલવા લાગ્યો. અહા, ભાવિતીર્થકરની સેવાનો યોગ જેને બન્યો તેનું કલ્યાણ થાય જ ને !

શ્રી મુનિરાજ-પદ્મનાભ જ્યાં—જ્યાં વિહાર કરતાં, હાથી પણ આંશકારી શિષ્યની જેમ ત્યાં જતે; મુનિરાજ ધ્યાન ધરતાં ત્યારે હાથી પણ તેમની નજીકમાં ગુપ્તરૂપ બેસીને આત્મચિંતન કરતો. મુનિરાજની સમીપમાં જ રહીને અદ્ભુત વૈરાગ્યજીવન જીવતો. મુનિરાજના દર્શન કરવા આવનારા શ્રાવકો આ વૈરાગી હાથીને જોઈને આશ્રમથી મુઘ બનતા ને ધર્મનો અપાર મહિમા તેમના અંતરમાં જાગતો...કે અહા, આ હાથી પણ મુનિરાજના ઉપદેશથી જૈનધર્મ પામીને આવું સુંદર વૈરાગી જીવન જીવે છે, તે આપણે માટે પણ અનુકૂરણીય છે.—આમ અનેક જીવો હાથીને દેખીને વૈરાગ્ય પામતા. હાથી જ્યારે સુંદર નમાવીને મુનિરાજને નમસ્કાર કરતો ને મુનિરાજની દાઢિ તેના ઉપર પડતી, કે મુનિ હથ ઊંચો કરીને તેને આશીર્વદ આપતા... ત્યારે તે હાથી પોતાની ધન્યતા અનુભવતો હતો. (દશ્ય માટે જુઓ પાનું : ૩૬૮)

### દર્શનવિશુદ્ધિ આદિ ૧૬ ભાવના અને તીર્થકરાયકૃતિ

મુનિરાજ શ્રી પદ્મનાભને સમ્યગદર્શન સહિત ૧૬ ઉત્તમ ભાવના હતી.—

- (૧) સમ્યગદર્શનસહિત આઠ મૂળગુણનાં નિરતિચાર પાલનરૂપ દર્શનવિશુદ્ધિ હતી;
- (૨) દેવ—ગુરુ—ધર્મ—જિનાગમ પ્રત્યે આદરરૂપ વિનયસમ્પત્તા હતી;
- (૩) શીલ-ક્રતોનું નિરતિચાર પાલન કરતા હત્તા;
- (૪) નિરંતર નિયમપૂર્વક જ્ઞાનાત્્યાસમાં ઉપયોગ લગાવતા હત્તા, તેમાં પ્રમાદ કરતાં ન હતા;
- (૫) તેઓ સંસારહુંબોથી ભયબીત રહેતા ને મોક્ષ સાધવા પ્રત્યે ઉત્સાહિત રહેતા;
- (૬-૭) ત્યાગ અને તપમાં પોતાની શક્તિ લગાવતા હતા;
- (૮-૯) સાધુજીનો આરાધનામાં વિધન ન થાય તે રીતે તેમની સેવા તથા વૈયાવૃત્ત્ય કરતા હતા;
- (૧૦-૧૧-૧૨-૧૩) અરિહંત પ્રત્યે, આચાર્ય પ્રત્યે બહુશ્રુતધારી સાધુઓ પ્રત્યે તેમ જ રત્નત્રયવંત સાધમાંજનો તથા જિનપ્રવચન પ્રત્યે પરમ આદરરૂપ ભક્તિ હતી;
- (૧૪) સામાયિક આદિ આવશ્યક-કિયાઓ તેઓ બરાબર સાવધાનપણે

નિયમિત કરતા, તેમાં આળસ કરતા ન હતા;

(૧૫) વિશેષ જ્ઞાન-તત્પ્રવર્તના વડે તેઓ રત્નત્રયમાર્ગની પ્રભાવના કરતા હતા,

ઉપદેશ વડે જિનધર્મનો વિસ્તાર કરતા હતા; અને

(૧૬) સાધમાંજનો પ્રત્યે વાત્સલ્યભાવ રાખતા હતા.

આ રીતે મોક્ષસુખની ભાવનાપૂર્વક આવી ૧૬ ભાવનાના વિશુદ્ધપરિણામ તેમને સહજપણે વર્તતી હતા, ને તેથી તે આસપ્રભુવ્ય મહાત્માની સેવા કરવા માટે તીર્થકરપ્રકૃતિરૂપ શ્રેષ્ઠ નામકર્મ આવતું હતું; જો કે એમને તો આત્મવિકાસમાં તે તીર્થકરપ્રકૃતિની કાઈ જરૂર ન હતી....પણ તે શ્રેષ્ઠ પ્રકૃતિને બિચારીને રહેવા માટે આવા ભવ્ય—મહાત્માના શરણ સિલાય બીજું કોઈ સ્થાન ક્યાં હતું? તે ભગવંત નિષ્ણાપ હતા, ધીર હતા, ગંગીર હતા, રત્નત્રયના ધારક અને ચાર આરાધનામાં તત્પર હતા; ભવસમુદ્રનો હવે તેમને ડિનારો આવી ગયો હતો; તેઓ વારંવાર નિર્વિકલ્પ ધ્યાનમાં લીન થતાં હતા. વર્ષો સુધી અખંડ આરાધના કરીને આયુનો અંત સમય નજીક આવતાં તેમણે સહ્લેખના ધારણ કરી ને આત્મચિંતનમાં ઉપયોગ જોડીને દેહત્યાગ કર્યો. ભાવિ ચંદ્રપ્રભ એવા તે પદ્ધનાભ મુનિરાજ, ૧૬ સ્વર્ગ ૮ ગ્રેવેયક અને નવ અનુદિશ વિમાનોથી પણ ઉપર, અને મોક્ષનગરીની એકદમ નજીક એવા પાંચ અનુત્તર વિમાનમાંથી વૈજ્યન્ત-વિમાનમાં ઉપજ્યા.

#### (૬) ચંદ્રપ્રભ ભગવાન : વૈજ્યન્ત વિમાનમાં

આપણા ચરિત્રનાયક ચંદ્રભૂને વૈજ્યન્ત વિમાનમાં તેનીસ સાગરનું આયુ હતું; દેવલોકનો આ અંતિમ ભવ હતો; હવે માત્ર એક મનુષ્યભવ બાકી હતો. વૈજ્યન્ત વિમાનમાં અહમિન્દ્રપણે તેઓ નિર્દોષ જીવન જીવતા હતા ને આત્મસાધના કરતા હતા. તેમને ગમનશક્તિ તો ઘણી હતી પણ વ્યાકુળતા ન હતી તેથી સ્વસ્થાન છોડીને તેઓ જ્યાં ત્યાં ઘૂમતા ન હતા. ચિત્તમાં અપાર જિનેન્દ્રભક્તિ હોવા છતાં તીર્થકરોના પંચકલ્યાણકમાં પણ તેઓ મનુષ્યલોકમાં આવતા ન હતા. તેમના અવધિજ્ઞાનમાં જાણવાની શક્તિ તો ઘણી હતી પણ વારંવાર જ્યાં ત્યાં ઉપયોગ ભમાવતા ન હતા...કોઈવાર તીર્થકરપ્રભને દેખી લેતા હતા. અમૃત પોતાના કંઠમાં જ ભર્યું હોવા છતાં, હજારો વર્ષો સુધી તે અમૃતપાનની પણ ઈચ્છા તેમને થતી ન હતી. અહા, શૈતન્યરસમય વીતરાગી અમૃતથી તેમનું જીવન એવું તૃપ્ત હતું કે દેવલોકનું દિવ્યઅમૃત પણ તેમને લવચાવી નહોતું શકતું. તેમના દેવવિમાનમાં કરોડો દેવો રહેતા, પણ તેમાં કોઈ મોટા—નાના ન હતા; બધા જ સરખા, પોતે જ પોતાના ઈન્દ્ર (અહમિન્દ્ર) હતા; બધાય સમ્યગદિષ્ટ, આત્મજ્ઞાની ને સ્વાનુભૂતિવંત હતા, અને ભેગા મળીને તેની જ ચર્ચા કરતા હતા. આ રીતે આપણા ચરિત્રનાયક આત્મિક શાંતિની પ્રધાનતા સહિત તે દેવલોકમાં, સિદ્ધ ભગવંતોની પાડોશમાં અસંખ્ય વર્ષો સુધી રહ્યા.

પછી, આ ભવચ્યકના અંતિમ ભવમાં, તે મહાત્મા કયાં અવતર્ય ને કેવી રીતે સુંદર આત્મસાધના પૂર્ણ કરીને, સર્વજ્ઞ પરમાત્મા (ચંદ્રપ્રભતીર્થકર) થયા—તે હવે આપણે જોઈશું.

[દીતી શ્રી ચંદ્રપ્રભ—ચરિત્રમાં, પૂર્વભવમાં પદ્ધનાભ રાજ્ય, વૈરાગ્યપૂર્વક મુનિદીલા,  
સૌણ ભાવના, તીર્થકરપ્રકૃતિ અને દેવલોકગમન—તેનું વર્ણન પૂરું થયું.]

## ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભ-તીર્થકરનો અવતાર

જેમ ચંદ્ર-કિરણોના સંસરથી ચંદ્રકાન્તમણિમાંથી અમૃત જરે છે તેમ હે ચંદ્રસ્વામી ! આપનાં વચન-કિરણોના સંસરથી અમારા જેવા ભવ્યાત્માઓના અંતરમાં વીતરાગી ધર્મરૂપી અમૃત જરે છે... શાંત-રસનો સમુદ્ર આપના દર્શનથી ઉલ્લસે છે. અહા, દૂરથી પણ આપ અમને આવી શાંતિ આપો છો તો હે પ્રભો ! આપ સ્વયં કેવા શાંતિમય છો !—ને અમારા અંતરમાં આવીને વસતાં અમને જે શાંતિ થાય છે-અહો ! તે તો વચનથી અગોચર અને કલ્યાણથી પાર છે. આવા હે ચંદ્રપ્રભુ ! આપની આ મંગલ જીવનકથાનું આલેખન કરતા અમારું ચિત્ત પરમ હર્ષિત થાય છે.

\*\*\*

### આ છે કાશીદેશની ચંદ્રપુરી નગરી

ઈક્ષુવંશના મહાસેન નામના મહાપ્રતાપી રાજી ત્યાં રાજ્ય કરે છે. તેઓ ઉદાર અને ગંભીર છે, પરાક્રમી અને ક્ષમાવંત છે, વિક્રતા સાથે વિનયવંત છે ને ધની સાથે ધાની પણ છે. તેમના ગુણો કેટલા કહેવા ? ટૂંકમાં એટલું જ બસ થશે કે તેઓ, ભાવ્યાલ્યુને મોક્ષમાર્ગ દેખાડીને ભવધી પાર કરનારા એવા જગતગુરુ અષ્ટમ તીર્થકરના પિતા થવાના છે અને તેમની મહારાણી લક્ષ્મણાદેવી જગમાતા તરીકે પૂજાવાની છે; અહા, જેના ઉદરમાં મહાપવિત્ર તીર્થકરનો મંગલ આત્મા અવતરવાનો છે તેના ગુણોનું શું કહેવું ?

### ચંદ્રપ્રભ-ગર્ભકલ્યાણક

આપણા ચારિત્રનાયક જે પહેલાં પદ્મનાભ રાજી હતા ને હવે ચંદ્રપ્રભ તીર્થકર થશે; તેને વૈજ્યન્તા-વિમાનમાં અસંખ્ય વર્ષો વીતી ગયા; પછી જ્યારે તેનું છ માસ આયુ બાડી રહ્યું ત્યારે, ચંદ્રપુરીનગરીમાં દરરોજ કરોડો રત્નોની વૃદ્ધિ થવા લાગી; તેમજ ઈન્દ્ર દિંગુમારી દેવીઓને લક્ષ્મણામાતાની સેવા માટે મોકલી. તેમજે માતાનો દેહ અશુચી વગરનો શુદ્ધ કરી દીધો.—અહા ! જ્યાં તીર્થકર જેવા પવિત્રાત્મા સવા નવ માસ સુધી રહેવાના છે તે સ્થાન અપવિત્ર કેમ હોય !

દેવીઓનું આગમન, રત્નોની વૃદ્ધિ વગરે આશ્રયકરી બનાવો સાથે છ માસ વીતી ગયા, ત્યારે એકવાર (શાગણ વદ પાંચમે) મહારાણી લક્ષ્મણાદેવી સુંભનિદ્રમાં સૂત્રાં હત્યા રાતના



પાછલા પહોરમાં તીર્થકરના આગમનસૂચક ૧૬ સ્વખો તેમણે જોયા : (૧) ઐરાવત હાથી (૨) વૃષભ-બળદ (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) બે મંગળમાળા (૬) ચંદ (૭) સૂર્ય (૮) મીનયુગલ (૯) બે મંગળ કળશ (૧૦) સરોવર (૧૧) સમુદ્ર (૧૨) સિંહાસન (૧૩) દેવવિમાન (૧૪) નાગેન્દ્રભવન (૧૫) રલાશિ અને (૧૬) નિર્ધમ અર્દિન. અહા, તીર્થકરનો આત્મા પોતાના ઉદરમાં પ્રવેશ્યો તે વખતે જોયેલા આ ૧૬ દ્વિવ્યસ્વખોથી મહારાજાને મહાન હર્ષપૂર્વક રોમાંચ થયો.

સવારમાં મહારાજાને મંગલ સ્વખોની વાત કરી, અને તેનું ફળ પૂછતાં મહારાજાએ કહ્યું : હે દેવી ! તારા ઉદરમાં અષ્ટમું તીર્થકરનું આગમન થયું છે તેની સૂચનારૂપ આ મંગલ સ્વખો છે. દેવી ! તમે મહાકલ્યાણકારિણી છો... આપણા પરમ ભાગ્ય છે કે જગતપૂર્જ્ય આત્મા આપણો ત્યાં અવતરશે. અહા, મોક્ષમાંથી આત્મા આપણો પુન્ત્ર થશે તો આપણો પણ અવશ્ય મોક્ષમાંથી જ છીએ. આમ તેઓ ખૂબ જ હસ્તિનંદ કરવા લાગ્યા.


આ પ્રસંગે ઈન્દ્ર આવીને તીર્થકરના માતા-પિતા તરીકે તેમનું સન્માન કર્યું સ્તુતિ કરી. આપણી નગરીમાં તીર્થકરપ્રભુનો અવતાર થશે—એમ જાડીને આખી ચંદપુરીના પ્રજાજનો ખૂબ જ આનંદોત્સવ કરવા લાગ્યા. સર્વત્ર તીર્થકરના મહિમાની ચર્ચા ચાલવા લાગી : ‘અરે, હજુ તો જે ગર્ભમાં છે, જેનું મુખ પણ આપણો નથી જોયું છતાં આપણને આવો આનંદ આપે છે, —તો પછી તેનું મુખ જોતાં આપણને જે આનંદ થશે—તેનું તો શું કહેયું !!’ ‘વાહ રે વાહ ! એક નાનકડા તીર્થકરને આપણી નગરીમાં હરતા—ફરતા બોલતા આપણે નજરે જોઈશું...ધન્ય થશે આપણું જીવન !’ આકાશમાંથી કરોડો રત્નોની વર્ષા રોજ ચાલુ જ હતી...પણ લોકો હવે તે રત્નોથી ધરાઈ ગયા હત્તા...હવે તો તીર્થકર પાસેથી સમ્યગ્દર્શન—જ્ઞાન—ચારિત્રરૂપ મોક્ષમાર્ગનાં રત્નો દેવા તેઓ આતુર હત્તા, તેથી રત્નવૃદ્ધિનું તેમને આશ્રય થતું ન હતું.

વૈજ્યન્ત વિમાનમાંથી પ્રભુ અહીં પદ્ધારતાં તે વિમાનની શોભા ઘટી ગઈ ને આ ચંદપુરીની શોભા વધી ગઈ. પુદ્ધગલના પિંડમાં કથાં શોભા છે !—એ શોભા તો ચિદાનંદ પ્રભુના સાન્નિધ્યને લીધે જ છે. આ વિશ્વાની શોભા ચૈતન્યતત્ત્વને લીધે જ છે. વિશ્વમાં જે કાંઈ શોભા કે સુંદરતા છે તે જિનધમની આરાધનાને લીધે જ છે. જિનધમ વગરનું શું સ્વર્ગનું દેવપદ પણ શોભે છે ? ના રે ના, એ તો મરુદા જેવું કે નરક જેવું છે.

સામાન્યપણે સ્વીઅવતાર તો નિંદ ગણાય, છતાં લક્ષ્મણાદેવી, તીર્થકરના આત્માના સ્પર્શથી સ્વીઅવતારમાં પણ શોભી ઉઠ્યા ને જગતમાં પૂર્જ્ય બન્યા, ઈન્દ્ર પણ તેમનું સન્માન કર્યું. વાહ, ‘દ્વિ—તીર્થકર’નો આવો પ્રતાપ ! તો કેવળજ્ઞાન પામીને સાક્ષાત ભાવતીર્થકર થશે ત્યારના મહિમાની તો શી વાત !!—આવા મહિમાના ચિંતન વડે આત્માના અગાધ સ્વરૂપને લક્ષ્મગત કરીને અનેક જીવો સમ્યકૃત પામવા માંય્યા. આ રીતે પ્રભુ ચંદપ્રભુનો ગભકુલ્યાણક પ્રસંગ ઘણાય જીવોને કલ્યાણનું કારણ થયો, ને સર્વત્ર આનંદ—મંગલનું વાતાવરણ ફેલાઈ ગયું.

## ચંદ્રપ્રભ-જન્મકલ્યાણક

ચંદ્રપુરીમાં આનંદપૂર્વક બીજા નવ માસ વીતી ગયા. માગશર વદ અગિયારશ આવી....બધાય ઉત્તમ ગ્રહોનો સર્વોત્કૃષ્ટ સુયોગ હતો. હજુ તો મધ્યરાત વીતી હતી, અંધારી રાત હતી છતાં ચંદ્રપુરીનગરી એકાએક કોઈ દિવ્ય પ્રકાશથી ઝળળી ઊઠી. સૌ આશ્રય પામ્યા : અરે, આ શું છે ! અંધારી રાતે આ દિવ્ય પ્રકાશ શેનો ! ત્યાં તો દેવોનું આગમન થવા માંડયું ને ખબર પડી કે અહા ! આ ભરતક્ષેત્રના આઠમા તીર્થકર અહીં ચંદ્રપુરીમાં લક્ષ્મણાદેવીની કુંભે અવતર્યા છે...પ્રભુને જન્મ-કલ્યાણક થયો છે તેના આ અજવાળાં છે. પ્રભુના પ્રતાપે જગતનો મિથ્યાત્વઅંધકાર પણ દૂર થશે.—આ પ્રમાણે પ્રજાજનોમાં આનંદનો કોલાહલ ફેલાઈ ગયો.



બીજુ બાજુ—સ્વર્ગમાં, દેવોના દરબારમાં રત્નમય મંગલઘંટ એની મેળે વાગવા માંડ્યા, શંખનાદ અને સિંહનાદ થવા માંડ્યા, તેમ જ દેવોના દુદુંભી વાજો વાગવા માંડ્યા; એ રીતે સમસ્ત દેવલોકમાં પ્રભુજન્મની આનંદ વધાઈ પહોંચ્યો ગઈ. દેવોનાં આસન ધૂળ ઊઠ્યા. અરે, તીર્થકર—વિભૂતિ પાસે ઈન્દ્રવિભૂતિ કુપી ઊઠી. કેમ કે, તીર્થકર ભગવાન જગતને જે ચૈતન્ય-વિભૂતિ દેખાંડરો તેની પાસે હવે જગતના છ્યાંવો અમને (ઈન્દ્રપદની વિભૂતિનેય) તુચ્છ ગણશો,—એવી ચિંતાથી તે ઈન્દ્રાસન પણ ધૂળ ઊઠ્યું. ત્યારે ઈન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્યું : અહા ! આ તો અમારાથી વિશેષ મહિમાવંત એવા ત્રિલોકપૂર્જ્ય તીર્થકરનો ભરતક્ષેત્રમાં અવતાર ! ચાલો....તેમનો જન્મોત્સવ કરવા મધ્યલોકમાં જઈએ.

એ રીતે ઈન્દ્રની આજ્ઞાથી સ્વર્ગપુરીના દેવો ચંદ્રપુરીમાં ઉત્સવ મનાવવા ધામધૂમથી દોડ્યા. એટલા બધા દેવોથી આકાશ છવાઈ ગયું કે સૂર્ય-ચંદ્ર પણ દેખાતા બંધ થઈ ગયા. કદાચ ચંદ્રપ્રભુના આત્મતેજથી ઝંખવાઈને તે સૂર્ય-ચંદ્ર ધૂપાઈ ગયા હશે. દેવોના મુગટના ઝળગાથી ત્યા દિવસ—રાતનો કોઈ ભેદ ન રહ્યો. અસંખ્ય દ્વીપ—સમુદ્રાંશુ આ મધ્યલોક ઉપર બધે સૌધર્મ—ઈશ્યાન સ્વર્ગ છે; સૌધર્મ સ્વર્ગમાં લાખલાખ વિમાનોની ઉર શ્રેષ્ઠી છે, તેમાં દિક્ષિણ દિશાની છેલ્લી શ્રેષ્ઠીના ૧૮મા કલ્યાણમાં સૌધર્મઈન્દ્રનું રહેઠાણ છે; તે જો કે અહીંથી અસંખ્ય યોજન દૂર હે પરંતુ ઉત્લાસને લીધે ઈન્દ્ર એટલી બુધી જરૂરથી આવ્યો કે એક ક્ષણમાં અસંખ્ય યોજનનું અંતર કાપીને ચંદ્રપુરીમાં આવી પહોંચ્યો.

ઈન્દ્રની દિવ્યસેનામાં એક દેવે, દેવને બદલે તિર્યચનું (ઐરાવતી હાથીનું)- રૂપ ધારણ કર્યું છતાં તેને ભેદ ન થયો પણ ઉત્લાસ થયો કે : ‘અહા, મારા ઉપર બાલ—તીર્થકર પ્રભુની સવારી થશે.. એ મોક્ષગામી મહાત્માના નીકટ સ્પર્શથી હું ધન્ય બનીશ ને હું પણ જરૂર મોક્ષગામી થઈશ... અહા, તીર્થકરની સેવાનું આવું ભાગ્ય આ દેવપર્યાયમાં મને ક્યાંથી ?’ પહેલાં તો મહાન ગૌરવથી તે દેવ એક લાખયોજન મોટા હથીનું રૂપ બનાવ્યું...પણ પછી જેમ જેમ ચંદ્રપુરીની નજીક આવ્યો તેમ તેમ ભગવાનની ભવ્યતા

પાસે તેને પોતાની તુચ્છતા સમજાણી એટલે તે પોતાનું રૂપ નાનું-નાનું કરતો ગયો ને ચંદ્રપુરી ઉપરના આકાશમાં આવીને થંભી ગયો. તેના ઉપરથી ઈન્દ્ર નીચે ઉત્તર્યો ને ઈન્દ્રજાહીને માતા પાસે જિન-બાળક (દવ્ય-તીર્થકર)ને તેડી લાગવા મોકલ્યો.

તે ઈન્દ્રજાહીએ અંદર જઈને જ્યાં પ્રભુનું ભવ્ય રૂપ દેખ્યું ત્યાં તો તે આશ્રયચક્ષિત થઈ ગઈ. જો કે દેવલોકમાં ઈન્દ્રના દિવ્યરૂપને તે રોજ જોતી હતી છતાં તીર્થકરના રૂપ પાસે તો તેને તે પણ જાંખ્યું લાગ્યું.—ખરું જ છે, ચૈતન્યના અતીન્દ્રિય સુખની પાસે તો ઈન્દ્રિયસુખો જાંખા જ લાગે ને! હવે તે ઈન્દ્રજાહી વિચારમાં પડી ગઈ કે આ બાળકને હું અહીંથી લઈ જઈશ તો માતા-લક્ષ્મણ પુત્રને ન દેખવાથી વ્યાકૂળ બની જશે, એટલે તે બુદ્ધિમતી ઈન્દ્રજાહીએ પોતાની ઉત્તમ વિકિયાથી એવા જ બીજા બાળકનું રૂપ બનાવીને માતાજીની ગોદમાં મૂક્યો ને જિન-બાળકને તેરીને ઈન્દ્ર પાસે ચાલ્યો.

અહા, એ નાનકડા તીર્થકરને ગોદમાં લેતાં જ ઈન્દ્રજાહીનો આત્મા તો જાણે મોકસુખનો આઙ્ગલાદ થયો તેમ આનંદથી જાણજાણી ઉઠ્યો...ચૈતન્ય—સુખની તેને પ્રતીત થઈ ગઈ ને એક ભવમાં મોકસ પામવાનો તેને પરવાનો મળી ગયો. હજુ તો તેની માતા તીર્થકરને તેડશે ત્યાર પહેલાં તો પ્રભુને તેહવાનું મહા સૌભાગ્ય ઈન્દ્રજાહીને મળ્યું.—ધન્ય!

અદ્ભુત આનંદથી પ્રભુને અવલોકતી ને ખેલાવતી તે ઈન્દ્રજાહીએ, ઈન્દ્રના હાથમાં પ્રભુને સોંઘા...અને ઈન્દ્ર તો પ્રભુને તેરીને આનંદથી નાચી ઉઠ્યો...પ્રભુનું દિવ્ય—આશ્રયકારી રૂપ જોવા માટે પોતાના એક હજાર નેત્રોની તાકાત તેણે એક સાથે કામે લગાડી...પ્રભુનું રૂપ જોઈને એ ટૃપ્ત-ટૃપ્ત થયો. તેણે વિદ્યાર્થુ—અંદર અતીન્દ્રિય જ્ઞાનયક્ષુથી દેખાતું ચૈતન્યરૂપ સૌથી મહાન છે, ને બહારમાં હજાર નેત્રોથી દેખાતું આ જિન-રૂપ સૌથી શ્રેષ્ઠ છે. ઈન્દ્ર પોતે તો તે બંને રૂપને નીહાળનારો છે. તેણે ભક્તિ-દ્વારા પ્રસિદ્ધ કર્યું કે જગતમાં જિનપદ શ્રેષ્ઠ છે ઈન્દ્રપદ નહિ.

ઈન્દ્ર જિનપ્રભુને ખોળમાં લઈને ઐરાવત હાથી પર બેઠા. કરોડો દેવ-દેવીઓ આનંદથી નાચી ઉઠ્યા. આકાશમાર્ગો પ્રભુની સવારી મેરુ તરફ ચાલ્યા. પ્રભુના જન્મોત્સવના આનંદની ધૂનમાં, પચાશ હજાર યોજન (ક્રીસ કરોડ કિલોમીટર) દૂર અને ૬૦ કરોડ ક્રિ.મી. ઊંચા મેરુ પર કચ્ચારે આવી પહોંચ્યા....તેની ખબરે ન પડી....ક્ષાણમાં મેરુ પર પહોંચી ગયા. અનેક આકાશગામી મુનિવરો તેમ જ વિદ્યાધરો મેરુવંદના અર્થે આવેલા, તે સૌ પ્રભુના જન્મકલ્યાણકરે જોવા ત્યાં રોકાઈ ગયા. અદ્ભુત જિનમહિમા દેખીને....ચૈતન્યમહિમાના ચિંતનથી અનેક દેવો તેમ જ વિદ્યાધરો સમ્યકૃત્વને પામ્યા.—‘ધન્ય અવતાર !’

હવે પ્રભુનો જન્માલિખેક કરવા દેવો ઉત્સુક બન્યા. તે માટે મેરુથી માંડીને કરોડો યોજન દૂર એવો ક્ષીરોદક નામના પંચમ-સમુદ્ર સુધી દ્વોની હારમાળા ગોઠવાઈ ગઈ....ને ૧૦૦૮ સુવાર્ષરિત્નોના ઘડા ભરી-ભરીને એકબીજાને હથોહાથ આપવા મંડ્યા. ઈન્દ્ર પોતાના ૧૦૦૮ હાથ બનાવીને તે ૧૦૦૮ કળણોથી એકસાથે બાળક-તીર્થકરનો જન્માલિખેક કર્યો. ચારેકોર દેવી-વાજાં વાગવા મંડ્યા. અલિખેક પછી ઈન્દ્રજાહીએ પ્રભુને દેવલોકના દિવ્ય વસ્ત્રાલંકારોથી શાશગાર્ય, સાથેસાથે પોતાના આત્માને દિવ્ય પુણ્યથી અલંકૃત કર્યો.અહીં કટાક્ષયુક્ત અલંકારથી પુરાણકાર કવિ કહે છે કે અરે, ઈન્દ્રજાહીની જરૂતા તો જુઓ—કે વસ્ત્રવગરના નિર્ગંથ-દિંગંબર બાલતીર્થકરને તેણે સંગ્રંથ કર્યા. અહા, તીર્થકરનો મહિમા તો જુઓ! દેવો જેના સ્નાન માટે પાણી ભરે છે, ઈન્દ્ર જેને નવડાવે છે ને તે માટે અહીં કરોડ યોજન ૧૫૦ અબજ (૧૫૦,૦૦૦૦૦૦૦૦૦ ક્રિ. મીટર) દૂરથી ક્ષીરસમુદ્રનું જળ ભરી લાવે છે, ક્ષીરસમુદ્ર જેની તાંબાકુંડી છે,

પાંડુકશિલા જેનો પાટલો છે, સ્નાન માટેનો દૈવીરત્નકળશ તો આશ્રમ ઉપજાવે એવારો મોટો (આઈ યોજનનો) છે. સ્નાન પછી સ્વર્ગનાં આભૂષણો વડે ઈન્દ્રજાહી જેને શાશગાર સજે છે; આવા અલોકિક જેનાં પુષ્ય, તેની અંદરની આત્મસાધનાની શી વાત !!

આનંદમય જન્માભિરેક બાદ ઈન્દ્ર મેરુ ઉપર તાંડવનૃત્ય કર્યું અને તે બાલતીર્થકરને 'ચંદ્રપ્રભ' એવું સંબોધન કરીને સ્તુતિ કરી :-

'ચંદ્રની પ્રભા જેવા શોભાયમાન હે દેવ ! આપ આ ભરતકોત્તના આઈમા તીર્થકર છો.... ભવ્યજીવોના અંતરમાં સુખના સમુદ્રને ઉધાળવામાં આપ ! ચંદ્રરૂપ છો... આપના રત્નત્રયધમનો આશ્રમ કરીને અનેક જીવો ભવસમુદ્રને તરી જશે. ભવસાગરની વર્ચ્યે રૂબતા જીવોને માટે આપ જહાજ સમાન છો. પ્રભો, આપનાં દર્શન અને આપના માર્ગનું સેવન જીવોને વિષય-કણાયના પાપોથી છોડાવે છે ને વૈરાગ્યમય સુખમાં જોડે છે! પ્રભો ! આપની સેવાથી, જીવોને ઈચ્છાયા વગર પણ સુખ મળે છે. જેના હૃદયમાં આપ બિરાજો છો તે ભવ્યાત્માને મોક્ષસાધનામાં કોઈ વિઘ્ન આવતું નથી; જગતની સંપદા સામેથી ચાલી આવીને તેની સેવા કરે છે. અહા, દેવો અને મનુષ્યોની તો શી વાત ! પરંતુ પશુઓ પણ આપની સેવાથી પોતાનું કલ્યાણ કરશે. જેને આપના પ્રત્યે ભક્તિ નથી તેનું જીવન પશુ કરતાં ય તુચ્છ છે.'

ઈન્દ્ર સ્તુતિ કરે છે : 'હે ચંદ્રપ્રભ દેવ ! આપને હવે ભવનો અભાવ થઈ ગયો... આપ જન્મરહિત થઈ ગયા; હવે આપ મોક્ષને જ ધારણ કરશો, ભવને ધારણ નહિ કરો. સ્વાનુભૂતિગમ્ય આપનો મહિમા ખરેખર અદ્ભુત ને અચિત્ય છે.' આ પ્રમાણે સહદ્યજીએ સ્તુતિ કરતાં-કરતાં થાકીને છેવટે ઈન્દ્ર કહે છે—અરે, આપના સંપૂર્ણ ગુણોની સ્તુતિ કરનાર હું કોણ ? આપના સંપૂર્ણ ગુણોની સ્તુતિ તો દૂર રહો, જે ભવ્ય આપના પ્રત્યે શ્રદ્ધાથી માત્ર 'નમ' એવા બે અક્ષર કહે છે, તેનાં પણ બધા પાપો નાચ થઈ જાય છે ને આપના જેવા ગુણો તેને પ્રાપ્ત થાય છે. (—વન્દે તદ્ગુણાં-લબ્ધયે....) આમ વિચારીને ઈન્દ્ર પ્રભુ ચરણોમાં અતિ ભક્તિપૂર્વક સાચાંગ નમસ્કાર કર્યા.... અને પછી પ્રભુની સવારી લઈને પુનઃ ચંદ્રપુરીમાં આવ્યા.

અહા, ચંદ્રપુરીના હષ્ઠોત્સવની શી વાત ! જ્યાં સામાન્ય દેવવિમાન આવતાં પણ લોકો આશ્રમ પામી જાય, ત્યારે અહીં તો દેવલોકની વિભૂતિ લઈને ઈન્દ્ર, પોતે ચંદ્રપુરીમાં આવ્યો અને તે ઉપરાંત બાલ-જિનેન્દ્રનું આગમન થયું... પછી તો આનંદ-આશ્રમની શી વાત !! વળી બીજું એક આશ્રમ એ બન્યું કે પંદર-પંદર મહિનાથી ચંદ્રપુરીમાં જે કરોડો રત્નોની દરરોજ વૃદ્ધિ થતી હતી તે રત્નવૃદ્ધિ આજથી બંધ થઈ ગઈ. 'ભગવાન નહોતા અવતર્યા ત્યાં સુધી તો રત્નવૃદ્ધિ થઈ ને ભગવાનનો અવતાર થતાં જ તે બંધ કેમ થઈ ગઈ ?' — હા... બરાબર છે ! — કેમ કે ભગવાન તીર્થકર જગતને જે સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગનાં રત્નો આપશે તેની પાસે હવે આ જડ-રત્નોની શી ગણતરી ? મોક્ષનાં રત્નો છોડીને આ જડ-રત્નોને કોણ લેશે ? આ તીર્થકર-રત્નના સાક્ષાત દર્શન પછી જડ રત્નોની સામે હવે કોણ જોશે ? બસ, એટલે જ તે રત્નોની વૃદ્ધિ શરમાઈને બંધ પડી ગઈ.

ઈન્દ્રે ભગવાનના માતા-પિતાનું સન્માન કર્યું; તેમની સમક્ષ મહાન આનંદ સહિત નાટક કર્યું... તાંડવ નૃત્ય કર્યું. એ રીતે ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભજિનનો જન્મોત્સવ ઉજ્વાને તે પાછે સ્વર્પુરીમાં ચાલ્યો ગયો. કહે છે કે ઈન્દ્રે જાતી વખતે બાલતીર્થકરના અંગૂઠામાં અમૃત મૂક્યું, તે ભગવાન ચૂસતા—અરે ભાઈ ! તીર્થકરના પોતાના સર્વ-આત્મપ્રદેશોમાં ચૈતન્યનું અમૃત ભર્યું હતું... તેને તેઓ ચૂસતા હતા.... તે ચૈતન્ય અમૃતની

મીઠાસ પાસે દેવલોકના જડ-અમૃતની શી ગણતરી ? એટલે ઈન્દ્ર બિચારો શરમાઈને તે અમૃત પ્રભુચરણોમાં છોડી ગયો હતો !

બાલતીર્થકર—ચંદ્રપ્રભ, શુક્લપક્ષના ચંદ્રની જેમ રોજરોજ વૃદ્ધિગત થવા લાગ્યા. સુપાર્શ્વનાથ તીર્થકરના મોક્ષગમન પછી ૮૦૦ કરોડ સાગરોપમ વીત્યા બાદ ભગવાન ચંદ્રપ્રભ—તીર્થકર થયા. દશલાખપૂર્વ તેમનું આયુષ્ય હતું. ૧૫૦ ઘનુષ. (=૧૫૦૦ ફૂટ, ૪૫૦ મીટર) ઉંચો તેમનો દેહ હતો. ચંદ્રલક્ષ્માણી ચિહ્નિત ચંદ્રપ્રભુનો તે દેહ ચંદ્ર કરતાંય વધારે કાંતિમાન તથા વધારે સૌમ્ય હતો, અને તેમની અંદરની ભાવલેશ્યા તો એનાથીયે વધુ ઉજ્જવળ હતી. એ અમૃતભોજ મહાત્માના શરીરમાંથી જાણે અમૃત જરૂર હતું હતું. દેવીઓ તેમને આનંદથી રમાડતી, જૂલાવતી, મંગલ ગીત ગાતી ને તેમની સાથે મધુર વાર્તાવાપ દ્વારા તેમના અમૃત જેવા વચનો સાંભળીને ઘન્ય બનતી.



જૂલો રે જૂલો પ્રભુજી જૂલો રે જૂલો....

નાનકડા હે જિનરાજા, શાનજૂલે જૂલો....પ્રભુ જૂલો રે જૂલો.

માતા જૂલાવે, દેવી જૂલાવે, હાથી પણ જૂલાવે....કુંવર જૂલો રે જૂલો.

કેવળજ્ઞાને કૂદકો મારી સમક્ષિત જૂલે જૂલાવો....પ્રભુજી જૂલો રે જૂલો.

આકાશે જેમ ચંદ્ર જૂલે પ્રભુ ચૈતન્યજૂલે જૂલો....પ્રભુ જૂલો રે જૂલો....

અહા, તીર્થકરની સાથે રહીને તેમની સેવા કરવાનું સૌભાગ્ય મળતાં પોતાની દેવીપર્યાયને પણ તેઓ ઘન્ય માનતી. આ પ્રકારનું ભાગ્ય શું સ્વર્ગની બધી દેવીઓને મળે છે ?—નહીં; મહા ભાગ્યવતી કુમારિકા મોક્ષગમિની દેવીઓને જ તે લાભ મળે છે. સ્વીપર્યાયને નિંદ્ય ગણવામાં આવી છે પણ તે વાત દેવીઓને, ઈન્દ્રાણીને કે લક્ષ્મણમાતાને લાગુ પડતી ન હતી. માતા—લક્ષ્મણાદેવી તો તીર્થકરની માતા બનીને જગતના સર્વશ્રેષ્ઠ નારી બન્યા હતા, ને તેમની પર્યાય ઘન્ય છે—એમ ઈન્દ્રોએ પણ સ્વીકાર્ય હતું.

ચંદ્રકુમાર સૌને આનંદ પમાડતા ઉછરી રહ્યા હતા. જેમ કિંમતી રત્ન, જવેરીઓની વચ્ચે હાથોહાથ એક હાથમાંથી બીજા હાથમાં ફરતું રહે...ને જવેરીઓ તેને દેખીને આનંદિત થાય, તેમ આ તીર્થકર—રત્નને હાથોહાથ તેરીને રાજપરિવારના સભ્યો આનંદિત થતા હતા. એ બાલ-ચંદ્રની સાથે દેવ-બાળકો (—બાળકનું રૂપ ધારણ કરેલા દેવો) આનંદકારી રમત-ગમત કરતા; કયારેક નાનકડા હાથીનું રૂપ ધારણ કરીને સુંધરી જૂલે બાલતીર્થકરને જુલાવત્ત; કયારેક ભગવાન પોતે, દેવોએ બેટ આપેલા હિંય વાજિંત વગાડતા અને

મંગલ ચૈતન્યગીત ગાતા, ત્યારે, શ્રોતુઓ મંત્રમુખ બની જતા : 'અહો રૂપં! અહો ધ્વનિ!' શું તેમનું અદ્ભુત રૂપ ને શી તેમની મધુર વાણી !!—જાણો કે તીર્થકર થયા પહેલાં જ લોકોને તેમની દિવ્યધ્વનિનો સ્વાદ મળવા લાગ્યો. અહા, તીર્થકરની સાથે રહીને તેમને હસતાં-ખેલતાં-બોલતાં નજરે જોવા એ કંઈ સાધારણ વાત છે ! સાતમાં તીર્થકરના મોક્ષાંમને પછી અસંખ્યાત વર્ષો બાદ ભરતક્ષેત્રના જીવોને આ આઠમાં તીર્થકરના દર્શનનું મહાભાગ્ય મળ્યું. માત્ર ચંદ્રપુરીના જ નહિ, દેશોદેશના પણ હજારો ભવ્ય જીવો રોજ રોજ તેમના દર્શન કરવા રાજમહેલના આંગણે ઉભરાતા. પ્રસન્નચિત રાજકુમાર કોઈ વાર રાજમહેલના ઝડુખામાં ઉભા રહીને તેમને દર્શન દેતા; તો કોઈ વાર મહેલની બહાર આવી લોકો સાથે પ્રસન્નતાથી વાત પણ કરતા. અહા, નાનકડા પરમાત્માના દર્શન પામાને ભારતના લોકો ફુતાર્થ બનતા. તે તીર્થકર-રાજકુમાર કોઈવાર હાથી ઉપર બેસીને નગરીમાં ફરવા નીકળત્યે ત્યારે નગરજનો તેમને દેખીને અવષેણીય આનંદ પામતા. અહા, હાલતા-ચાલતા ભગવાન...તે ભગવાનન્યાં સાંક્ષાત્ક દર્શનથી જે આનંદ થાય તેની શી વાત !! બચપણમાં રેઓ કચારેક 'જલકીડા' તો કરતા 'પણ' 'જરૂરીયા' કદી નહોતા કરતા. ગંગાનદી રાજમહેલને સ્પર્શને જ વહેતી હતી; કચારેક નાનકડા ચંદ્રકુમાર એ ગંગાનદીમાં નૌકા વિહાર કરતા; પ્રભુચરણના સ્પર્શો ગંગાનદી પાવન બનતી; અને ઘણું કરીને ત્યારથી જ લોકો એ ગંગાજળનો મહિમા કરવા લાગ્યા. એ લાગીલા રાજકુમાર; કોઈક વાર મહેલમાં ગુપ્યુપ્યુસંતાઈ જતા, માતા-લક્ષ્મણા તેમને શોધવા ગોપ્તાગોત કરતા, 'બોટા ચંદ્ર...ઓ ચંદ્ર !' એમ કહીને સાદ પાડતા; એમ, તેમને પરેશાન કરીને પછી એકાએક 'મા...મા...' એમ બોલતા કુમાર બહાર આવી તેમને વળગી પડતા. એ રીતે બાળદ્વારાવડે માતાને આનંદ પમાડતા. મા તેને ઊઠાવીને અતિ વાત્સલ્યથી ચૂંભી લેતી ને તેના માથે હાથ ફરવીને અપાર વહાલ વરસાવતી.

### ચંદ્રપ્રભુનું પંચમગુણસ્થાન-આરોહણ તથા રાજ્યાભિષેક

બાલયોગ્ય કિલ્લોલ કરતાં કરતાં ને સૌને આનંદ પમાડતા-પમાડતા, તે પ્રભુ જ્યારે આઠ વર્ષના થયા ત્યારે સહજવૃત્તિથી સ્વયમેવ દેશબત્ત ધારણ કરીને પંચમગુણસ્થાને પહોંચ્યા. પહેલાં ચાર કષાયોનો તો અભાવ કર્યો જ હતો, હવે બીજાં ચાર કષાયોનો નાશ કરીને આત્મસાધનમાં આગળ વધ્યા. હજ આઠ વર્ષના થયા ત્યાં તો આઠ કષાયોને તોડી નૂંખ્યા. તેમનું જીવન પાપ, વગરનું પવિત્ર તો હતું જ, તેમાંય દેશબત્ત ધારણ કરતાં તેમની વિશુદ્ધિ ઘણી વધી ગઈ.

ગુણોમાં વૃદ્ધિગત થતા થતા તે બાલપ્રભુ હવે યુવાન થયા, અને રાજસેભાના કાર્યમાં પણ ભાગ લેવા લાગ્યા. મહારાજાએ તેમના વિવાહ પણ કર્યા; જો કે તેમને કોઈ ઇન્દ્રિયવિષયોની આશા કોઈ ન હતી, તેમ જ પ્રજા ચાસેથી કર લેવાની પણ જરૂર ન હતી; તેમનું ચિત્ત તો મોકલક્ષ્મીમાં જ લાગેલું હતું.

રાજકુમાર ચંદ્રપ્રભના આયુનો ચોથો ભાગ એટલે અઢી લાખ પૂર્વ જ્યારે વીત્યા ત્યારે મહારાજાએ ધામધૂમપૂર્વક તેમનો રાજ્યાભિષેક કર્યો. પ્રજાજનો ખુશ થયા; ખરેખર પ્રજાના હદ્ય-સિંહાસને તેઓ બિરાજતા 'હતા' અરે, જન્મથી જ ઇન્દ્ર જેના સેવકપણો વર્તે છે એવા તે ભગવાન માત્ર ચંદ્રપુરી કે કશીદેશના જ નહિ, ત્રણ લોકના અધિપતિ હતા. તેઓ રાજ્યશાસનની સાથે સાથે ધર્મશાસન પણ કરતા હતા.

### ઉવે ચાલો.... ચંદ્રપ્રભ-મહારાજાના રાજ્યદરખારમાં

અહા, મહારાજા ચંદ્રપ્રભનો રાજ્યદરખાર કેવો ભવ્ય છે ! તેની શોભા અદ્ભુત છે; પણ તે રાજ્યસભામાં રાજકાર્યની ચર્ચા બહુ ઓછી થાય છે, કેમકે પ્રજાજનો સર્વ વાતે સુખી છે. ક્યાંય યુદ્ધ-દુષ્કળ-રોગચાળો કે લૂટકાટ વગરે કોઈ દુઃખ કે ભય નથી, તેથી પ્રજાને કાંઈ ફરિયાદ કરવાનું રહ્યું નથી. રાજ્ય સુવ્યવસ્થિત ચાલે છે; તેથી તે સંબંધી વિશેષ ચર્ચાની રાજ્યસભામાં જરૂર જ પડતી નથી. એટલે રાજ્યસભામાં પણ વિશેષ સમય ધર્મની ચર્ચા થાય છે; સૌ જિનધર્મનો મહિમા ગાય છે, અને તેમાંય કચારેક-કચારેક મહારાજા ચંદ્રપ્રભ પોતે ચૈતન્યતત્ત્વની સુંદરતાનું અદ્ભુત વર્ણન કરે છે ત્યારે તો, એ તીર્થકરના શ્રીમુખથી ચૈતન્યમહિમા સાંભળીને સભાજનો મુગધ બની જાય છે. ચાલો, આપણે પણ તેમના એક મધુર ગીતનો નમૂનો ચાખીએ.—

આતમા આતમા આતમા રે....અહો અદ્ભુત ચિદાનંદ આતમા....  
જેને દેખતાં તું થઈશ પરમાત્મા રે....અહો અદ્ભુત ચિદાનંદ આતમા....  
તારામાં શાંત થા, ધર્મત્યા જીવ થા; સ્વરૂપ બહાર તું ભમ મા રે....અહો  
સમ્યક્ દાસ્તિ થા, ભમ મટાડી, આનંદસ્વરૂપે તું લીન થા રે....અહો  
આનંદનો દરિયો જ્ઞાન સ્વરૂપી, ઉછળે....એમાં તું ભગ્ન થા રે....અહો  
આવી ગયો છે....અવસર રૂડો, શાંત સ્વરૂપે તું સ્થિર થા રે....અહો  
આતમરામ આ સુંદર મજાનો, દેખો...દેખો....નિજ અંતરે રે....અહો

જાણો મધુર ચૈતન્યબંસરી વાગતી હોય તેમ પ્રભુ આત્મગીત ગાતા. પ્રભુના શ્રીમુખે ચૈતન્યમહિમા સાંભળતાં-સાંભળતાં કેટલાક જીવો ઊડા ઊતરીને આત્મઅનુભવ પણ કરી લેતા... જાણો કે અત્યારથી જ પ્રભુએ ધર્મતીર્થનું પ્રવર્તન શરૂ કરી દીધું હોય ! આ રીતે તેમના પ્રતાપે રાજ્યસભા પણ ધર્મસભા જેવી શોભી ઊઠતી. ચંદ્રપુરીમાં સાચે સાચું ધર્મરાજ્ય હતું. ખરેખર ભાગ્યશાળી હતા ત્યાંના નગરજનો, કે જેમને તીર્થકરના દર્શન થતાં ને તેમની સાથે વાત કરવાનું તથા ધર્મશ્રવણનું મહાભાગ્ય પણ મળતું.

### મહારાજા ચંદ્રપ્રભ-વૈરાગ્ય

એ રીતે સુખપૂર્વક રાજ્ય કરતાં-કરતાં બીજા પાંચ-લાખ પૂર્વ વીતી ગયા. ૧૦ લાખમાંથી કુલ સાડાસાત લાખ પૂર્વનું આયુષ્ય વીતનું. ત્યારે એક દ્વિવસ ચંદ્રપ્રભ મહારાજાનો રાજ્યદરખાર ભરાયો હતો; આજે પ્રભુની જન્મતિથિ (આગશર વદ ૧૧) હતી, તેથી આનંદોત્સવ થઈ રહ્યો હતો... એવામાં અચાનક એક આશ્રમ્યકારી બનાવ બન્યો. શું બન્યું ? તે સાંભળો—



એક અત્યાંત વૃદ્ધ ભયભીત પુરુષ લાકડીનો ટેકો લઈ, રાજ્યસભામાં આવ્યો, ને મહારાજ ચંદ્રપ્રભને નમસ્કાર કરી ધૂજતો-ધૂજતો દુઃખપૂર્વક હહેવા લાગ્યો : હે મહારાજ ! આપ દેવોથી પણ પૂજ્ય છો, આપનું હદ્ય દયાળું છે, આપ શરણાગત-વત્સલ છો; પ્રજાનાં દુઃખ દૂર કરનારા છો. હે દેવ ! હું બહુ દીન-ભયભીત છું; આપ મારી રક્ષા કરો. મને બચાવો !

મહારાજાએ દ્યાભરી નજરે પૂછ્યું—ભાઈ ! તને શું દુઃખ છે ? શેનો ભય છે ?

વૃદ્ધ બ્રાહ્મણો કહ્યું : હે સ્વામી ! એક નિમિત્તશાનીએ મને કહ્યું છે કે આજ રાતે જ તારું મૃત્યુ થઈ જશે. તેથી મૃત્યુથી હું બયબીત છું કોઈ વિષયોમાં મને ચેન નથી; માટે આપ મને મૃત્યુથી બચાવો. અરેરે, શું આપના દેખતાં યમરાજ મને મારી નાંખશે ? હે સ્વામી ! જો તમે મને મૃત્યુથી ન બચાવી શકો તો પછી આપ 'મૃત્યુંજ્ય' કેમ કહેવાશો ?

બ્રાહ્મણની આ વાતનો એક મંત્રીએ જવાબ દેવા માંજ્યો : હે ભાઈ ! તું ધીરજ રાખ. આયુષ પૂરું થતાં મૃત્યુ બધાય પ્રાણીઓને આવે જ છે. તે મૃત્યુથી કોઈ ઇન્દ્ર-નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ બચાવી શકતા નથી. ભગવાન ચંદ્રપલ—મહારાજાએ આત્મસાધના વડે મોક્ષને સાધીને મૃત્યુને જીત્યું છે તેથી તેઓ 'મૃત્યુંજ્ય' છે.—નેર્ણી કે બીજા જીવોને મૃત્યુથી બચાવી લેવા માટે. હા, એટલું ખરું કે ભગવાને બતાવેલા મોક્ષમાળને જે ઉપાસે તે મૃત્યુને જીતી શકે ને અમર પદને પામી શકે. ભગવાન જગતને માર્ગ દેખાડનારા છે પણ જગતના કર્તા-હર્તા નથી.

હજુ તો મંત્રી જવાબ આપે છે, ત્યાં તો એકએક બ્રાહ્મણ રૂપધારી તે પુરુષ ત્યાંથી અંતધિન થઈ ગયો....સભાજનો એકદમ આશ્વય પામી ગયા. પણ મહારાજ ચંદ્રપલ તો અત્યંત ગંભીર થઈને કોઈ ઊંડા વિચારમાં ઉત્તરી ગયા હત્તા.

સભાજનો પૂછ્યું—મહારાજ ! આ બધું શું છે ? એકએક આ શી આંશ્વર્યકારી ઘટના બની રહી છે ? આપ આવા ગંભીર વિચારમાં કેમ ઉત્તરી ગયા છો ?

ત્યારે અવવિજ્ઞાનથી બધી વિગત જાણનારા મહારાજા ચંદ્રપલ ધીર-ગંભીર સ્વરે બોલ્યા—સાંભળો, હે સભાજનો ! સભામાં જે વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો હતો તે કોઈ મનુષ્ય ન હતો, પણ સ્વર્ગમાંથી એક દેવ, મને વૈરાગ્ય જગાડવા માટે તેવું રૂપ ધારણ કરીને આવ્યો હતો ને જીવનની ક્ષણલંગુરતા બતાવવા તેણે આ યુક્તિ કરી હતી. તેનું કામ પૂરું થતાં તે ચાલ્યો ગયો. ખરું જ છે—સંસારી પ્રાણીઓનું જીવન અનિત્ય છે. અરે, દેવલોકના દેવો ભલે અસંખ્ય વર્ષનું આયુ ધરાવે છતાં તે પણ અંતે તો વિનશ્ચર છે; આયુ પૂરું થતાં તે દેવને કે ઇન્દ્રને પણ કોઈ બચાવી નથી શકતું. માટે આ જીવનમાં આત્માની સાધના પૂર્ણ કરીને, આ ભવચકના જન્મ-મરણનો અંત કરી લેવાનો છે. તેના ઊંડાં વિચારમાં હું હતો: કેમ કે મારો આ અવતાર પૂર્ણ પરમાત્મપદને સાધવા માટે છે; એંધા સંસારમાં રહેવા માંટે મારો અવતાર નથી. ઘણાં વણો મેં રાજપદમાં વીતાવ્યા; ઇન્દ્રની આજ્ઞાથી ધર્મસ્થિ નામનો તે દેવ, બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને મને રાજ્ય-ભોગોથી વિરક્ત કરવા માટે આવ્યો હતો; મને વૈરાગ્ય જગાડીને તે ચાલ્યો ગયો. અત્યાર સુધી મને જે શુભાશુભ કર્મોએ સંસારભ્રમણ કરાવ્યું તે બધા કર્મોને છેદીને હવે હું મોક્ષરૂપ પરમ પદને સાધીશ....તે માટે હું આજે જ જિનદીક્ષા અંગીકાર કરીશ.

સભાજનો તો પ્રભુની આ વાત સાંભળતાં એકદમ ચકિત થઈ ગયા. અરે, આ શી વાત !! બસ, પ્રભુનું ચિત્ત ક્ષણમાં સંસારથી વિરક્ત થઈ ગઈયું; હવે તેમને કોઈ રોકી શકે નહિ. એ વન-કેશરીને હવે ગૃહવાસના પીંજરે પૂરી શક્યતા નહિ. ઘણા પ્રજાજનો તો પ્રભુની પરમ શાંત વૈરાગ્યમુદ્રા દેખીને પ્રસર થયા ને પોતે પણ વૈરાગ્ય પામીને પ્રભુ સાથે જ જિનદીક્ષા લેવાની ભાવના કરવા લાગ્યા. આખી રાજસભા ક્ષણમાત્રમાં વૈરાગ્યસભામાં ફેરવાઈ ગઈ. પ્રભુના જન્મોત્સવનો દિવસ એ જ વૈરાગ્યમય જિનદીક્ષાનો દિવસ બની ગયો.

\* \*

શ્રી ચંદ્રપ્રભુના વૈરાજ્યનો પ્રસંગ ઉત્તરપુરાણમાં બીજી ગીતે આવે છે; તે આ પ્રમાણે—



મહારાજા ચંદ્રપ્રભુ એક દિવસે દર્શણમાં પોતાનું મુખ જોતા હતા... બરાબર એ દિવસે પ્રભુનો જન્મ દિવસ હતો. પ્રભુને દર્શણના પ્રતિબિંબમાં વિશોષતા દેખાયાં... જાણે કે એક સાથે બે પ્રતિબિંબ દેખાતા હોય ! આશ્વર્યથી વિચારતાં તેમને જાતિસ્મરણ થયું. પોતાના પૂર્વભવો દેખાયા. ચક્રવર્તીનો ભવ, મુનિદશા તેમજ દેવલોકનો દિવ્ય ભવ પણ તેમણે દેખ્યો. તેઓ ચિંતવવા લાગ્યા : અરે, ચક્રવર્તીના કે દેવલોકના દિવ્ય ભોગો પણ ક્ષાણભંગુર નશર છે, ત્યાં બીજા ભોગોની શી વાત ! અરે, એવા સુખને તે સુખ કેમ કહેવાય કે જે આત્મામાંથી ઉત્પત્ત ન થયું હોય ને પરાધીન, હોય ? એવી લક્ષ્મીને તે લક્ષ્મી કોણ કહે કે જેનો મોહ કેવળજ્ઞાન—લક્ષ્મીને રોકે ? એવા બંધુજીનો શું કામના કે જેમનો વિયોગ થઈ જાય ! આત્મામાંથી ઉત્પત્ત થયેલું સહજ સુખ તે જ સાચું સુખ છે; કેવળજ્ઞાન—સંપદા તે જ આત્માની સાચી લક્ષ્મી છે; અને સમ્યકૃત્વાદિ અનંત ગુણ પરિવાર તે જ આત્મનો સાચો પરિવાર છે. અરેરે !

એવું સંસારજીવન શું કામનું કે આયુનો અંત થતું જેનો અંત થઈ જાય ! જે આયુને આધીન નથી એવું અનંત સિદ્ધજીવન એ જ આત્માનું સાચું જીવન છે. ભવ—ભવમાં દેહાદિ સંયોગો કેવા બદલતા રહે છે!—થતાં હું તો તે જ છું—ચૈતન્યસ્વરૂપ મારો આત્મા જ મારે માટે ધૂવરૂપ છે, બાકી બધા સંયોગો મારે માટે અધ્યુવ છે.—

મારો સુશાશ્વત એક દર્શન—જ્ઞાન લક્ષ્મી જીવ છે;  
બાકી બધા સંયોગ—લક્ષ્મી ભાવ મુજબી બાધ્ય છે.

અને, પુષ્યક્ષણનો ઉપભોગ પણ અધ્યુવ છે, તે જીવને જિત્ર અને વ્યાકુળ કરે છે; વીતરાજી-કેવળજ્ઞાનમાં જ ખેદ અને થાક વગરના ધૂવ—સુખનો ભોગવટો છે. તેને પ્રાપ્ત કરવા હું આજે જ ચારિત્ર અંગીકાર કરીને મોક્ષને સાધીશ.—ભગવાન ચંદ્રપ્રભ આમ વિચારે છે ત્યાં તો મોક્ષની ધૂતી એવી દીક્ષા, પ્રભુને મોક્ષમાં તેડવા માટે આવી પહોંચી. પ્રભુ મોક્ષસુંદરીને વરવા માટે દીક્ષા લેવા તૈયાર થયા. તે જ વખતે અવધિજ્ઞાનથી તે વાત જાણીને લૌકાંતિક દેવો ત્યાં આવ્યા બ્રહ્મલોક નામના પાંચમા સ્વર્ગમાં ૮ પ્રકારના લાખો લૌકાંતિક દેવો રહે છે; તે દેવર્ષિઓ ઉપશાંતપરિષામી, બાર અંગધારી, વૈરાજી, બ્રહ્મચારી ને એકાવતારી છે. તેઓ માત્ર તીર્થકરદેવના દીક્ષાકલ્યાણક સિવાય બીજા કોઈ પ્રસંગે મધ્યલોકમાં આવતા નથી. ચંદ્રપ્રભુની દીક્ષાના પ્રસંગે તે લૌકાંતિક દેવો ચંદ્રપુરીમાં આવ્યા ને પ્રભુને વંદન કરી, સ્તુતિ દ્વારા વૈરાજ્યની અનુમોદના કરવા લાગ્યા :-

સુખ-દુખમાં જીવ એકલો, જન્મ-મરે જીવ એકલો;  
છે ભવભમણમાં એકલો ને મોક્ષમાં પણ એકલો.

અહો જિનેન્દ્ર પ્રભો ! આત્માના એકત્વને જાણીને આપ જે વૈરાજ્યભાવના ભાવી રહ્યા છો તે

પ્રશંસનીય છે. ચારિત્રદશા માટેનો આપનો નિશ્ચય અતિ સુંદર અને મંગળકારી છે; આપનું ચારિત્ર જગતના જીવોને પણ કલ્યાણકારી છે. અમે પણ એ જ ચારિત્રદશાની ભાવના ભાવીએ છીએ. પ્રભો! આપ મુનિ થઈ શુદ્ધોપયોગ વડે અલ્યુકાળમાં જ કેવળજ્ઞાન પામશો ને હિવ્યધનિ વડે ભરતક્ષેત્રના ભવ્યજીવોને માટે મોક્ષમાગનું પ્રવર્તન કરશો.—ધન્ય આપનો અવતાર!

—આ પ્રમાણે વૈરાગ્યની અનુમોદના કરીને તે લોકાંતિક દેવો ચાલ્યા ગયા. એજ વખતે દીક્ષા માટેની દેવી પાલખી લઈને ઈન્દ્રાંદ્ર દેવો ત્યાં આવી પહોંચ્યા. જન્મોત્સવ કરતાં આ વખતના ઉત્સવની ઘામધૂમ જુદી જાતની હતી. શાંતરસમય આ ઉત્સવ દેખીને. અનેક રાજાઓ તેમ જ પ્રજાજનો વૈરાગ્ય પામ્યા ને પ્રભુના પગલે પગલે વનમાં જવા તૈયાર થયા.



પ્રભુ વનગમન માટે જ્યારે પાલખીમાં આરૂઢ થયા તે વખતે ઈન્દ્ર પ્રભુને સ્વહસ્તાનું અવલંબન આપ્યું... અરે નહિ, પ્રભુના હાથમાં પોતાનો હાથ આપીને ઈન્દ્ર પોતે ભવથી તરવા માટે પ્રભુનું અવલંબન લીધું. અહા, પ્રભો! તમારી સેવાનું આવું ભાગ્ય અમને કયાંથી? ભવચકમાંથી મોક્ષપુરીમાં જવા માટેની આં તમારી છેલ્લી વાહન—સવારી છે; આ વાહન દ્વારા આપને અમારા શિરે લેતાં અમારું છુંબન 'ધન્ય' બન્યું.—આવી ભાવના ભાવતાં ભાવતાં પહેલાં રાજાઓ પાલખી ઉપાડીને ચાલ્યા ને પછી દેવોએ તે પાલખી લઈને આકાશમાર્ગ ગમન કર્યું. પ્રભુ ચૈતન્યસાધનાના વિમલ કાર્ય માટે વનમાં જવા જે પાલખીમાં આરૂઢ થયા તે પાલખી 'વિમલા' કહેવાણી. પ્રભુ તે 'પાલખીમાં બેઠાનેછા' વૈરાગ્યભાવના ભાવતા હતા.

### ચંદ્રપ્રભુએ ભાવેલી ૧૨ વૈરાગ્ય ભાવના

(૨૦૫-હાર્દિકીત જોવ)

જે જ્ઞાન-દર્શન, માહરા તે ધૂવ મારું, રૂપ છે;  
એકત્વ છું ને શુદ્ધ છું બસ, એ જ મારું રૂપ છે.  
ચૈતન્યમથી મુજ આત્મમાં રક્ષિત થઈ રહેનાર હું;  
નથી શરણ જોતું કોઈનું બસ, શરણ આત્મરામનું.  
એકત્વ જોણી આત્મનું બસ! લીન હું મુજ આત્મમાં;  
અન્યત્વ સૌ પરભાવથી, સંયોગનું, તો નામ ક્યાં?  
અનાગા દેહ ને રોળી રીગા તે સૌ ચેતનાથી અન્ય છે;  
એમાંના નથીપાંકડી સુખ મારું, ચિન્તાનું મુજ આત્મને.  
ભર્વચક્કમાં ભમવો છતાં, પરમાત્મા મુજ પાસમાં;  
હું ધ્યાવતો નિજ આત્મને બસ, જઈ રહ્યો છું મોક્ષમાં.

શુચિરૂપ મારો આતમા, હું મહિનને સ્પર્શ નહીં;  
ભાવો અશુચિ રાગના તે આત્મમાં લાવું નહીં.



[ હરખ હવે હું હિન્દુસ્તાન એ રાગ ]

જ્ઞાનતણી નૌકામાં બેઠો, આખ્રવ સર્વે દૂર થયા;  
ભવથી છૂટી મોક્ષે ચાલ્યો, હુઃખડા મારા દૂર થયા.  
સંવર છે મુજ પરમભિત્ર ને હું જ સ્વયં બસ સંવર છું;  
સમ્યક્રૂપી ઢાલ ધરીને, આખ્રવને અટકાવું છું.  
રત્નત્રયમાં વૃદ્ધિ કરતાં, કર્મો ઝર-ઝર તૂટી પડે;  
પરીષહોને સહતો આતમ મુક્તિપુરીમાં આવી રહે.  
લોકભભમણ હવે નથી-નથી, બસ ! લોકશિખરમાં જાવું છે;  
સાદિ-અનંત બસ સુખ જ વેદી, સિદ્ધપુરીમાં વસવું છે.  
મુજ આતમનો ધર્મ જ ચેતન, દર્શન-ચારિત-જ્ઞાન છે;  
ક્ષમા ધરમ છે મુજ આતમનો, રાગ રહિત વીતરાગ છે.  
ભલે બોધિ છે દુર્લભ પણ તે પ્રાપ્ત થતી જિનમારગમાં,  
ધન્ય બન્યો હું બોધિ પામી આનંદ જાયો આતમમાં.  
નથી સુંદર કર્દ જગમાં બીજું, બોધિ મારી સુંદર છે,  
જે બોધિના પરમ બોધથી મુક્તિ મારી અંદર છે.

[ ઇતિ તીર્થકર વૈરાગ્યચિત્તન ]

[મુમુક્ષુઓ આ ભાવના મોઠે કરો, જીવનમાં સંદાય કરું આવશે.]

આવી વૈરાગ્યભાવના બાવતં-ભાવતાં પ્રભુ 'સકલજીતુ' નામના વનમાં પદ્ધાર્ય. સકલજીતુ-વન જેમ સર્વજીતુમાં સર્વપ્રકારનાં ફૂલ-ફળ સહિત ખીલેલું પ્રસત્ર હતું તેમ ભગવાનના અંતરના વનમાં પણ સર્વજીતુમાં સુંદરપણે ખીલેલા રત્નત્રય-પુષ્પાશી ચૈતન્યભાગ શોભી રહ્યો હતો...અહા, ચૈતન્યની અદ્ભુત શોભાને લીધે આખું જગત શોભી ઉઠે છે !

દીક્ષાવનમાં, હજારો-લાખો દેવો ને મનુષ્યો, અરે વનનાં પશુઓ પણ, પ્રભુની વૈરાગ્ય પ્રવૃત્તિને અત્યંત આશ્રયપૂર્વક નીહાળી રહ્યા હતા....આટલા બધા ઈન્દ્રિયવિષયોને તેમજ ઉત્તમ રાજ-ભોગોને પણ છોડીને આ મહાત્મા કોઈ દિવ્ય સાધના કરી રહ્યા છે, તો તે સાધનામાં, ઈન્દ્રિયવિષયોથી પાર કોઈ અચિંત્ય-અતીનિદ્રિય પરમ સુખ પ્રાપ્ત થતું હો !—એમ અનેક જીવોને આત્માના અતીનિદ્રિય સુખની પ્રતીત થઈ જતી હતી ને તેમનું ચિત્ત વિષયોથી વિરક્ત થતું હતું. પ્રભુએ સમસ્ત રાજવૈભવ સહિત વસ્ત્રાદિ સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો અને 'હું નમઃ સિદ્ધેભ્યः' એમ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરી, સ્વયં મુનિદીક્ષા અંગીકાર કરી. તેમની સાથે બીજા એક હજાર મુમુક્ષુજીવો પણ જિનદીક્ષા લઈને મુનિ થયા. મુનિરાજ ચંદ્રમાલને ધ્યાનરૂપ શુદ્ધોપયોગમાં તરત જ સાતમું ગુણસ્થાન, મનઃપર્યયશાન તેમજ અનેક લભિઓ—એ બધું એક સાથે પ્રગટ્યું. મુનિપણું તો પૂર્વભવોમાં પણ તેમણે અલ્યાસેલું હતું જ, તે ઉપરાંત વિશેષ શુદ્ધિપૂર્વક પ્રભુ કેવળજ્ઞાન સાધવા તત્ત્વર બસ્યા.

ધન્ય ચંદ્રપ્રભુ—મુનિદીક્ષાવંત....તેમને નમસ્કાર હો !

મુનિદીક્ષામાં બે ઉપવાસ બાદ પ્રભુને પહેલું પારણું કરાવવાનો (—આહારદાનનો) મહાન લાભ નહિનપુરના સોમદાત રાજાને પ્રાપ્ત થયો; ત્યારે રત્નવૃષ્ટિ વગેરે પંચ-આશ્રય વડે દેવોએ પણ તે દાનનો મહિમા કર્યો. ધ્યાનની બળે પ્રભુએ ઉત્તમ ક્ષમાદિ ધર્માંની આરાધના પ્રાપ્ત કરી અને કોધાદિ કષાયોને મરાણતુલ્ય કરી નાંખ્યા. પછી શુક્લ ધ્યાન વડે સાદ પારીને પ્રભુએ કેવળજ્ઞાનને બોલાયું; એટદે તે કેવળજ્ઞાન, નવલલભિને તથા તીર્થકરપદને સાથે લઈને, એકદમ જરૂપથી નજીક આવી રહ્યું હતું. એમનું વૈરાગ્ય-કવચ એવું મજબુત હતું કે કોઈ ઉપસગ્ન કે પરીષહ એમની આત્મસાધનાને અસર કરી શકતા ન હતા.

મુનિદીક્ષામાંય પ્રેરભુનો પ્રભાવ અચિંત્ય હતો. અનેક મુનિઓ તેમના શરણે આવેતા, અને બોલ્યા વગર પ્રભુના દર્શનમાત્રથી પણ 'તેઓને સૂક્ષ્મ તત્ત્વોનું સમાધાન થઈ' જતું. પ્રભુને પોતામાં તો કોઈ શંકા ન હતી ને તેમની નીકટ આવનાર જીવના અંતરમાં પણ તત્ત્વની કોઈ શંકા રહેતી ન હતી. અરે, એમના શરીરને સ્પર્શાને જે હવા આવતી...તેના વડે પણ રોગીના સર્વ રોગો મટી જતા હતા; એવી અનેક લભિઓ હોવા. ઇતાં પ્રભુને તેનું લક્ષ ન હતું. તેમનું ચિત્ત તો કેવલ્ય-લભિને સાધવામાં જ લાગ્યું હતું.

સાધક-મુનિદીક્ષામાં ચંદ્રપ્રભુ લગભગ ત્રણ માસ રહ્યા....પછી ફણગણ વદ સાતમે તેઓ 'કેવળજ્ઞાન માટે કટિબદ્ધ થયા....ક્ષપકશ્રોડી ચહવા તેયાર થયા; ક્ષાળિક સમ્પર્કત્વ તો તેઓ પહેલેથી જ પામી ચૂકવ્યા હતા; હવે ચૈતન્યના પરમાનંદને તન્મયપણે ધ્યાવતાં-ધ્યાવતાં, મુનિરાજ શ્રી ચંદ્રપ્રભુ મોક્ષની શ્રેષ્ઠી ચઢવા માંડ્યા. ચારિત્ર-મોહનો ક્ષય કરવા માટે શુક્લધ્યાનચકને ધારાડા કર્યું ને શુદ્ધતાના 'અપૂર્વ પરિણામ' વડે આઠમે ગુણસ્થાની આવ્યા. કર્માનું બધન જરૂપથી તૂટવા માંડ્યું; તરત તેઓ નવમાં ગુણસ્થાને પહોંચ્યા.

અહો, હવે એમની વૈરાગ્યપરિણાતિ એટલી બધી વધી ગઈ કે, અત્યાર સુધી (અસંખ્ય વર્ષોથી સતતપણે) તીર્થકરપ્રકૃતિનું જે કર્મ બંધાતું હતું તે પણ હવે બંધ થઈ ગયું, જેની પરિણાતિ અતિ ઝડપથી મુક્તિ તરફ જઈ રહી હોય તે મુમુક્ષુને તો તીર્થકરપ્રકૃતિનું પણ બંધન કેમ પાલવે? અહીં કોધ-માન ને માયારૂપ કષાયોનો તો તેમણે સર્વથા અભાવ કર્યો ને પછી દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લોભને છોડીને સર્વ કષાયરહિત અકષાય-વીતરાગ થયા. તે જ કષેણે, વર્ષે ૧૧મા ગુણસ્થાનને સ્પર્શયી વગર, સીધા ક્ષીણમોહરૂપ ૧૨મા ગુણસ્થાને આવ્યા અને અતિ ઝડપથી (આંખના પલકાર માત્રમાં) બાકીનાં ઘાતી કર્મોને તોડી ૧૩મા ગુણસ્થાને પહોંચીને સર્વજ્ઞ-પરમાત્મા થયા. અહાહા! ધન્ય હતી એ ક્ષાણ! કૃતકૃત્ય હતું એ પરમાત્મપદ! જ્યાં—સર્વ ભાવો અત્યંત શુદ્ધ અને પૂર્ણ જ્ઞાતા-દશારૂપ વર્તતા હતા, અને સાથે અતીન્દ્રિય સુખ પણ પૂર્ણતારૂપ પરાકાશને પામ્યું હતું; તેઓ 'સ્વયંભૂ' ભગવાન હતા કેમકે સર્વજ્ઞતા માટે તેમણે પોતાના આત્મસ્વભાવ સિવાય કોઈ બીજાનું આલંબન લીધું ન હતું. મહાન સંતો પણ એ દશાની અનુમોદના કરે છે—

અત્યંત આત્મોત્પત્ત વિષયાતીત અનુપ અનંત ને  
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગ-પ્રસિદ્ધને.

સર્વજ્ઞલભ્યસ્વભાવ ને ત્રિજગેન્દ્ર પૂજિત એ રીતે,  
સ્વયમેવ જીવ થયો થકો તેને 'સ્વયંભૂ' જિન કહે.

પ્રક્ષીણ ઘાતીકર્મ અનહંદ વીર અધિક પ્રકાશ ને  
ઈન્દ્રિય-અતીત થયેલ આત્મા જ્ઞાન-સૌખ્યે પરિણામે.

અહો, એ જ્ઞાન અને એ સુખના મહિમાની શી વાત!—જેની ઓળખાડા અને પ્રતીત કરતાં મુમુક્ષુજીવને પોતામાં પણ અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય સુખનો સ્વાદ આવી જાય છે એટલે સમ્યગદર્શન થઈ જાય છે.

ચંદ્રપ્રભ ભગવાન સર્વજ્ઞ થયા. સર્વજ્ઞ થતાં જ તેમનો મહાન આનંદસમુદ્ર જાહો કે આખા લોકમાં ઉત્તસ્યો હોય, તેમ ક્ષણભરને માટે ત્રણે લોકના સમસ્ત જીવોમાં બેઘડી સાતાનું વાતાવરણ છવાઈ ગયું.....નરકના જીવો એ સપ્તાના વેદનથી આશ્રયચક્તિ થઈ ગયા ને જિનેન્દ્રમહિમાનું ચિંતન કરતાં કરતાં, સુખસ્વભાવી આત્માની પ્રતીત કરીને કેટલાય જીવો સમ્યગદર્શન પામી ગયા....એ જ રીતે દેવોમાં, મનુષ્યોમાં ને ત્રિયોમાં પણ અનેક જીવો ધર્મ પામ્યા....આઠમા તીર્થકરના ધર્મચક્નું પ્રવર્તન થવા માંજું.

કેવળજ્ઞાની—તીર્થકર પ્રભુના મહિમા પાસે જાહો નમીભૂત થઈ જતું હોય તેમ ઈન્દ્રનું આસન ડેલી ઊક્યું....તે વખતે—ઈન્દ્ર તીર્થકરપ્રભુના કેવળજ્ઞાન-કલ્યાણકનો પ્રસંગ જાહોને, તરત ઈન્દ્રાસન ઉપરથી નીચે ઉત્તરીને, અદ્ભુત મહિમાથી આનંદપૂર્વક તે સર્વજ્ઞદેવને નમસ્કાર કર્યા....અને દેવોના સમૂહસહિત ચંદ્રપ્રભુના કેવળજ્ઞાનની પૂજા કરવા આવ્યો.

પ્રભુએ ચંદ્રપુરીના જે વનમાં મુનિદીક્ષા લીધેલી તે જ વનમાં (ફાગણ વદ સાતમના દિવસે) કેવળજ્ઞાન પામ્યા. ઈન્દ્રની આજ્ઞાથી કુબેરે અદ્ભુત શોભાવાળા સમવસરણની રચના કરી; જાહો દેવલોકની બધી શોભાને અહીં પ્રભુની સેવામાં ઉત્તરી. અને તીર્થકર પ્રભુના સુયોગથી તો તે સમવસરણ-ધર્મદરબારની શોભા એવી વધી ગઈ કે તે જોઈને ઈન્દ્રનેય આશ્રય થયું—કે આવી અદ્ભુત સુંદરતા રચવાની અમારી

શક્તિ નથી; આ અદ્ભુત રૂચના તો તીર્થકરપ્રભુના પુષ્પપ્રતાપે જ થઈ છે, અહા, ઈન્દ્ર પણ જેને દેખીને આશ્રય પામે તે સમવસરણની ને તે ભગવાનની શોભા કેવી હશે!!—જેનો મહિમા વિચારતાં મુમુક્ષુને ચૈતન્યનો મહિમા લક્ષમાં આવે ને સમ્યગુદ્દર્શન થઈ જાય—એવી!

વાહ રે વાહ.....સમવસરણ એટલે તો રત્નત્રય-ધર્મની પેઢી, જ્યાં ‘આત્મગવેણી મુમુક્ષુને’ મનગમતાં ચૈતન્ય-રત્નો મળે છે, ચંદ્રપ્રભુની એ ધર્મનગરી સાડાઆઠ યોજન વિસ્તારમાં ફેલાયેલી હતી. વચ્ચે સમવસરણને સ્પશ્યા વિના જ વીતરાગપ્રભુ ચૈતન્યના સુંદર પિંડલપુરે બિરાજતા હતા. ઉપર રત્નત્રય જેવા સુશોભિત ‘ત્રણ છત્ર’ એમ પ્રસ્તિક્ષ કરતા હતા કે ભગવાને રત્નત્રય વડે આ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે....માટે હે ભવ્ય જીવો! તમે પણ તે રત્નત્રયનું સેવન કરો.

‘અશોકવૃક્ષ’ પ્રસંગતાપૂર્વક એમ બોલી રહ્યું હતું કે—ભગવાન સર્વજ્ઞની સર્વીપત્તો પામીને હું ‘અશોક’ બની ગયું હે ભવ્ય જીવો! તમે પણ ભગવાનના સાત્ત્વિદ્યમાં આવો, પ્રભુનું સાત્ત્વિદ્ય પામીને તમે પણ અ-શોક (શોક વગરના, આનંદરૂપ) બની જશો!

અને ‘દુર્દુલીવાજાં’ દિવ્યાન્પદ વડેં એવી ઘોષણા કરતા હતા કે—આ જિન ભગવાને મોહ શત્રુને જીતીને તેવલ્ય—સામાજ્ય પ્રાપ્ત કર્યું છે....તમે પણ મોહવિજેતા થવા માટે આ પ્રભુના માર્ગો આવો.

દેવ—મનુષ્ય-તિર્થયોનાં યોગેયોનાં ચંદ્રપ્રભુના દર્શન માટે ઉમટયા. જો કે સમવસરણની શોભા કોઈ અદ્ભુત હતી—છત્રાં મુમુક્ષુજીવોનું ચિત્ત તેમાંન લાગ્યું, કેમકે, તેમનું ચિત્ત તો ભગવાન ચંદ્રપ્રભુના દર્શનમાં જ ચોટેલું હતું ને તેમની દિવ્ય વાણી સાંભળવા આતુર હતું.

પ્રથમ ઈન્દ્ર હથ જોડીને સર્વજ્ઞ પરમાત્માની સુત્તિ કરી : અહો—દેવ! આજે આપ પરમાત્મપદને પામ્યા, ચાર ઘાતીકમોને હણીને આપ ‘અરિહત્તા’ બન્યા. ઉત્કષ્ટ જ્ઞાન-દર્શન—સૂખ-વીર્યરૂપ અનંત ચતુષ્યને આત્મામાંથી પ્રગંટ કર્યા. તે ચૈતન્ય-ચતુષ્ય વડે આપ નિરંતર પ્રકાશમાન છો. હે દેવ! મેં આપનું ‘ચંદ્રપ્રભ’ નામ વગર વિચોર્યે રાખી દીધું છે, કેમકે ચંદ તો માત્ર રાત્રે જ પ્રકાશે છે, ત્યારે આપ તો ચૈતન્ય-પ્રકાશવડે દિન-રાત નિરંતર પ્રકાશમાન છો, તેથી આપનું નામ ‘સૂર્ય-ચંદ્રપ્રભ’ રાખતું જોઈએ, એકદું ‘ચંદ્રપ્રભ’ નહીં. પ્રભો! આપ આ ભરતકોત્તાના અષ્ટમ તીર્થકર છો. આપના દિવ્યધ્વનિ વડે ધર્મનું અમૃત પીવા અમે સૌ સભાજનો આતુર છીએ. માટે, હે જિનેશ્વર-પ્રભો! આપના દિવ્ય ઉપદેશ વડે અમને ફૃતાર્થ કરો.

### તીર્થકર પ્રભુની ધર્મદિશના

ઈન્દ્ર પ્રાર્થના કરી...ત્યાં તો, ચંદ્રમાંથી શીતોળ-અમૃત જરે તેમાં ચંદ્રતીર્થકરના સર્વરીથી અત્યંત મધુર દિવ્યવાણી છૂટી....વીતરાગી અમૃત જરવા લાગ્યું....અંધી સભા આનંદમય વાતાવરણમાં સ્તબ્ધ હતી. ને પ્રભુની સામે જ જોઈને દિવ્યધ્વનિ સાંભળવામાં મુગંધ બની હતી. ચારે દિશામાંથી પ્રભુના સાક્ષાત દર્શન થઈ, શેકતા હતા; ચારે બાજુ બેઠેલા સભાજનોને એમ લાગતું હતું કે ભગવાન અમારી જ સન્મુખ બિરાજમણનું છે....અમારી ભાષામાં અમને, જ ઉપદેશ આપી રહ્યા છે. ભગવાને ઉપદેશમાં જીવાદિતાત્મોનું સ્વરૂપ બંતાવ્યું તેમાં શુદ્ધ-ચૈતન્યનો અપાર નિજવૈભવ દેખાડીને તેનો અનુભૂવ કરવાનું કહ્યું.

૧. ‘સત્તુ’ જગતમાં જીવ ને અજીવ એમ બે પ્રકારનાં તાત્ત્વો છે.


૨. તે દરેક પોત્પોતાના ઉત્પાદ-વ્યાપ-ધ્રુવત્વ સહિત છે.

૩. તેમાં ‘જી’ ચૈતન્યસ્વરૂપ છે તે જીવ છે.

૪. જીવો અનંતાનંત છે; તેમાં અનંત જીવો મુક્ત છે, ને તેનાથી અનંતગુણા જીવો સંસારી છે.
૫. દરેક જીવ પોતાના શુદ્ધ કે અશુદ્ધ ભાવનો કર્ત્તા-ભોક્તા છે.
૬. સંસારી જીવ મિથ્યાત્વ અને કષાયભાવોને લીધે હુંખી છે ને નરક-તિર્યં-મનુષ્ય તથા દેવ એવી ચારગતિમાં જન્મમરણ કરે છે.
૭. તેમાંથી જે જીવ જૈનમાર્ગ પામીને, શરીર અને કષાયથી બિન પોતાના આત્મસ્વરૂપને ઓળખે છે તે સમ્યક્તવાદિ ભાવો વડે મોક્ષનો સાધક થાય છે....ભેદજ્ઞાન વડે અંતરાત્મા થઈને તે જીવ સંસારથી છૂટવા માંડ્યો ને મોક્ષને સાધવા લાગ્યો.
૮. મોક્ષની સાધના સમ્યગ્દર્શન-જ્ઞાન-આરિત્રિપ વીતરાગભાવ વડે થાય છે: રાગ ભાવ મોક્ષનો સાધક નથી પણ બાધક છે.
૯. બંધ અને મોક્ષનાં કારણો સંક્ષેપમાં આ પ્રમાણે છે—

જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય-પ્રાપ્ત મુકાય છે;  
એ જિનતણો ઉપદેશ, તેથી ન રાય તું કર્મો વિષે.  
તેથી ન કરવો રાગ જરીયે, કચ્ચાય પણ મોક્ષચુંબુંબે;  
વીતરાગ થઈને એ રીતે તે ભાવ્ય ભવસાગર તરે.

૧૦. હે ભાવ્ય જીવો ! તમે ચૈતન્ય-ગાયત્રીમાને જાણો ને વીતરાગભાવને સેવો. વીતરાગતા તે ૪



સુખ છે, વીતરાગતા તે જ જૈનમાર્ગનો સાર છે, ને વીતરાગતા તે જ મોક્ષમાર્ગ છે.

શ્રી ચંદ્રપલુ તીર્થકરના ધર્મદરબારમાં સુંદર વીતરાગમાર્ગનો ઉપદેશ સાંભળીને, તત્કષ્ણ ત્યા જ અનેક જીવો સંસાર છોડીને મુનિ થયા; અનેક જીવો ધ્યાનમાં સમ્યગદર્શન પામ્યા; અનેક જીવો ભેદજ્ઞાન ઉપરાંત અવધિ-મન:પર્યયજ્ઞાન તથાં બાર અંગનું શાન ખીલી ઊઠ્યું. અદ્ભુત હતો એ ધર્મનો મેળો ! અહા, જે મેળામાં મોક્ષને સાધનારા લાખો-કરોડો ધર્મા જીવો ઉપરાંત દશ હજાર તો કેવળજ્ઞાની-અરિહ્ંત પરમાત્માઓ આકાશમાં બિરાજતા હતા તેની શોભાની શી વાત !! શ્રી ચંદ્રપલટેવ આઠમા તીર્થકર હતા; તેમના સમવત્તરણાંના શ્રીદાટાદિ ઈડ ગણધરો હતા; ૨૦૦૦ પૂર્વધારી-શ્રુતકેવળી હતા; ૮૦૦૦ અવધિજ્ઞાની હતા, ૮૦૦૦ મન:પર્યયજ્ઞાની હતા; વિક્રિયાલભિદ્વ વગેરે અનેક ઋષિધારક હજારો—લાખો મુનિવરો હતા. ત્રણ લાખ અંસી હજાર આર્થિકાઓ હતા; ત્રણ લાખ ધર્મત્તમા શ્રાવકો ને પાંચ લાખ શ્રાવકાઓ હતાં.—આ ઉપરાંત સમ્યગદર્શિ દેવો અને તિર્યંચો તો જુદા....આવા મહાન ચતુર્વિધ સંઘની વચ્ચે શાસનનાયક તીર્થકરપલુ બિરાજમાન હતા. ચંદ્રપલુના શાસનમાં આવો મહાન ચતુર્વિધસંધ મોક્ષમાર્ગમાં આનંદપૂર્વક સિદ્ધ્યત્વા કરી રહો હતો. એક સાથે આટલો મહાન ધર્મવૈભવ દેખતાં જીવોનું ચિત્ત સહેજે ધર્મમાં લાગ્યો જતું હતું. સભામાં સર્વત્ર હર્ષ-આનંદ હતો, વેરવિરોધ કે ખેદનું કયાંય નામ-નિશાન ન હતું.

આવી ગૌરવપૂર્ણ ધર્મસભાની વચ્ચે તીર્થકર ચંદ્રપલુ દરરોજ ચાર વખત છ-છ ઘડી સુધી (એટલે દરરોજ લગંભગ દશ કલાક) પરમ છિતકારી ધર્મોપદેશ દેતા હતા. તીર્થકરપ્રકૃતિની નિર્જરાં માટે અને દેશોદેશના ભવ્યજીવોના ભાગ્યોદ્યે કરોડો—અબજો વર્ષો સુધી ભરતક્ષેત્રમાં ભગવાનનો શ્રાવિહાર થયો. અને, ઉત્પાદ-વ્યય-ધૌબ્યત્રપ સત્તતાત્વ તેમજ અનંત ધર્મસ્વત્રપ અનેકાન્ત-તત્ત્વ પ્રભુએ ઉપદેશ્યું: જે નિત્ય ટકીને પરિણમતો હોય એવો જીવ જ કર્મોને છેદીને. (—સંસારી-હુઃખી જ રહ્યા કરે) અને જો જીવ જો પર્યાયત્રપ પરિણમે નહિ તો તે મોક્ષને સાધી શકે નહિ; (સંસારી-હુઃખી જ રહ્યા કરે) અને જો જીવ નિત્ય ન રહે તોપણ તે મોક્ષ-સુખને પામી શકે નહિ; (—તેનો અભાવ થઈ જાય.) માટે ‘નિત્ય-પરિણમી’ એવા અનેકાન્તત્રપ સ્વભાવ માનવાથી જ મોક્ષની સિદ્ધિ છે. આવા અનેકાન્તત્રપ જિનશાસન પામીને અનેક જીવોએ એકાંતત્રપ મિથ્યામત છોડ્યો, તેઓ અનેકાન્તી-સમ્યગદર્શિ-જૈન બન્યા, ને નિજધાર્મના વૈભવને જાહીને, શાયકભાવના સુખના વેદન વડે મોક્ષસુખનો સ્વાદ લેવા લાગ્યા. પ્રભુના ઉપદેશથી ભરતક્ષેત્રમાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રત્રપ મોક્ષમાર્ગ-આનંદમાર્ગ, વિદેહક્ષેત્રની જેમ જ ધમધોકાર ચાલવા લાગ્યો. જ્ઞાન અને રાગાદિ કષાયોની બિમતા ભવ્યજીવો બરાબર સમજવા લાગ્યા.

‘જ્ઞાન’ને આત્મા સાથે એકતા છે; તે જ્ઞાન, કષાયોથી તેમજ કર્મથી વિરુદ્ધ સ્વભાવવાળું છે, તેથી જ્ઞાનરસના વેદન વડે કષાયોનો ન કર્મોનો ક્ષય થઈ જાય છે.

જીવના સમ્યગજ્ઞાનાદિ ભાવો જેમજેમ વધે છે તેમતેમ કષાયો શાંત થતા જાય છે ને સર્વથા કષાય વગર પણ જ્ઞાનમય જીવન વિવધમાન રહે છે; પરંતુ જ્ઞાન વગર જીવ કરી વિવધમાન રહેતો નથી.—આ રીતે જ્ઞાન તે જીવનું સ્વત્રપ છે ને કષાય તે જીવનું સ્વત્રપ નથી.

કષાયમાં શાંતિ નથી, જ્ઞાનમાં શાંતિ છે; કષાયમાં તો થાક છે, જ્ઞાનમાં થાક નથી. સિદ્ધભગવંતો કેવળજ્ઞાનરૂપે અનંતકળ સુધી પરિણમ્ય છતાં અને લોકાલોકને જાણતા હોવા છતાં તેમને કદી થાક લાગતો નથી, ઊલ્ટું પરમ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે,—જ્ઞાને: કોધાદિ કષાયમાં તો જીવ ક્ષણભરમાં થાકી જાય છે ને તેમાં હુંઅનો અનુભવ થાય છે.

—આવા સ્પષ્ટ બેદજ્ઞાન વડે કષાયથી ભિત્ર ઉપયોગસ્વરૂપ આત્માનો અનુભવ કરવો તે મુક્તિનો ઉપાય છે, તે જિનશાસનનું ફરમાન છે. જે અનંતા જીવો સ્ત્રીદ્વિષય છે તેઓ બધા આવા બેદજ્ઞાન વડે જ સિદ્ધ થયા છે. બેદજ્ઞાન વગર બીજું ગમે તેટલું કરે તોપણ કોઈ જીવ સિદ્ધિને પામી શકે નહિએ.—સમ્યક્તવ પણ પામી શકે નહિએ. —આ પ્રકારે બેદજ્ઞાનનો ઉપદેશ પ્રભુના શ્રીમુખેથી સાંભળીને અનેક જીવો મોક્ષમાર્ગમાં લાગ્યા....ગામેગામ ને ઘરેઘર બેદજ્ઞાનની ચર્ચા ચાલવા લાગ્યો.

ભગવાન ચંદ્રપ્રભ—તીર્થકરનો વિહાર અદ્ભુત હતો...આકાશમાં જ તેમનું ગમન હતું; તેમનાં ચરણોની નીચે દૈવી કમળો રચાતા; પગલાં ભર્યા વગર જ તેમનું ગમન હતું ને હોઠ હાલ્યા વગર જ તેમની દિવ્ય વાણી સર્વાંગેથી છૂટતી હતી. પ્રભુની દિવ્ય વાણીનો મધુર રણકાર ઉર-ઉર ગાઉ (એક સો જેટલા કિલોમીટર)ના ઘેરાવામાં સ્પષ્ટ સાંભળાતો હતો. ધર્મચક્ર અને દેવદુંહુભીના નાદ ચારેકોરથી લખ્યજીવોને મોક્ષસુખ લેવા માટે બોલાવતા હતા કે હે જીવો ! આવો....રે....આવો ! તમારે સંસાર—દુઃખોથી છૂટીને મોક્ષસુખ પામવું હોય તો અહીં આવો....આ પ્રભુનાં દર્શન કરો ને તેમની વાણી સાંભળીને આત્માના આનંદમય નિજવૈભવને પોતામાં નીખળો. બીજા કાયોને એકકોર મૂકી, પ્રમાદ છોડીને શીંગ અહીં આવો ને આ પ્રભુચરણને સેવો. ટેઝો, આ પ્રભુએ રત્નત્રય વડે આત્મતાત્વની અદ્ભુત સંપદાને સિદ્ધ કરી છે....અને જગતને પણ તે આત્મસંપદા દેખાડી રહ્યા છે. જે ભવ્યજીવ પ્રભુને ઓળખીને ભક્તિપૂર્વક પોતાના ચિત્તમાં ધારણ કરે છે તે પણ આત્મસિદ્ધિને પામીને પ્રભુના જેવો જ થઈ જાય છે. ભવદુઃખોથી ભરેલું આ ભવવન પણ પ્રભુના માર્ગમાં ચાલનારને તો નંદનવન બની જાય છે. પ્રભુ તો સર્વને જાણનારા છે પણ સર્વે જીવો પ્રભુને નથી જાણતા, કોઈક વીરલા જ સ્વાનુભવવડે પ્રભુના અતીન્દ્રિય સ્વરૂપે ઓળખે છે. પ્રભુ અરિહંતપદે કરોડો—અબજો વર્ષો સુધી દેહના સંયોગમાં રહ્યા છતાં તેમને કદી ખોરાક આવો પડતો નથી કે પાણી પીવું પડતું નથી. રોગ થતો નથી, આડો—પેશાબ તો પ્રભુને જન્મથી જ કદી ન હતો. જગતના ઉત્તમ પરમાણૂઓ સ્વયમેવ પ્રભુશરીરમાં પ્રવેશીને તેનું પોષણ કરતા હતા....એ રીતે પૂર્વના પુષ્યકર્મો આવી—આવીને પ્રભુની સેવા કરતા હતા. પ્રભુને શુભકર્મો છૂટવા માટે એટલા બધા ઉદ્યમાં આવતા હતા કે તેમના સંગે, કોઈ અશુભ કર્મ હોય તે પણ શુભરૂપ થઈ જતું હતું અને બધાય કર્મો તેમને નિર્જરી જ જતા હતા....તેમની બધી કિયાઓ કર્મના કષયનું જ કારણ હતી.

શ્રી પ્રભુના વિહારકણે સર્વત્ર સુકાળ હતો; ક્યાંય દુષ્કાળ કે રોગાદિ ન હતા; બધાય જીવોમાં વેર-વિરોધ શાંત થઈ જતા. હિંસક પશુઓ પણ શાંત અને અહિંસક થઈને એકબીજાના મિત્રપણે વર્તતા હતા. ગાયનું બચ્ચું સિંહણને પોતાની માતાની જેમ ધાવતું હતું અને ગાય સિંહના બચ્ચાને વાછરડાની જેમ ચાટતી હતી; કોઈને ભય ન હતો, ક્યાંય કૂરતા ન હતી. અહા ! તીર્થકરનો પરમ શાંત આત્મા જ્યાં વિચરતો હોય ત્યાં અશાંતિ કેવી ? પ્રભુની સમીપ આવતાં ઘણા કોથી જીવોને પોતાને આશ્વય થતું કે અરે, આવી શાંતિ અમારામાં ક્યાંથી આવી ! પછી તેઓ ઊડા વિચારથી અંતરૂપ થઈને કોથીથી ભિત્ર પોતાના શાંતસ્વભાવને દેખી લેતાં....ને તે શાંતિના અનુભવથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને સાધી લેતાં અહા ! 'ચંદ્ર'નો ઉદ્ય થતાં મોક્ષમાર્ગનો સમુદ્ર ઉલ્લસ્યો ને સમ્યક્તવાદિ રત્નો બહાર આવ્યા.

ઘણા ઘણા કરોડો—અબજો વર્ષો સુધી (—અઢી લાખ પૂર્વ એટલે ૧૭૬૪૦૦૦, ૦૦૦૦૦૦૦, ૦૦૦૦૦ આટલા વર્ષોસુધી) ધર્મચક્રપ્રવર્તન વડે દેશોદેશના કરોડો—અબજો જીવોનું કલ્યાણ કરીને, ભગવાન ચંદ્રપ્રભ તીર્થકર સમેદાચલ પહાડ પર પદ્ધાર્યા. ત્યાં એક માસ પ્રતિમાયોગમાં સ્થિર રહ્યા, વિહાર બંધ

થઈ ગયો, વાણી પણ બંધ થઈ ગઈ.....પછી 'જ્ઞાગણ સુદ સાતમ'ના હિવસે તે અરિહંતપ્રભુ યોગનો નિરોધ કરીને અયોગી દશાને પામ્યા, તેરમાથી ચૌદમા ગુણસ્થાને (મોક્ષમહેલના અંતિમ પગથિયે) આવ્યા....ને પછી તરત જ સિદ્ધપદ પામીને મુક્તિમહેલમાં પ્રવેશ કર્યો. ઈન્દ્રાદિક દેવોએ તેમના મોક્ષકલ્યાણકનો મહોત્સવ કર્યો. આ રીતે, આત્મસાધનાવડે આઠ કર્માનો અભાવ કરીને, આઠમા તીર્થકર આઠ ગુણો સહિત આટમી પૃથ્વીપર સિદ્ધાલયમાં બિરાજ રહ્યા છે. [બરાબર ચંદ્રપ્રભુના મોક્ષહિવસે, તેમની આ મોક્ષટૂંકની યાત્રા, સં. ૨૦૧૩માં પૂ. શ્રી કહાનગુરુએ હજારો ધ્યાનિકોના સંઘસહિત અતિ ઉલ્લાસ-ભક્તિપૂર્વક કરી હતી. તેનું આનંદકારી વર્ણન 'મંગલ તીર્થયાત્રા' પુસ્તકમાં વાંચો; તેમજ સોનગઢમાં તેની ફિલ્મમાં પણ જુઓ.]

ચંદ્રમલુ જિનરાજકી લલિત ટૂંક હૈ જેહ,  
મન-વચ-તાન કર પૂજહું શિખરસમેદ યજેહ.

આપણો જ્યારે સમેદશિખર-તીર્થની યાત્રા કરીએ છીએ ત્યારે, દૂર-દૂરની લલિત ટૂંક પર જઈને ચંદ્ર-ચરણને સ્પર્શતો સંસારનો થાક ઉત્તરી જાય છે. બરાબર એ ટૂંકની ઉપર સિદ્ધાલયમાં અત્યારે પણ બિરાજ રહેલા એ સિદ્ધપ્રભુ, ધ્યાન વડે આપણા અંતરમાં પદારીને કોઈ અપૂર્વ શાંતિનું વેદન આપે છે ને આપણનેય તે સિદ્ધલોકમાં તેરી જાય છે.

### સિદ્ધપદની સાધનામહિત તે સિદ્ધભગવંતોને નમસ્કાર હો.

[શ્રીગુણનંદી આચાર્યની શિષ્યપરંપરામાં વીરનંદી સ્વામીએ ચંદ્રપ્રભચરિત્ર રચ્યું છે,, તેમ જ વીરસેન તથા જિનસેન સ્વામીના શિષ્ય ગુણભદ્રસ્વામીએ ઉત્તર-પુરાણમાં ચંદ્રપ્રભચરિત્ર રચ્યું છે; તે પુરાણોને અનુસરીને આ ચંદ્રપ્રભ ચરિત્ર લખ્યું છે. તેમાં શારીરિક અલંકારો વગેરે શુંગારરસનું વર્ણન છોડીને, શાંતરસમય આધ્યાત્મિક અલંકારોસહિત આત્માર્થ-પોષક રચના કરી છે. તે ભવ્યજીવોને તીર્થકર પરમાત્મા પ્રત્યે ભક્તિં જગડો, ને તેમણે દેખાડેલા આત્મમહિમા વડે સમ્યગદશનાદિ મોક્ષમાગની પ્રાપ્તિ કરાવો. શ્રી વીર નિર્વિક્ષા સં. ૨૫૦૮ ભાદ્ર વદ ચોથે સોનગઢ પરમાગમ-મંદિરમાં આત્મસાધક ભ્ર. હરિલાલ કૈને, પરમોપકારી ગુરુ-કહાનની મંગલસ્મૃતિપૂર્વક આ રચના લખીને પૂર્ણ કરી. 'જૈન જ્યતું શાસનં.']

૧. પ્રથમ જેઓ શ્રીવર્મા રાજા હતા ને સમ્યક્તવ પામ્યા;
૨. પછી પ્રથમ સ્વર્ગમાં દેવ થયા;
૩. પછી અજિતસેન ચક્રવર્તી થયા, ને છ ખંડનું રાજ્ય છોડીને મુનિ થયા;
૪. પછી અચ્યુત સ્વર્ગમાં ઈન્દ્ર થયા;
૫. પછી રાજા-પદનાલ થયા ને મુનિ થઈને દશન-વિશુદ્ધ આપ્યા હે.
૬. પછી વેજયન્ત વિમાનમાં અહમિન્દ થયા; અને
૭. અંતિમ ભવનમાં ચંદ્રપુરીમાં ચંદ્રપ્રભ-તીર્થકર થઈને ભવ્યજીવોને મોક્ષમાગની બતાવ્યોને અંતે ભવનો અંત કરીને, સમેદશિખરથી સિદ્ધાલયમાં સીધાવીને ત્યાં સિદ્ધપણે બિરાજ રહ્યા છે,-તે ભગવંત ચંદ્રપ્રભદેવને મારા નમસ્કાર હો.

[ઈતિ શ્રી ચંદ્રપ્રભ-ચરિત્ર સમાપ્ત.]

\* \* \*